

ગાળુભાઈ-સરભાન-થિલી પ્રકાશનમાણસ પુસ્તક ૧૬.

દિવાસ્વમ.

(શિક્ષણના પ્રયોગની વાર્તા)



દ્વ. ગાળુભાઈ

દિનત-૧-૦-૦

ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય
[ગુજરાતી કોર્પિગાઇટ વિભાગ]

અનુક્રમાંક ૨૩૮-૨૬ કિમત

ગ્રંથનામ ૧૯૮૧૨-૮૧૩

વર્ગાંક ૪૫૪

ગિજુભાઈ-સંમાન-થલી પ્રકાશનમાળા, પુસ્તક ૧૫.

દિવાસ્વમ.

(શિક્ષણના પ્રયોગની વાતો)

લેખક :
સ્વ. ગિજુભાઈ

પ્રકાશક :
ગુજરાત બાલવિકાસ સંસ્થા
અમદાવાદ

સોલ એજન્ટ્સ :
દી મહાગુજરાત પણિલરીંગ, કે.પની લિ.
ફરોઝા મહેતા રોડ, કોટ, સુલાઈ

ફિલે—૦-૧૨-૦

પ્રકાશક :

વળુલાઈ હવે

મંત્રી, ગુજરાત ખાલવિકાસ સંસ્થા

જૂનું ટોણકનગર, અમદાવાદ

ગુજરાત લિધાપીઠ પ્રદ્યાનમ
 કામદાવાદ
 ગુજરાતી કોપીરાઇટ-સંગ્રહ
મદ્દ ૨૩૮૨૫

આવૃત્તિ-૨૭

પ્રન-૭૫૦

જાન્યુઆરી, ૧૯૪૩

મુદ્રક :

રખુણોડાઈ વહેરીભાઈ પટેલ

રા. પું. આર્યાપ્રકાશ પ્રેસ

આશ્રુંદ

નિવેદન

સ્વ. ગિજુભાઈ બધેકા શ્રીદક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન, આવનગરમાં
વીસ વર્ષની આજુવન સ્વયંસેવક તરીકેની સેવા પૂરી કરી નિવૃત્ત
થયા તે પ્રસંગે તેઓના વિદ્યાર્થીઓએ, પ્રશાસકોએ અને મિત્રોએ
અમદાવાદમાં એક સન્માનસમારંભ દરખારશી ગોપાળદાસ દેસાઈના
પ્રમુખપણા નીચે યોજ એક થેલી એમને અર્પણ કરેલી. તે
પ્રસંગે સ્વ. ગિજુભાઈએ આ થેલી 'બાલસન્માન વિદ્યાપીઠ' (Children's Academy)ના પ્રથમ ફણા તરીકે અર્પણ
કરવાની ઈચ્છા જણાવી હતી; પરંતુ ત્યાર બાદ તેઓએ
'ગુજરાત બાલવિકાસ સરસ્થા'ની યોજના તૈયાર કરી, અને તે
કામ નીચેની સમિતિ નીમાં તેમને સાંખ્યું:—

પ્રો. શ્રી. રામનારાયણ વિ. પાડક, પ્રમુખ, અમદાવાદ

„ શંકરભાઈ સોમાભાઈ પટેલ, વડોદરા

„ સોમાભાઈ કીશાભાઈ પટેલ, સુણાવ

„ નરેન્દ્ર ગિજુભાઈ બધેકા, આવનગર

„ છન્દુપ્રસાદ દેવશાંકર ભટ્ટ, અમદાવાદ

„ સોમાભાઈ લાવસાર, અમદાવાદ

„ લીલાવતી ખાંડવાળા, સુંબઈ

„ શંકરભાઈ રતિલાલ શાહ, નડિયાદ

„ વજુભાઈ દવે, અમદાવાદ

આ સમિતિ પોતાનું કામ થાડ કરે તે પહેલાં તેઓનું દુઃખ
અવસાન થયું. તે પછી તે થેલીના રકમ મેળવવા માટે કાયદા પ્રમાણેની
તજવીજ કરવામાં આવી. તે કામનો નિકાલ તા. ૪-૩-૧૯૪૨ના
રોજ થતાં થેલીનાં નાણું સમિતિને મળી ગયાં. બાદ થેલીનાં
નાણુંની બ્યવસ્થા કરવા માટે સમિતિની સભા તા. ૮-૩-૪૨ના
રોજ થઈ. તેમાં પ્રકાશન બાબતમાં નીચેનો ફરાવ થયો:—

પુસ્તકપ્રકાશનનું કાર્ય હાથ ધરવું. તેમાં પહેલાં શ્રી. ગિજુભાઈનાં શિક્ષણવિષયક અપ્રાપ્ય પુસ્તકો તથા તેઓનાં અગ્રગત બાલસાહિત્યનાં પુસ્તકો ગ્રગત કરવાં.

આ ઠરાવ થયા પછી ‘ગુજરાત બાળવિકાસ સંસ્થા’ને સ્વ. ગિજુભાઈનાં સુપુત્ર ભાઈ નરેન્દ્ર યોગ્ય શરતોથી ગિજુભાઈનાં બખેલાં પુસ્તકોનું પ્રકાશન કરવાની અનુઝૂળતા કરી આપી. તેથી આ પ્રવૃત્તિને આરંભ ‘દિવાસ્વાન’ની ખીલ આવૃત્તિના પ્રકાશનથી આજથી શરીર થાય છે. ઉપરના ઠરાવ મુજબ ખીલં પુસ્તકો ગ્રગત કરવાનું કામ અનુઝૂળતા પ્રમાણે ચાલુ રહેશે. અંતમાં સ્વ. ગિજુભાઈએ કલ્પેલું ‘બાલસન્માન વિદ્યાપીઠ’ નું સ્વેચ્છાબેનું આચું પડો એવી પ્રાર્થના કરીએ છીએ.

તા. ૩૧-૧૨-૪૨

અમદાવાદ

મંત્રીએ,
ગુજરાત બાળવિકાસ સંસ્થા



ખીલ આવૃત્તિની પ્રસ્તાવના

‘દિવાસ્વાન’ રણ્ણ થયાં વર્ષો થયાં. તે હવે સ્વાન નથી રહ્યું; સારા યે ગુજરાતના બાળશિક્ષણુને આ પુસ્તકે નવે અવતાર આપ્યો છે. આવતા રાષ્ટ્રીય પુનર્જનાના કાર્યમાં ‘દિવાસ્વાન’ નવો રાજમાર્ગ દર્શાવતું તેજ પાથરશે એવી માન્યતા હોવાથી તેને કુરીથી પ્રસિદ્ધ કર્યું છે. ગુજરાત આ પ્રયાસને આદ્ય આપશે એવી આશા અસ્થાને છે?



એ પોલ

મને ડેઈંગે કહું કે ભારેખમ તાત્ત્વિક દેખોને બહલે વાતીંસ
શૈલીમાં શિક્ષણના વિચારોને લખો તો!

મને પ્રયત્ન કરવાની પ્રેરણ મળી અને કુળ રૂપે આ
'દિવાસ્વાન' આવ્યું.

દિવાસ્વાનેનું મૂળ વાસ્તવિક અનુભવ હોય તો તે મિથ્યા
નથી જતાં. આ દિવાસ્વાન મારા જીવંત અનુભવોમાંથી ઓપન્યું
છે, અને મારી આતરી છે કે પ્રાણ્યવાન કિયાપ્રધાન કલ્પક શિક્ષકોએ
પોતાને માટે પણ તે વાસ્તવિક કરી શકો.

મને આવાં દિવાસ્વાનો અહું આવી ગયેલાં છે. ને શિક્ષકને
તેમાં વિહરવાની, અને તેમાંથી વાસ્તવિક જગત રચવાની મજા
આવશે તો હું તેમને તે આપવાની મારી ફરજ સમજુશ.

હાલ તો આટલેથી બસ.

માર્ચ, ૧૯૩૧

ગિજુભાઈ

પ્રવેશક

જરાક કલ્પના હોય, યોડીંગે વિચાર કરવાની શક્તિ હોય
અને અદ્યતન સાહિત્યનો સારો એવો પરિચય હોય તેવા માલ્યાસ
માટે કેળવણીકાર બનવું સહેલું છે. ગિજુભાઈ કેળવણીકાર તરફિ
નાણીતા છે. દક્ષિણાર્થીર્થિતની સંસ્થામાં કામ કરતાં કરતાં કેળવણીના
ક્ષેત્રમાં નવા વિચારોને નવી રીતે તેમણે મુક્યા કર્યા છે. ગુજરાત
આપું એમને કેળવણીકાર તરાક તો એણખતું થયું જ છે.

કેળવણીના વિચારોને મૂર્ત્ત સ્વરૂપ આપવું, શિક્ષણની અનેકવિધ
પદ્ધતિઓની યોજનાઓ કરી કેળવણીના સિદ્ધાંતોનો તેવી પદ્ધતિઓ
દ્વારા સાક્ષાત્કાર કરવો કરવંબા, અને પોતાના જતદાર્થાંતરી તેના
અમલ તરફ શિક્ષણના ધંધામાં પડેલાઓને વાળવા તે કામ શિક્ષણ-
શાસ્ત્રીનું છે. કેળવણીકાર આવો શિક્ષણશાસ્ત્રી ન બને તાં સુધી
કેળવણીના તેના વિચારો માત્ર વિચારો જ રહે છે. ગિજુભાઈ આવા

(૨)

એક શિક્ષણશાસ્ત્રી પણ છે. ગુજરાતે તેમને એક સદ્ગ્રં શિક્ષણશાસ્ત્રી તરીકે જાણ્યા છે, પણ હજુ પિળાન્યા નથી. તેમની પાસે આવીને માન્ટેસોરી પદ્ધતિનાં તત્ત્વ અને વ્યવહારનું શિક્ષણ લઈ જનારાં ગુજરાત-કાડિયાવાડના શિક્ષક ભાઈઓનો સિવાય બીજાન થોડાક જ લોકને તેમનો એક સરસ શિક્ષણશાસ્ત્રી તરીકેનો પરિચય છે. તેમણે શિક્ષણશાસ્ત્ર ઉપર લખ્યું છે; પણ તેમના લખાણના પ્રાથમિક શિક્ષણના પ્રદેશ પૂરતો નિયોઝ આપવાનો નો કોઈ રસિક અને સુંદર પ્રયત્ન આજ દિવસ સુધી થયો હોય તો તે તેમનું આ ‘દિવાસ્વર્પન’ છે.

આ પુસ્તકનું નામ ગિન્જુભાઈએ ‘દિવાસ્વર્પન’ રાખ્યું છે. એ નામનો અર્થ તો એટલો હું કે આ પુસ્તકમાં જે જે વસ્તુઓનો નિર્દેશ કરવામાં આવ્યો હું તે બધું ય આજના પ્રાથમિક શાળાના શિક્ષકનું દિવાસ્વર્પન અને. ગિન્જુભાઈને મારે એ દિવાસ્વર્પન નથી રહ્યું. તેમણે કોઈ પ્રાથમિક શાળા ચલાતી ન હોય પરંતુ આલશિક્ષણની બાબતમાં શિક્ષણપદ્ધતિના જે અટલ નિયમોનો અમલ તેઓ આજે પોતાના આલમદિરમાં કરી રહ્યા છે તે નિયમોને પ્રાથમિક શાળામાં બંધ રેસતા કેમ કરી શકાય એ સંબંધેનો પોતાના વ્યવહાર વિચાર તેમણે આ પુસ્તકમાં રજૂ કર્યો છે. ગુજરાત-કાડિયાવાડના પ્રાથમિક શાળાના શિક્ષકો આ દિવાસ્વર્પનને પોતાનું અનાવે તો સ્વર્પનનો સાક્ષાત્કાર કરવાની જંખના તેમના અંતરમાં ખરી થાય તેવું એ મીઠું ને મધુર દિવાસ્વર્પન છે.

આજની પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષણ અપાય છે તે શિક્ષણની પદ્ધતિઓ બાળકોને તુકસાન કરનારી છે. આજના શિક્ષણનું માય પરીક્ષાઓ, ધનામ અને હરીફાઈથા કાઢવામાં આવે છે. આજનાં શિક્ષણનાં પરિણામો વેરઝેર, મારામારી, અસાંતિ અને અન્યવસ્થામાં આવે છે. એ બધાનો અસાંત મનોહર ચિત્તાર આ વાર્તામાં આપણું ભલે છે. પરંતુ લેખક એ આખતાનો કરુણ ચિત્તાર

(૩)

આપીને જ નથ્ય એસી રહેતા. આવશિક્ષણમાં આજે પ્રવર્તી રહેલી એ કસુણતાનો ઉકેલ એટલો જ સરસ અને મનોહર રીતે તેમણે રજૂ કર્યો છે. એ ઉકેલ લાવવા માટે શિક્ષકનામાં જે 'હૈયાઉક્લાસ'ની જરૂર છે તે હૈયાઉક્લાસ ડેવિલ્લો હોય તેનો આભાદ ચિત્તાર આ પુસ્તકમાં આપણું જેવા મળે છે. પ્રાથમિક શાળામાં જે ગંધી, જે ધોંધાટ અને જે અવ્યવસ્થા આપણું નજરે આવે છે તે અધું હૈયાઉક્લાસના શિક્ષકની જાહૂનું લાડડી અડતાં આપોઆપ જ જણે કે બીજી જાય છે ન તેને સ્થાને સ્વચ્છતા, વ્યવસ્થા અને શાંતિ ગિજુભાઈના વર્ગમાં આવીને ગોહવાઈ જતાં આપણું હેખાય છે. શિક્ષકને પોતાના કામમાં શી શી અડયણો આવવાની છે તેનો આખેહૂઅ ખ્યાલ પુસ્તક લખતી વખતે લેખકની નજર. આગળ રહેલો હેખાય છે. આજનો સમાજ ડેવળ ઇન્ડિયુસ્ટ્રીસ છે. નાના એવા ફેરફારોને પણ અયની નજરથી જુઓ છે. પોતાનાં બાળકોની ડેળવણી માટે માયાપો અક્ષમ્ય એદરકારી સેવે છે. શિક્ષકાને હેડમાસ્ટર, ઉપરી અને ઉપરીના યે ઉપરીનો ડર બંધમાં પણ રહ્યા કરે છે; અભ્યાસક્રમ અને પરીક્ષાની બેરીઓમાંથી શિક્ષક કે બાળકો જરા પણ ચસકી શકતાં નથી. આ બંધી વસ્તુઓ લેખક અરાખર સમજે છે, અને તેથી જ ધીરજ અને શાંતિપૂર્વકના પોતાના અવિરત કાર્યઅળથી એ સુશેલીઓને ગોળાંગી જવાનું માર્ગદર્શિન સચોટ રીતે આપણું તે કરાની શક્યા છે.

આખા પુસ્તકમાં એક ખૂલ્લામાં ભરાઈ રહેલો એક અલંત મહત્વનો વિચાર આ પુસ્તક વાંચનારાઓ પાસે રજૂ કરવો એ મને મિત્રધર્મ હેખાય છે. આપણી ગમે તેટલી સુંદર આશાઓ હોવા છતાં પ્રાથમિક શાળાના ખુદ શિક્ષકમાં જ્યાં સુધી સુધી સ્વભાવકરે કરી નાખવામાં આવે નહિ લાં સુધી આપણા અભતરાઓ ને પ્રયોગો કરવાનું સાચું સામર્થ્ય સાંપડવાનું નથી. ગિજુભાઈના હુદયને આ બાત બરાખર ડંખતી હેખાય છે. એટલે જ શિક્ષકનામાં તેના

સ્વભાવની કાંતિ કરવાના મુદ્દાને ખૂબ ડેમળતાથી રજૂ કરવાની તેમણે કાળજી રાખી છે. આપણો આજનો પ્રાથમિક શાળાનો શિક્ષક અગ્રાન છે, બાદૂતી છે, પૈસાનો લોચી છે, જાતમાં અવિશ્વાસ રાખ્યારા છે. શિક્ષકની આ નખળી બાજુ ગિજુભાઈ પોતે હમદર્દીથી પિછાને છે, અને શિક્ષકના માનસિક રોગમાં પોતે પણ હું અનુભવે છે. એ દાખિયે તેમણે એ આખા મુદ્દાને આ પુસ્તકમાં રજૂ કર્યો છે. એ મુદ્દો વાંચ્યા પછી શિક્ષક પોતાની નિર્ભળતાએથી મુંજાવાનો છે, શરમાવાનો છે, પોતાનામાં તેવું બળ જમાવવાની મહત્વાકાંક્ષાએ જીબી કરવાનો છે, કે જે બળ વડે ગિજુભાઈના દિવાસ્વાનો સાક્ષાત્કાર કરતો શિક્ષક પોતે બની શકે.

આખું પુસ્તક ગઈ કાલની પ્રાથમિક ડેળવણીની નાનકડી સમાલોચના જેવું, તેમ જ આવતી કાલની નવીન પ્રાથમિક શાળાના મનોધર અને સ્પષ્ટ દર્શન જેવું છે. વાર્તાની શૈલીમાં લખવામાં આવું છે એ એની વિશિષ્ટતા છે. ગિજુભાઈ મારા બહુ જ નળુકના મિત્ર છે; તેમનાં લખાણો ઉપર હું હંમેશાં શકરા જેવી દાખિ રાખવાનો છું, અને તેમનાં લખાણાથી સોએ સો ટકા મુગ્ધ થાડું તેવું ભાગ્યે જ બન્યું છે. આમ છતાં ગિજુભાઈના આ પુસ્તકે મને ખરેખર મુગ્ધ બનાવ્યો છે. ડેળવણીના તાત્ત્વિક લેખા અથવા તો શિક્ષણશાસ્ત્રીનાં શાસ્ત્રીય પુસ્તકોને અદ્દલે ગિજુભાઈ આવાં જ લખાણો આવી જ શૈલીમાં આપણું હવે પછી આપતા રહે તેવું સ્નેહનું દાખ્ય હું હંમેશાં તેમના ઉપર કરવાનો.

હરભાઈ ન્રિવેદી



પ્રથમ અંડ

પ્રયોગની શરૂઆત

: ૧ :

મેં વાંચ્યુંવિચારું તો ધણું હતું પરંતુ મને અનુભવ ન હતો.
 મને થણું કે મારે જનતાનુભવ લેવો જોઈએ: લારેજ મારા
 વિચારો પાકા થશો, લારેજ મારી અલ્યારની કહેપનામાં ડેટલું સત્ય
 છે અને ડેટલું પોલાણું છે તે સમજશો.

હું ડેટલથીના વડા પાસે ગયો ને મને પ્રાથમિક શાળાનો
 એક વર્ગ સોંપવાની ભાગથી કરી.

ઉપરી સાહેબ જરા હસ્યા ને કહ્યું: “રહેવા દો તો? એ
 કામ તમારાથી નહિ અને. છોકરાને ભર્યાવનાં અને તેમાંથી પ્રાથ-
 મિક શાળાનાં છોકરાને, એમાં તો નેવાનાં પાણીને મોલે ચડાવવાં

પડે છે. વળી તમે તો લેખક અને વિચારક રહ્યા. ટે'લખ પર એસી લેખો લખવાનું સહેલું છે, કલ્પનામાં ભણુવી હેતું પણ સહેલું છે; અધ્યાત્માનું છે માત્ર ગ્રલ્યક્ષ કામ કરવું અને તે પાર ઉતારવું.”

મેં કહ્યું: “એટેઝ તો મારે જાતઅનુભવ કરવો છે. મારી કલ્પનામાં મારે વાસ્તવિકતા આજુની છે.”

ઉપરી સાહેબે કહ્યું: “અલે સારે. તમારો આગ્રહ હોય તો એક વર્ષ સુખેથી અનુભવ લો. ગ્રાંથમિક શાલાનું ચોથું વર્ષ હું તમને સોંપું છું. આ તેનો અભ્યાસક્રમ છે; આ રહ્યાં તેમાં ચાકતાં પાઠ્ય-પુરુષ્ટકો; અને આ રહ્યા રજા વગેરેના ખાતાના ડેટલાએક નિયમો.”

મેં આદરથી એ બધાં તરફ નજર નાખી. અભ્યાસક્રમ હાથમાં લઈ બિસ્સામાં મૂક્યો ને પાઠ્યપુરુષ્ટકોને એક દોરીથી બાંધવા લાગ્યો.

સાહેબે કહ્યું: “જુઓ, તમને ગમે તે અખતરા કરવાની છૂટ તો છેજ; એ માટે તો તમે આચ્યા છો. પરંતુ એટસું પણ ધ્યાનમાં રાખજો કે બાર માસે પરીક્ષા આવીને તેલી રહેણે ને તમારું કામ પરીક્ષાના માપે મપાશે.”

મેં કહ્યું: “ગો કખૂલ છે; પણ મારી એક ભાગણી છે કે પરીક્ષક સાહેબ આપ પોલે જ થશે. આપે પોતે જ મારા કામનો ક્ષયસ કરવો પડશે. આપ નો અખતરા કરવાની છૂટ આપો છો તો આપને જ મારું કામ ભત્તાવી સંતોષ ખાભીશ. આપજ મારી સફળતાનિષ્ઠળતાનાં ફારણો સમજ શકશો.

ઉપરી સાહેબે હસીને હા કલી ને હું ઓફિસમાંથી અછાર નીકળ્યો.

: ૨ :

અભ્યાસક્રમ આપો નેર્ધ ગયો હતો. ડેટલાએ ફેરફારો કરી શકાશે એમ ખાતરીપૂર્વક લાગ્યું. પાઠ્યપુરુષ્ટકો પર નજર નાખી ગયો. શુદ્ધદાષ્ટ આંખ આગળ તરી આવ્યા. ડેવા સુધારા થઈ શકે તે

વિચારી લીધું: પહેલે દિવસથી તે છેલ્ખા દિવસ સુધીના કામનો મનમાં જણે કે આશેખ થઈ ગયો. પરીક્ષા અને તેના પરિણામના દિવસો પણ જોઈ લીધા. અંતે વર્ગ આપું આવી રીતે ચાલસે, આવું કામ અશે ને આવું પરિણામ આવશે તેના દોડા ઘડાઈ ગયા. વિચારોમાં ને વિચારોમાં રાતના એ ક્યારે વાગ્યા તેની ખખર પણ ન પડી! છેવટે આવતી કાલે શું કરવું તેની નોંધ કાગળ પર ટપકાની નાખુંને ટકારે સૂતો.

સવાર પડ્યું. જિત્સાહ હતો; અંદ્રા હતી; વેગ હતો. નાહીં-ધોઈ અદ્યપાહાર કરી વખતસર ત્રીજી નંબરની શાળાએ જઈ પહોંચ્યો. હજુ શાળા જીવઠી ન હતી. અમારા હેડમાસ્ટર આવ્યા ન હતા. પટાવાળા તેમને લાં ચાની લેવા ગયો હતો. છોકરાઓ આવતાજતા હતા અને સડક પર દોડાહોડ કરતા હતા.

મને થતું હતું કે “ક્યારે શાળા જીવઠે ને ક્યારે વર્ગ હાથમાં લઈ ને કામ કરવા માંડું? ક્યારે મારી નવી યોજના રજૂ કરું? ક્યારે બ્યન્સથા ને શાંતિ દાખલ કરું? ક્યારે રસિક રીતે પાડ સમજવું? ક્યારે છોકરાઓનાં મન હરી લઈ? ” મારા મગજમાં લોહી ધણું ઝડપથી વહેઠું હશે.

ધંટ થયો. છોકરાઓ વર્ગમાં ગોડવાયા ને હેડમાસ્ટર મારી સાથે આવી મને મારી વર્ગ બતાવ્યો, અને છોકરાઓને કહ્યું: “નુયો, આ લક્ષ્મીરામભાઈ આજથી નમારા માસ્ટર છે. તે કહે તેમ કરને. તેમની આજા માનને. જેણે, હોઈ તોફાન ન કરતા.”

હેડમાસ્ટર કહેના હતા તે વખતે હું મારા બાર માસના સાથીઓ સામે જોઈ રહ્યો હતો. ડોઈએ મોં મનહાયાં; ડોઈએ બાડી આંખ કરી ભીંયકારો કથો; ડોઈએ અકડાઈથી ઊકાં હજાબાં; ડોઈ મારી સામે આશ્ર્ય અને મરકરીથી જોઈ રહ્યા; ડોઈ વગર જગત્યે જિલ્લા જ હતા.

મેં જોઈ લીધું: “આ છોકરાઓને મારે ભણુવવા છે! આ મસ્કરા, તોઝાની, અસ્કડ અને ચિત્રવિચિત્ર!” મન જરા શેહ તો ખાઈ ગયું, જરા છાતી થડકી ગઈ; પણ થયું કે “ફિકર નહિ, ધીમે ધીમે જોયું જરો.”

રાત્રે કરેલી નોંધ પીસામાંથી કાઢીને જોઈ લીધી. બજેટું હતું: પ્રથમ શાંતિની રમત; પછી વર્ગની સ્વચ્છતાની તપાસ; પછી સહગાન; પછી વાર્તાલાપ; વગેરે.

મેં છોકરાઓને કહ્યું: “ચાલો, આપણે શાંતિની રમત રમીએ. જુઓ, હું ‘અં શાંતિઃ’ કહું લારે સૌ ચૂપચાપ એસી જનો. પલાંડી બગાબર વાળનો. જોણે, ડાઈ હલરોચલરો. પણ નહિ. પછી હું આરણાં બંધ કરીશ એટલે અંધારું થશે. સૌ શાંત હોસે એટલે આસપાસના દોંધાડો સંભળાશે. એ સાંભળવાની ગમત આવશે. માખીઓનો બાણુભણુટ સંભળાશે. તમારો શાસોર્ઝ્ઝાસ પણ સંભળાશે. પછી હું ગાઈશ અને તમે સંભળનો.”

હું આ બધું ઓદી ગયો ને શાંતિની રમત આદી. ‘અં શાંતિઃ’ એલો પણ છોકરાઓ તો ધક્કાધકી ને વાતો કરતા હતા. એપાંચ વાર એલ્યો. પણ જણે હવામાં જય છે! હું મનમાં મૂંજાયો. “ચૂપ! ગડાડ નહિ!” એમ તો કાંઈ થોડુંકે ફેલ્યાય? થપાટ મારીને ડરાવાય પણ કેમ? પણ હું આગળ ચાલ્યો ને બારીઓ. બંધ કરી. અંધારું થયું ને ધ્યાન (!) ચાલ્યું. છોકરાઓમાંથી ડાઈ ઉડી કરવા લાગ્યા, ડાઈ હાઉ હાઉ કરવા લાગ્યા, તો ડાઈ ધડધડ પગ પછાડવા લાગ્યા. એમાં એક જણે તાળી પાડી ને અવાએ તાળીએ પાડી. પછી ડાઈ હસ્યું ને હસાડસ ચાલી. હું ખસ્ઝિયાણો પડી ગયો; મેં ફિસું પડ્યું; બારીએ ઉધાડી નાંખાની ને જરૂર વાર એરડાની બહાર જઈ પણે આવ્યો. વર્ગ આંદ્રા ઊલટો મસ્તીમાં આવ્યો હતો; છોકરાએ એકઅભીજતની.

સામે 'હજ શાંતિ' કરતા હતા. કોઈ બિલા થઈને ચોતેજ બારીઓ
નોંધ કરતા હતા.

મને થયું: "આ મારી નોંધ એઠી પડી. ધરમાં એડાં એડાં
નોંધ કરી કલ્પનામાં ભણ્ણાવી હેવું સહેલું હતું; પણ આ તો લોદાના
ચણ્ણા ચાવવા જેવું છે. આ અત્યાર સુધી ધોંઘાટ ને ધમાધમીમાં
ઉછરેલા છોકરાએ આગળ શાંતિની રમત એટલે હમણું તો
ભેંશ આગળ ભાગવત જેવું થયું. પણ ફિકર નહિ. ચૂક્યા ત્યાંથી
કુરીને. સારુંજ થયું કે પહેલેજ ગ્રાસે મક્ષિકા આવી. કાલથી નવા
ગણેશ માંડીયું."

હું વર્ષમાં આવ્યો ને છોકરાએને કહ્યું: "ભાઈએ, આજે
હવે વધારે કામ નહિ કરીએ. કાલથી આપણે આપણું કામ શરૂ
કરીયું. આજે તમને રજા."

'રજ' શબ્દ સાંલળતાં છોકરાએ હોડો કરતા વર્ગ અહાર
ગયા ને આખી નિશાળ અગલળી ગઈ. 'રજ', 'રજ', 'રજ'
વાતાવરણમાં ગાળ રહ્યું! છોકરાએ ઝૂદ્ધા, ઉછળતા, ઉલળતા ધર
અણી ભાગવા લાગ્યા.

બીજા ક્ષક્ષેપા અને નિશાળિયાએ જોઈ રહ્યા: "આ શું છે?"
હેડમાસ્તર એકદમ મારી પાસે આવ્યા ને જરા ભવાં ચડાવી કહ્યું:
"રજ કેમ પાડી? હજ એ કલાકની વાર છે."

મેં કહ્યું: "આજે છોકરાએ અભિમુખ ન હતા. આજે તેઓ
અવ્યવસ્થિત હતા. શાંતિની રમતમાં મેં તે જેયું હતું."

હેડમાસ્તરે કડકાઈથી કહ્યું: "પણ એમ તમે વગર પૂછ્યે રજ
ન આપી શકો. વળી એક વર્ગના છોકરાએ ધેર જાય એટલે
બીજાએ કેમ ભણ્ણે? તમારા આવા પ્રયોગે નહિ ચાલે."

તેમણે જરા રોક કરી ફરી કહ્યું: "એ તમારી અભિમુખતા-
કબિમુખતાને જવા હો; અને શાંતિની રમત તો ચાલે મોનેસોરી

શાળામાં. અહો પ્રાથમિક શાળામાં તો ફડ કરતો તમાચો લગાવો એટલે સૌ ચૂપાચૂપ ! ને પછી રીતસર સૌ ભણુવે છે એમ ભણુવેનો તો બાર માસે પરિણામ દેખાશે. આ એક દિવસ તો ગયો ને જીલટા બન્યા ! ”

મને ભારા હેડમાસ્ટરની દ્વારા આવી. મેં કહ્યું : “ સાહેબ, તમાચા મારી ભણુવવાનું તો ખીજ સૌ કરી જ રહ્યા છે. અને તેતું ફળ તો હું ભાગું છું કે છોકરાઓ ડેટલા અસભ્ય, જંગલી, અભિંત અને અભ્યવસ્થિત છે. હું તો જોઈ શક્યો કે આ ચાર વર્ષની ડેળવણીમાં છોકરાઓએ જણે કે આટહું જ લીધું : હોઢો, હૃદ ને તાણી પાડની ! એમને નિશાળ તો ગમતી જ નથી. રજાનું નામ પડયું એટલે તો બાળી બાળીને ભાગ્યા ! ”

હેડમાસ્ટર કહે : “ ત્યારે હવે તમે શું કરો છો તે જોઈશું : ”

હું ધીરે પગે અને મોળે હૈયે ધેર ગયો. વિચાર કરતો પડ્યો : “ માગું, કામ તો આડકું છે ! પણ આડકું છે તેથી તો મારી ખરી કસેારી થશે. હરકત નહિ. આપણે હારતું નથી. એમ કંઈ ‘જાતિની રમત’ તે થતી હશે ? મોનેસોારી પદ્ધતિમાં એ માટે ડેટલી પૂર્વતાલીમ હોય છે ? હું પણ થોડોએક ખરખ તો ખરા કે પહેલે જ દિવસે એ કામ ઉપાડયું ! પ્રથમ મારે એમનો કંઈક પરિયય સાધવો જોઈએ. કંઈક મારે માટે, તેમને રસ ને પ્રેમ ઉપજવાં જોઈએ. પછી તેવો મારું કહેતું કંઈક સાંબળો ને કરે. જ્યાં આ છોકરાઓને નિશાળ નહિ પણ રજા ગમે છે સાં કામ કરતું એટલે તો ભગીરથે ગંગા આખું ! ”

ખીજ દિવસના કામના વિચારો જોઈયા ને સુતો. રાત્રી તો દિવસના કામમાં અને આવતી કાલના કામનાં સ્વપ્નોમાં જ ચાલી ગઈ.

: ૩ :

શાળા જિધડી ને હું ગયો. છોકરાઓ મારી કરતા ક્રી વણ્ણા ને મસ્કરીમાં ઉડાવતા હેઠ તેમ ગમ્મતમાં પણ ડ્ર્યા વિના કહેવા લાગ્યા: “માસ્તર સાહેઅ, આજે પણ રજ આપો ને? આજે પણ રજ, રજ, રજ !”

મેં કહ્યું: “ડીક ત્યારે, આજે પણ રજ તો આપીયું; પણ આમા દ્વિસની નહિ, એ કલાકની. પણ બિલા રહો, હું તમને એક વાર્તા કહું છું તે સાંભળો. પછી આપણે બીજી વાતો કરીયું.”

મેં તુરત જ વાર્તા ઉપાડી.

‘એક હતો રાજ, અને એને સાત રાણીઓ. સાતેને સાત કુંવર ને સાતેને સાત દીકરીઓ.’

ગડાડ ગડાડ ને હલ્લાહલ્લી કરતા સૌ છોકરાઓ મારી આસપાસ એસી ગયા. હું વાર્તામાં જરા અટક્યો ને કહ્યું: “જુઓ, સૌ સરખા એસો. આમ તો ડીક ન પડે.”

ઘધા કંઈક કંઈક ડીક એસી ગયા, પણ કહેવા લાગ્યા: “પણ ઝ્ર વાર્તા કહો ને: ઝ્ર કહો. પછી શું થયું?”

મેં મેં મલકાની આગળ ચલાયું.

‘એ સાતે દીકરીઓને જાત સાત મહેલ ને મહેલે મહેલે સાત સાત મોતીનાં ઝાડ.’

છોકરાઓ તો કાઢી આંખે વાર્તા સાંભળવા લાગ્યા. આજો વર્ગ ચૂપચાપ હતો. કોઈ બોલે કે ચાલે. હેડમાસ્તરને થયું હશે કે આ વર્ગમાં આટલી બધી સાંતિ કેમ છે, એટલે તે વર્ગમાં આવ્યા. મને કહે: “કેમ, વાર્તા કહો છો કે?”

મેં કહ્યું: “હા જુ; વાર્તા અને આ નવી જતની શાંતિની રમત બન્ને કરું છું.”

હેડમાર્ટર પાછા પડી ચાલ્યા ગયા. વાર્તા ચાલતી હતી પણ આજુઆજુના વર્ગીમાંથી ખૂબ ધોંધાઈ આવતો હતો. મેં કહ્યું: “જુઓ, આસપાસ કેવી ગડઅડ થાય છે?” સૌ છોકરાઓએ ગડઅડ તરફ કંઠાળો ખતાવ્યો.

વાર્તા અરદે આવી એટલે મેં કહ્યું: “કહો જોઈએ, રજ જોઈતી હોય તો વાર્તા બંધ કરીએ; નહિતર તે ચાલુ રાખીએ.”

ખધા કહે: “ચાલુ ચાલુ. અમારે રજ નથી જોઈતી.”

મેં કહ્યું: “ઢીક ત્સરે, વાર્તા આગળ ચલાવીએ; પણ” મેં જોમેર્યું: “આપણે જરા વાતચીત કરી લઈએ. પછી ઘંટ વાગે ત્યાંસુધી વાર્તા ચલાવીએ.”

એક છોકરા કહે: “પણ વાતચીત કાલે કરને. જરૂર વાર્તા કહો ને, તે પૂરી થાય.”

મેં કહ્યું: “એ તો આર દિવસ ચાલે એટલી લાંખી છ.”

ખધા કહે: “ઓહો! એટલી બધી લાંખી! ભારે તો મજ પડશો!”

મેં ખીસામાંથી ડેટલોાગ કાઢ્યું ને નામ લખવા માંડ્યાં. સૌઓ વારાફરતી પોતાનાં નામ લખાવ્યાં, પટ પટ ને ઝર ઝર. પછી મેં હાજરી પૂરી લિધી ને કહ્યું: “જુઓ, ક્ષેત્રી આપણે વાર્તા શરૂ કરતાં પહેલાં હાજરી પૂરીશું ને પછી વાર્તા.” આટલું કહી મેં વાર્તા ચાલુ કરી તે ડેડ ઘંટ વાગ્યો લાં સુધી.

સમય પૂરો થયો પણ છોકરાઓ કહે: “ના, હજ એસે ને વાર્તા કહો.”

મેં કહ્યું: “અસ લાઈએ, હવે કાલે.” વળી પૂછ્યું: “કાલે રજ કે વાર્તા?” ખધા કહે: “વાર્તા, વાર્તા, વાર્તા!” એમ કહી સૌ ચાલ્યા ગયા.

ગર્છ કાલના ‘રજા, રજા, રજા’ શબ્દોને ખદલે આજે ‘વાર્તા,
વાર્તા, વાર્તા’ શબ્દો વાતાવરણમાં ગાળ રહ્યા.

મને થયું: “હાશ, આજનો દિવસ તો સુધ્યો! વાર્તા એક
અદ્ભુત જાહુ છે તે વાત સાચી: એક સો ને એક ટકા સાચી!”

: ૪ :

ખીજે દિવસે સવારે સૌ છોકરાએ મેં મલકાવતા મલકાવતા,
હું વર્ગમાં આવ્યો કે તુરતજ ઉપરાણાપરી પડતા પડતા મને વીઠી
વખ્યા અને એલાયા: “ચાલો માસ્તર સાહેબ, હવે વાર્તા કહો.”

મેં કહ્યું: “પહેલાં હાજરી, પછી થોડીએક વાતચીત ને
પછી આપણી વાર્તા.”

ખીસામાંથી ચાકનો કુકડો કાઈ વર્ગમાં વર્તુંણ આકાર કાઢ્યો
ને કહ્યું: “જુએ, આની ઉપર રોજ આવીને એસવું.” એસી
દેખાડી કહ્યું: “આવી રીતે. આ જગા મારી. અહીં એસી હું
વાર્તા કહીશ.”

બધા ગોડવાઈ ગયા. મેં જગા કીધી. હાજરી પૂરીને વાર્તા
શરૂ કરી. સૌ અભિમુખ હના. વાર્તા લલકારી. મંત્રમુગ્ધ પૂતળાં
જેમ સૌ સાંભળતા હતા. વચ્ચે વાર્તા અટકાવીને કહ્યું: “કેમ
તમને વાર્તા કેવી ગમે છે?”

“અમને વાર્તા બહુ ગમે છે.”

“તમને વાર્તા સાંભળવા ગમે છે તેમ વાંચવી પણ ગમે કે?”

“હા, અમને વાંચવી પણ ગમે. પણ એવી ચોપડીએ જ
ક્ષયાં છે?”

“પણ વાર્તાની ચોપડીએ હું તમને લાવી આપું તો વાંચો
કે નહિ?”

“વાંચીએ, વાંચીએ.”

એક ચતુર જણુ કહે: “પણ તમારે વાર્તા કહેવાની તો ખરીજ! અમારે એકલી વાંચવાની એવું નહિં.”

મેં કહ્યું: “ઠીકા?” પછી મેં વાર્તા આગળ ચલવી.

ધંટ વાગ્યો ને વાર્તા અટકી. બધા મારી ફરતા વીંટળાઈ વબ્બા. ડાઈ તો મારી સામે હેતથી જોઈ રહ્યા. ડાઈ મારા હાથે હળુ હળુ અડતા હતા. ડાઈ મનમાં મરસ્ત હતા.

મેં કહ્યું: “જામો, ભાગી જાઓ. શાળામાંથી ભાગો.”

છોકરાઓ કહે: “નહિં જર્ખાંઓ. વાર્તા કહો તો સાંજ સુધી એસીએ.”

છોકરાઓ ગયા ને શિક્ષકો મારી પાસે આવ્યા. તેઓ કહે: “ભાઈસા’બ, આ તો આરે કરી! અમારા વર્ગના છોકરાઓ પણ વાર્તા ભાગે છે. આજકાલ તેઓ ભજુવામાં ચિત્તજ રાખતા નથી. વરેખડાએ કહે છે કે અમારે તો વાર્તા સાંભળવા જવું છે; નહિતર તમે વાર્તા કહો.”

મેં કહ્યું: “થોડાએક કહેતા જામો તો?”

તેઓ કહે: “પણ એવું આવડે છે ડાને? એકય વાર્તા આવડતી હોય તો કું?”

હું મનમાં હસી રહ્યો.

: ૫ :

ખીને દિવસ રવિવારનો હતો. તે દિવસે હું ઉપરી સાહેખને મળવા ગયો.

ઉપરી સાહેખે કહ્યું: “હેડમાસ્તર કહેતા હતા કે તમે તો બહેલ વખત વાર્તા કહ્યા કરો છો.”

મેં કહ્યું: “છા સાહેખ, હમણાં તો વાર્તા ચાલે છે.”

સાહેબે પૂજ્યાઃ “પણ પછી પ્રયોગો ક્યારે કરશો? ને અમ્યાસ પૂરો કેમ થશે?”

મેં કહું: “પ્રયોગ તો સાહેબ ચાલુ જ રાખ્યો છે. વિદ્યાર્થીઓને અને શિક્ષકને પરસ્પર નજીક લાવવામાં વાર્તા કેટલી અદ્ભુત જાડુ-ભરી વસ્તુ છે તેનો હું જાતઅનુભવ કરી રહ્યો છું. પહેલે દિવસે જેએ મને સાંભળતા ન હતા ને જેએ મને હૃદાને હોલો કરી મૂંડ્યા રહ્યા હતા તેએ વાર્તા સાંભળવા મળી છે લારથી શાંત ઘન્યા છે. આરા તરફ પ્રેમથી જુદ્યો છે. મારું કહું માને છે. કહું છું તેમ બેસે છેને ‘ચૂપ રહો, ગડાયડ નહિ’ એમ તો કહેવું જ પડતું નથી! ને નિયાળમાંથી તો હાંક્યા પણ જતા નથી.”

ઉપરી સાહેબ કહે: “વારુ, એ તો જાણ્યું; પણ હવે નવી રીતે શીખવવાનું ક્યારે કરવાનું છે?”

મેં કહું: “કેમ સાહેબ, શીખવવાની આ નવી રીત છે ના! વાર્તા દારા આજે વ્યવસ્થા શીખવાઈ રહી છે; અભિભૂતતા કેળવાઈ રહી છે; ભાષાશુદ્ધિનો અને સાહિત્યનો પરિચય અપાઈ રહ્યો છે. કાલે વળી ખીનું પણ શીખવવાનું ચાલશે.”

ઉપરી સાહેબ કહે: “પણ જેણે, એમ વાર્તામાં વરસ વળું ન જાય!”

મેં કહું: “હા જી, હરકત નહિ.”

: ૬ :

વાર્તા માટે વર્ગના વિદ્યાર્થીઓ ગોબાકાર ગોઠવાઈને બેડા હતા.
મેં પાઠ્યા પર લખ્યા:

આજનું કામઃ—
હજરી
બાતચીત
વાર્તા

હાજરી લીધા પછી વાતચીત કાઢી. મેં કહ્યું: “ચાલો જોઈએ,
તમારા નખ કેટલા વધ્યા છે? બધા ભબા થઈને હાથ બતાવે.”

એકએક છોકરાના નખ વધ્યા હતા. નખમાં ખૂબ મેલ હતો.

મેં કહ્યું: “તમારી ટોપીએ હાથમાં લો ને જુઓ, કેટલી
મેળી અને ફાટલીદુટલી છે!”

સૌએ ટોપીએ તપાસી. કોઈકની જ ટોપી સારી હતી.

મેં કહ્યું: “જુઓ, તમારા કોટનાં જુતાનો પૂરતાં છે?”

બધાએ કોટ સામે જેયું. એમાર જણુનાં જ પૂરાં જુતાનો હતાં.

પછી મેં કહ્યું: “આજે હવે વધારે તપાસ નહિ. હવે વાર્તાનું
ઓઈ થાય છે.” આમ કહી વાર્તા શરૂ કરી.

વાર્તા વચ્ચે એક છોકરા કહે: “વાર્તાની ચોપડીઓનું શું થયું?”

મેં કહ્યું: “એકએ દિવસમાં લાવીશ. જેઓને વાર્તાની
ચોપડીએ વાંચ્યી ગમતી હોય તેઓ હાથ ઊચા કરો.”

એકએક વિદ્યાર્થીએ હાથ ઊચા કર્યો.

મેં પૂછ્યું: “તમે વાર્તાની જે જે ચોપડીએ વાંચી હોય
તેમનાં નામ ઓદો.” કોઈ એપાંચ જણુાએ એચાર વાર્તાએ
વાંચેલી. ચોથા ધોરણું સુધી પહોંચેલા પણ સૌએ પાડ્યપુરસ્તકની
બહાર કર્યું જ નહિ એવું વાંચેલું.

મેં પૂછ્યું: “તમે કોઈ માસિકા વાંચો છો?” એ જણુએ
કહ્યું: “અમે ‘બાલમિત્ર’ વાંચીએ છીએ.”

મેં કહ્યું: “ઢીક ત્યારે. આપણે વાર્તાએ લાવીશું, તમે વાંચને.
તમે વાંચી વાંચીને ધરાઈ જાઓ એટલી બધી વાર્તાએ લાવીશું.”

બધા ખૂબ ખુશ હેખાયા.

પછી વાર્તા આગળ ચાહી તે ધંટ વાગ્યા સુધી. રજ થઈ ને મેં કહ્યું: “સૌ એક વાત સાંભળતા જાઓ. ગોળ ઉપર એસીને સાંભળો. આ નખ કઢાવી લાવને, હો. જાતે કઢાય તો જાતે કાઢને, નહિતર બાપાને કહેને, નહિતર હજમ આવે ત્યારે દેવરાવી લેને.”

એક કહે: “આપણે તો મોંટેથી કાપી કાઢવાના.”

મેં કહ્યું: “ના ભાઈ, એમ ન કરતા. નખ કાં તો નરેણીથી કે છરીથી લેને.”

પછી મેં કહ્યું: “આપણે એક ગમ્મત કરીશું ?”

બધા કહે: “શું ?”

“તમારે ટોપી વિના નિશાળે અવવું. આવી ગંદી ટોપી શા માટે ! ને ટોપીનો વળી શો ખ્ય છે !”

સૌ હસી પણ્યા. બધા કહે: “ઉધાડે માથે તે શાળામાં અવાય ? મોટા માસ્તર વઠે ને !”

મેં કહ્યું: “હું કાલથી ઉધાડે માથે આવીશ ને તમે પણ આવને.”

છોકરાએ કહે: “પણ બાપા ના પાડશે તો ?”

“નો કહેને કે એ તો નકામો ભાર છે. ને ગંદી ટોપી એઠાવી તે કરતાં ન એઠાવી સારી.”

વળા મેં કહ્યું: “આ ડેટનાં યુતાનો ટંકાવી લેને. આમ તો સારું નથી લાગતું.” સૌ મનમાં વિચાર કરતા કરતા ધેર ગયા.

મને હેડમાસ્તર સાહેબ મળ્યા. તેએ કહે: “અરે ભાઈ, તમે તો કંઈકનું કંઈક કરો છો. આ બધા ચાળા શીછને કરો છો: નખ ઉત્તરાવતીના, ને યુનાન ટંકાતાના ને એવા અંદા ! ભાગ્યાવતાની નવી રીતો ડેગાવવા આવ્યા હોંનો તે એજ કરો ને ! આ તો માઆપો

કરણે નહિતર આપણે શું? ને ઉચ્ચાડે માથે તો છોકરાઓને શાળામાં આવવા ન હેવાય. એ તો અસમ્યતા! એ બાઅતમાં ઉપરી સાહેભનો હુકમ જોઈશે.”

મેં કહ્યું: “સાહેભ, આજ ભણુતરની નવી વાતો અને નવી રીતો છે. મેલાદેલા ને ઢંગથડા વિનાના છોકરાઓનું પહેલું ભણુતર વળી બીજું કચું હોય! વળી જુઓને, એ બધા મેં કચું તેથી શરમાપા તો છે જ. તેમને એમ તો લાગ્યું જ છે કે આમ ગંદા ન રહેવાય. મારી તો ખાતરી છે કે ધણ્યાઓ સાક્ષી રહેવા પ્રયત્ન કરવા લાગશે. બાકી ટોપીઓની બાઅતમાં હું ઉપરી સાહેભનો ભત જણીશ; અને અલઅત, તેઓનો હુકમ નહિ ભળે તો તો એ ફેરફાર બંધ રહેશે.”

હું ઘેર ગયો, જમ્યો ને તુરત જ ઉપરી સાહેભને લાં ગયો.

“કેમ? આજે અત્યારે ક્યાંથી?”

“જુ, એક બાઅતમાં પૂછવાનું છે.”

“પૂછા, શું છે?”

“વર્ગમાં હું અને છોકરાઓ ઉચ્ચાડે માથે આવી ન શકીએ?”

“શા મારે?”

“છોકરાઓની ટોપીઓ એટદી બધી ગંદી છે ને જતગતની છે કે તેઓ ટોપી વિના જ આવે તો થું એકું? આ ઉમરે તેમને માથે એ ભાર ન હોય તો નહિ સારુ?”

“પણ લોકાને એ વિચિત્ર અને હસવા જેવું લાગશે.”

“લોકાને તો એમ લાગશે જ. આપની મરજ શી છે?”

“મને લાગે છે કે આપણે આપણા આ પ્રયોગમાં આવી સામાજિક બાઅતોને ન રપદીએ. આપણે તો શાળાની ચાર

દિવાલોમાં એસીને શિક્ષણુમાં ડેવા સુધારા કરી શકીએ છીએ તે જેવાનું હોય. ટોપીમાપીનું જવા હો ને !”

મને ઉપરી સાહેબનો વિચાર ટૂંકો લાગ્યો. પણ મને થયું કે હમણું એનો આગાહ જવા દઈ એ. હમણું લોકો અને ઉપરીની સામે ન થઈ એ.

મેં કહ્યું: “પણ બધા છોકરાઓ ઉધાડે માથે એસીને કામ કરે તેમાં વાંધો નથી ને ?”

સાહેબે કહ્યું: “ના, જરા યે નહિ. આપણું વર્ગમાં તો તમે તમને ગમે તે સુધારા કરો ને ! જે એમ કરતાં લોકો તે જીલી લે તો ટોપી પહેંચવાનો ભારે આગાહ તો નથી જ.”

મેં કહ્યું: “વાનું સાહેબ. હવે એક ખીજુ વાત પૂછવાની છે. મારે મારા વર્ગમાં એક નાનું એવું પુસ્તકાલય રચવું છે. એ માટે મને ચેસા મળી શકે ?”

સાહેબ કહે: “ચેસા તો શી રીતે મળે ? આપણે પ્રયોગ તો એક રીતે મારી અને તમારી વર્ષયે છે. અનેટમાં જે ચેસા છે તેથીજ આપણું શાળા ચલાવવાની છે. તમારી શાળાના તમારા વર્ગને ભાગે જે આડખાર આના આવે બેમાં બધી રમત કરવાની છે.”

મેં કહ્યું: “સારે ?”

સાહેબે કહ્યું: “સારે હમણું તો એ વિચાર પડી મૂકવો.”

મેં કહ્યું: “એક ખીજ ચોજના છે. આપ મંજૂર કરો તો થાય. એ ચોજના એ છે કે દરેક છોકરાને પાડયપુસ્તકો તો લેવાંજ પડે છે. ગુજરાતી ચોથી ચોપડી, તેના અર્ભે અને ધૃતિદૂસની ચોપડી તો બધા છોકરાઓને ખરીદવાની જ હોય છે.”

“હા; તો ?”

“તો હું એમ કરવા માણું છું કે છોકરાઓ પાસે પાઠ્યપુસ્તકો લેવરાવવાંજ નહિ; પણ તેનું કુલ ખર્ચ જોટલી જે રકમ થાય

તે એકાં કરી તેનાં સારાં સારાં વાંચવા ચોગ્ય પુસ્તકો લેવાં અને તેનું પુસ્તકાલય બનાવવું.”

“વારુ; પણ પછી પાડયપુસ્તકો વિના શી રીતે ભણ્ણાવશો?”

“તેનો વિચાર મેં કરી રાખ્યો છે. એમાં ભણ્ણાવવાની પદ્ધતિ-ફેર ઉપર મારો આધાર છે. આપને હું કરી બતાવીને વધારે સારી ખાતરી આપી શકીશ.”

“એ તો ઢિક; જણે કે તમારા પ્રવેણ છે ને તમારે પરિણામ પણ બતાવવું છે. પણ મારે જરા ચેતવણી તો આપની જ નોઈએ કે જોણે, છેકરાએ રખે નહિ. પ્રવેણમાં તમારી સાથે તો હું છું જ; પણ જરા છાતી થડકી જય છે.”

મેં કહું: “સાહેબ, એકવાર નોઈએ તો ખરા! આપણો પ્રયત્ન છે તો ઈશ્વરેચ્છાએ ઢિક જ થશો.”

“વારુ, પણ વર્ષ આખરે આ તમારા પુસ્તકાલયનું શું થશો? સૌને ચોપડીએ વહેંચી આપશો ને?”

“હા, એક રીતે તો ચોપડીએ આખા વર્ગની છે ને તે વર્ગને પાછી જ મળની નોઈએ. પણ જે માઆપોને સમજની શકીશ કે તેઓ પાછી ન માગતાં વર્ગના પુસ્તકાલયમાં જ રહેવા હે, તો વર્ગનું પુસ્તકાલય કાયમ થશે ને દર વર્ષે તેમાં નવાં વાંચવાનાં પુસ્તકો ઉમેરાશે.”

“કોણું જણે લોકાને તમારી વાત ગળે જોતરે તો! બાકી વિચાર તો સુંદર છે. જરા એને તક તો આપો જ આપો. પણ સવાલ પાછો એમ થાય છે કે ભણ્ણાવતી વખતે તમે પાડયપુસ્તક વિના શી રીતે ચકાવશો?”

“એનો વિચાર મેં જોણની રાખ્યો છે.”

ઉપરી સાહેંગની રૂળ લઈ હું બેર ગયો.

: ૭ :

ખીજે દિવસે શાળા જીવડી. મને હતું કે છોકરાએ રોપીએ।
વિના કદાચ આવશે; પણ મારી ધારણા જોઈ પડી. જાણુવામાં
આવ્યું કે માબાપોએ તેમ કરવાની ના પાડેલી. તેમણે કહેલું:
“હવાડે માયે તે ક્યાં ય જવાતું હશે? તમારો મારતર તો ગાડો છે!”

મેં નખ તપાસ્યા; પણ કાંઈકે જ ઉત્તરાચા હા. જાતગતની
વરતી સુસ્કેલીએ તેનું કારણ હતી. ડેઢનાં ધુતને ટાંકના ડાંડ
નવરું હતું તે ટાંકી આપે? એક આએ કહેવગાવેલું: “મહેનાણ
સાહુઅ, તમે ભણાવવા આચા છો તે ભણાવો ને બાપુ! આ હુનર
શું કામ કાઢો છો! અમારે તે કાંઈ કામકાજ હશે કે છોકરાને
નખ કાઢી દઈએ ને બુતાન ટાંકી દઈએ ને આ કરી આપીએ ને
તે કરી આપીએ! અમારા લોકના છોકરાનું તો એમ જ ચાલે!
અમે તે મરવાયે નવરાં નથી, તે તમારી આ વેડ તે ક્યાંથી કરીએ?”

હું તો ફરી જ ગયો. આપણે તો ધારેલું કે શાળા જીવડતાં
વર્ગ સ્વચ્છ ને સુંદર હેખાશે પણ તેને બદલે આ સહેલા ભણ્યા!
પણ હરકત નહિ. મને થયું કે “આમ કાંઈ નહિ વળે. મારે એક
તરફથી માબાપોનો સહકાર, સાખવો જોઈશે ને ભીજુ ભાજુથી
શાળામાં જ તેનો શોખ કેળવાય તેવી યોજના કરતી પડ્યે.”

તે હવાડે તો વધારે વાતચીત ન કરતાં વાત શરૂ કરી ને
આદરેલી વાતો પૂરી કરી.

છોકરાએ કહેં: “એણ વાતો.”

મેં કહ્યું: “કાબથી નરી વાતો શરૂ કરશું. આજે ચાલો
જરા રમીએ.”

“રમીએ?” છોકરાએ આશ્વર્યથી મારી સામે જોઈ રહ્યા.

“હા, રમીએ. રમતો રમીએ. તમને કંઈ કંઈ રમતો આવડે છે?”

“ ધણું યે આવડે છે. પણ અહીં કાઈ રમાય ? ”

“ કેમ ન રમાય ? ”

“ આ તો નિશાળ છે. કયાં કોઈ દિવસ છોકરાએ અહીં રમે છે ! કોઈ દિવસ રમતાં ભાલ્યા છે ! ”

“ પણ આપણે તો રમીએ. હું તમારી જેઠે રમીશ. ચાલો રમીએ.”

કેટલાએક છોકરાએ સજણડ બેબા રહ્યા. કોઈ કોઈ તો હેઈયાં કહુને રમવા દેખ્યા. સાં તો હોહે થઈ રહ્યું ! બીજ વર્ગના છોકરાએ વર્ગમાંથી જેઈ રહ્યા. બીજ શિક્ષકો પણ મારી સામે તાકી રહ્યા.

હેડમાસ્તર એકાએક આવ્યા ને મને ટોક્યો : “ જુએ, આ રમતો અહીં નજીકમાં નહિ રમાય. જેઈ તો દૂર પેલા મેદાનમાં જાએ. અહીં બીજાએને અડયણું થાય છે.”

હું છોકરાએને લઈ મેદાનમાં ગયો.

છોકરાએ તો દ્રુતેલા બોડાએ જેમ ઝુદાઝુદ કરી બોલતા હતા : “ રમત ! રમત ! એ ભાઈ રમત ! ”

મેં કહ્યું : “ કઈ રમત રમીએ ? ”

એક કહે : “ જોએ . ”

બીજે કહે : “ ના, હતુણુ. ”

ત્રીજે કહે : “ ના, સાતટાપલિયો દાવ. ”

ચોથા કહે : “ તે અમારે નથી રમવું. ”

પાંચમો કહે : “ તો ચાલો આપણે બાકીના રમીએ. ”

હું છોકરાએને શરીમાં પડેલી ટેવો જેડ શક્યો. મેં કહ્યું : “ આપણે તો રમવા આવ્યા બીજે. ના અને હા, તે નથી રમતા ને રમ્હા, ને એવું કરવું હોય તો ચાલો પાછા નિશાળે જઈએ.”

છોકરાઓ કહે: “ના, અમે તો રમતા માગીએ છીએ.”

મેં કહું: “ચાલો લારે, આજે તો ખોએ રમીએ. એ જણું તિલાવડિયા થાએને ખીજાએ. પઢી આવો.”

બેઠું થતાં પાછી ડેટલીયે વાર લાગીઃ એક કહે હું તિલાવડિયો થાડીં ને ખીજે કહે હું. છેવટ મેં એનાં નામ નક્કી કરી આપ્યાં ને લાગ પાખા એટસે રમત ચાલી.

પણ એ તો શરીરમાં રમેલા છોકરાઓની રમત ! ડાઈ મોદામાં જુલ્દ ધાલીને રમે તો કે ! દેરક નકમો કંઈ ને કંઈ એલેજ લે. “એ અવો મિયાંજુ પકડવા !” “એ પકડ્યાં, પકડ્યાં ! તમારા ચાંદ છે, તે તમે પકડી શકો !” “એ પણ સાચવલો.” “એ ભાઈ, જરા ને તો અરો, પણેથી પેલો નીકળી જરો.” “અરે ધ્યાન રાખ ! ને હું નો’તો કહેતો કે નીકળી જરો ? ભાઈ વાતો કરવા રોકદ્યા લાં પેલો નીકળી ગયો. ને હારી ગયા !”

મને થયું: “આ તે રમતનું મેદાન કે ડાઈ નાતરો વડો ! આ તે ખોજોની રમત કે ધોંઘાટની રમત !”

રમત પૂરી થઈ ને જુતેલા છોકરાઓમાંથી એક પોલ્યેન: “લેણ, અમે જુસા, બો ! મહેનત તો ખૂબ કરી પણ કંઈ આલ્યું ! સારા તિલાવડિયો હતો એમાં શું થયું !”

સામાવળો ખીજયો ને ઘૂરક્યો. તે કહે: “લે હું હાર્યો. હવે શું છે !”

પેલાએ કરી વાર કહું: “તમે હાર્યા ને અમે જીત્યાં ! તમે હાર્યા ને અમે જીત્યા !”

હારનાની મેં પર ચુક્કો હતો. તે કહે: “અસ ! હવે ચુમ્મ રહેણું છે !—નહિંતર આ પથરો લગાવીશ.”

જીતનાર કહે: “લગાવ્યાં, લગાવ્યાં ! ખીજવીશું, ખીજવીશું ને
ખીજવીશું ! એ હાર્યો ! એ હાર્યો ! એ હાર્યો ! ”

ચેલાનો ગુસ્સો હાથ ન રહ્યો ને પથરો જાંચકને લગાવ્યો.
પથરો સામાના માથામાં લાગ્યો ને લોહીની ધાર ચાલી. મને થયું
કે આ ભૂંડી થઈ ! મારો રમાલ ફૂડી મેં તેને ફાટો બાંધ્યો.
સૌ છોકરાઓને પાસે બોલાવ્યા ને કહ્યું : “કાલથી રમવાનું બંધ.”

ખધા કહે: “પણ એ એ લડે એમાં અમને શું ! ”

મેં કહ્યું : “તમને એકએ વાત કખૂલ હોય તો જ રમવા આવીએ.”

ખધા કહે: “કખૂલ, કખૂલ.”

મેં કહ્યું : “પહેલી વાત એ કે રમતી વખતે નકારું બોલકું
નહિ. ઓલે તે માર થાય.”

ખધા કહે: “કખૂલ.”

“બીજી વાત એ કે હારવાજીતવાની વાત જ નહિ. રમત છે;
એક વાર આપણે નઅળા દેખાઈએ તો બીજી વાર બીજા દેખાય.
એમાં પછી અમે હાર્યાં ને તમે જત્યા એવું ન હોય. રમવું
એટલે રમવું, હોડવું ને મળ લેવી. હારવું ને જતવું ને પછી
માથાં ફોડવાં એ બધું આપણુંને ન જોઈએ.”

ખધા કહે: “એ પણ કખૂલ.”

અમે સૌ રમત રમીને શાળાએ આવ્યા. સાથે પેલો માથું
હૂટેલા છોકરો પણ હતો. માસ્તરો ને છોકરાઓ સૌ અમને જોવા
ભાડાર આવ્યા. એક ગીયળા છોકરે કહ્યું : “કાં, કેવી રમત રમાડી ! ”

ખીંઠો કહે: “એ તો બાઈ હોળી રમવા ગયા’તા ! ”

નાના પડી એટલે શિક્ષકા અને હેડમાસ્તર મળ્યા. એક શિક્ષક
મને કહે: “કેમ, યુદ્ધની રમત રમી આવ્યા ! ”

થીને કહે: “અરે ભાઈ, આ રમતનું કયાં કાઢ્યું! આ બાર ખાપની વેજ એને તો શાળાની ચાર દીવાલેઓમાં રાખ્યો ને ગોખાવવું ને અણુવવું; છૂટી મુજબે તો તો માથાં લાંગી નાએ! શેરીમાં રોજ શું થાય છે એ નથી જાણતા!”

હેડમાસ્તર કહે: “હું તો ધારતો જ હતો કે કંઈક નવાજૂની થશે. પણ ઠીક છે, આ ભાઈને એક વાર અનુભવની જરૂર છે; એ વિના અમસ્થા ટાઢા નહિ પડે! અહીં શાળામાં તે રમતો ફરમતો હોય?”

મેં કહું: “સાહેબ, રમત એ જ સાચું જાણતર છે. દુનિયાની મહાન મહાન શક્તિઓ રમતના મેદાન પર થયેલી છે. રમત એટલે ચારિન્ય.”

હેડમાસ્તર કહે: “ત્યારે જ તો મારામારી થઈ ને માથું ફૂટ્યું ને!”

વાત ચાલે છે ત્યાં માથું ફૂટેલા છોકરાનો બાપ છૂંવાફુંવા થતો આવ્યો. તે બોલ્યો: “આ અમારે આવું જાણતર નથી જોઈતું. જુઓ, આ માથું બધું લાંગી ગયું છે! કયાં છે મોટા માસ્તર? ડાણે એને માર્યો?”

મેં કહું: “જુઓ ભાઈ, એ તો રમવા ગયેલા તે ત્યાં છોકરા લડી પડ્યા ને લાગ્યું.”

બાપ કહે: “પણ રમવા જવાનું એને કીધું ડાણે? નિશ્ચાળમાં તે જાણવવાનું હોય કે કંઈક રમાડવાનું! દિવસ બધો શેરીમાં તો રમે જ છે ને! તમારે છોકરાને જાણવવો હોય તો મોકલું; નહિતર ન મોકલું.”

હું તો સાંલળી જ રહ્યો.

હેડમાસ્તર કહે: “એ તો આ ભાઈ જરા નવા શિક્ષક આવ્યા છે તે જાણવવાના નવા નવા અખતરા કરે છે. આને આ રમતનો અખતરો કર્યો! ને એમ કરતાં આ બાજુથી થઈ!”

છાકરાનો બાપ કહે: “તે મારે તમારા અખતરાખખતરા નથી જોઈતા. છાકરાને સરખે બલખુલવો હોય તો બલખુલો; નહિતર ઉડાલી લડ.”

ભીજા માસ્તરો મૂછમાં હસતા હતા. હું આ વર્ષતે શું એલં!

દેર ગયો. ખાતું જાણું નહિ. ઓરડીમાં જર્ઝને વિચાર કરવા લાગ્યો: “માણું, આ તો રોજડી થઈ! દેર. રમતનના નિયમો તો આપ્યા છે ને વધારે આપીશ. બાકી રમત રમાડવી તો જોઈએ જ. મારે મન તો એ જ શિક્ષણ સાચું છે.”

પદ્ધાં પદ્ધાં વિચાર આવ્યો: “માખાપોની એકાદ સલા કરું ને રમતનો મહિમા સમજાવું. તેમની પાસેથી સ્વચ્છતા અને વ્યવસ્થાની બાબતમાં સહકાર માણું. એ લોકો મદદ ન કરે તો મારું કામ માણું” જય. અને પોતાના છાકરાઓ માટે એટલું તો તેઓ કરે જ ને! આપણે શિક્ષક લોકો માખાપોનો સહકાર માગતા નથી તેમાં આપણી જ ખામી છે. કલે સલા એલાવીશ.”

: ૮ :

સલા ભરાઈ. આને સલા કહેવી કે કેમ! ચાળીશ માખાપોને આમંત્રણુ કર્યું હતું લારે સાત પિતાઓ આવેલા હતા. મારી નિરાશાનો પાર ન હતો. મેં તો ભાષણુ માટે સરસ તૈયારી કરી હતી. પણ મેં જુકાયું. મને થયું કે આપણું કામ પ્રયત્નનું છે. ભાષણુનો પણ આ અખતરો !

ભણું ગંભીરતાપૂર્વક એક કલાક સુધી મનનીય ભાષણુ કર્યું. સાત જણુમાંથી એકને દેર જવાતું તેણું આવ્યું ને તે ગયા; ભીજાઓ મહા કંઠાળે તે સાંલળી રહ્યા હતા. પણ મારા મુદ્દાઓ અગતના હતા ને તે તેમને સમજવવા જ જોઈએ.

મેં તેમને ખરું ભણુતર અને યોંદું ભણુતર એનો તાત્ત્વિક બેદ અનીખુવટથી બતાવ્યો. મેં તેમને આધ્યાત્મિક ઉજ્જ્વલિ અને સ્વચ્છના સાંબેનો સંબંધ સમજાવ્યો. મેં તેમને રમત અને ચારિત્રયગઠનની સાંકળ સાંધી આપી. મેં તેમને અંદરથી આવતા સાચા નિયમનનો મહિમા અને કિંમત કહી. આજની શાળાની શિક્ષણુપદ્ધતિ અને નિયમનને વિભાગી કાઢ્યા.

પણ આ હતું તુંઅડીમાં કંદુરા જેવું. બિચારા બેખાંચ જણ્ણા શરમેલરમે આવેલા, તેઓ તેણું તેણું થતા હતા; ને ભાષણ પૂરું થયું એટલે ઉતાવળથી ધર તરફ ચાલ્યા અયા.

અમે શિક્ષકોને ઉપરી સાહેય પાછળ રહ્યા. ઉપરી સાહેય જરા હસ્તિને કહ્યું: “લક્ષ્મીરામભાઈ, આ તો બેંશ આગળ બાગવત ગાયું! આ તમારી ફિલસુધી ડોણ સમજે!”

પાછળથી ડેઈ શિક્ષક હળવેથી બોલ્યો: “વેદિયો!”

મને સારું ન લાગ્યું પણ ગળી ખાખું; અને મને ખાતરી પણ થઈ કે “હું હજ વેદિયો તો છું જ; મને હજ સાધારણું લેડો પાસે કેવું ભાષણ કરવું જોઈ એ તેની પણ ગમ નથી.”

શિક્ષકો હસતા હસતા ધેર ગયા.

: ૬ :

દસબાર દિવસ ગયા ને મેં પુસ્તકાલયનો વિચાર હાથમાં લીધો. વાર્તાએં ધણી કહેવાઈ ગઈ હતી. છોકરાએં ચોથા ધોરણુના હતા. હવે તેમના હાથમાં પુસ્તકાલય આવવાની જરૂર હતી.

છોકરાએને કહી દીધું: “ચોથા ચોપડી ને ધતિહાસના પૈસા લેતા આવનો. અહીંથી તેનું બધું કરીશું.”

બીજે દિવસે એક છોકરો ચોથા ને ધતિહાસ લઈને જ આવ્યો. તે કહે: “મારા બાપાએ ચોથામાં પણો તે દિવસનાં લઈ રાખ્યાં હતાં.”

ખાને કહે: “મારા મોટાબાઈની ચોપડીએ છે તે લાવ્યો છું.”

ત્રીજે કહે: “મારી ચોપડીએ તો મુંબથી મારા કુચા મેાંકલવાના છે. અહીંથી નથી લેવી.”

એક કહે: “મારા બાપા ચૈસા આપવાની ના પાડે છે. તે કહે છે કે ચોપડી અમે અપાવી હેશું.”

મને થયું: “માર્યા! પુસ્તકાલયનો મેળ મળવો કહેયનામાં સહેલો હતો પણ અરેખર તો ભારે આકૃતું છે!”

થોડાએક જણ્ણા ચૈસા લાભ્યા હતા તેમના ચૈસા રાખી લીધા, પહેંચ આપી ને છાકરાએને કહ્યું: “ડીક.”

બીજે દિવસે છાકરાએ કહે: “અમારી ચોથી? અમારો ધર્તિહાસ?”

મેં કહ્યું: “એ તો તમારા ચૈસા ભેગા કરી મેં આ નવી વાર્તાએની ચોપડીએ આણી છે: તમે કહેતા હતા ને કે અમને વાર્તાની ચોપડીએ વાંચવી બહુ ગમે છે તેથી.”

છાકરાએ ખુશ ખુશ થઈ ગયા. તેઓ સારાં સારાં ૨૦૦૦ન પૂંડાવાળા અને ચિત્રાવાળા ચોપડીએ જેઠ પડાપડી કરવા માંથા.

મેં કહ્યું: “આપણી પાસે તો હજ પંદર જ ચોપડીએ છે; પંદર જણ્ણા વાંચી શક્યો. બાકી વીશ જણ્ણા મારી પાસે આવે, ને હું વાંચું છું તે સાંભળે.” એકદમ ગડાડ ગોટાળો ન થાય માટે મેં ઉમેર્યું: “પહેલેથી પંદર જણ્ણા વાંચે ને બીજાએ મારી પાસે આવે.”

પંદર જણ્ણાએ પંદર ચોપડી ઉપાડી ને એના પર તૂટી પડ્યા. મેં કહ્યું: “એ એક ચોપડી વાંચી રહે તે ટેખલ પર મૂકી હે, ને તાં પડી હોય તે લે; એટલે વારાફરતી સૌને બધી ચોપડીએ વાંચવા માટે મળે.”

બીજાઓને મેં પાસે લીધા ને આદર્શ વાચન શરૂ કર્યું. મેં છટાથી, ભાવથી, નિયમ પ્રમાણે વાંચવા માંબું; પણ પેલા પંદર જણાના વાંચવાનો અવાજ ! અટકોને મેં કહ્યું: “બાઈઓ, સૌ મનમાં વાંચો. અમને અડચણ થાય છે.” સૌ ધીરા દો પત્રા પણ તેમને મૂકું વાચનનો મહાવરો જ ન હતો. તેઓ તાણુને જ વાંચતા હતા. તેઓ ધીમા પડી પાણી જિયેથી વાંચવા લાગ્યા. મેં તેમને છૂટા છૂટા ઓશરીમાં એસી વાંચવાનું કહ્યું ને હું અંદર રહ્યો.

આદર્શ વાચન ચાલ્યું. વાર્તા પસંદ કરેલી હતી એટલે સૌએ તે રસપૂર્વક સાંલખ્યું. ઘંટ થયો ત્યાં સુધી પુસ્તકવાચન અને આદર્શ વાચન ચાલ્યાં, ને પછી અમે ધેર ગયા.

: ૧૦ :

વાર્તા, રમતો, પુસ્તકાલય, આદર્શ વાચન તેમ જ સ્વચ્છતાની અને વ્યવસ્થાની ખટપટ કરતાં એત્રણું માસ વીતી ગયા. હું કામનો હિસાબ કરવા એડો. મેં થયેલા કામ પર નજર નાભી. મને લાગ્યું કે “હજુ પાશેરામાં પહેલી પૂછી પણ નથી થઈ. અભ્યાસકરના વિષયો ગૂજરાતી, ગણ્યું, ખતિહાસ, પદાર્થ-પાઠ વગેરેમાં તો કશ્યું જ નથી કર્યું”. બીજા વગેરેમાં તો કેટલું ચે ચાલી ગયું છે. આ બધું તો વર્ષ આખરે મારે કરી ખતાવલું જ પડ્યે. એ મારા અખતરાની શરત છે. વારુ, એ તો હીક. પણ મેં શું શું સાધ્યું તે તો જોઈ ! વાર્તાક્ષયન સારી રીતે ફાળ્યું હતું. છોકરાએ તેથી હીક હીક વ્યવસ્થિત અને અભિમુખ થયા હતા. પણ હજુ ચંપકલાલ અને રમણુલાલને વાર્તા નથી ગમતી; રામજી અને શાંકરને વાર્તા સાવ સહેલી પડે છે; ને વાર્તા વખતે રહ્યો ને માસો આંખમીચકારા કરે છે, આંગળાઓના ચાળા કરે છે ને બીજાનાં આળવીતરાં કરે છે તેનો ઉપાય તો કરવો જ રહ્યો છે ! હા, એટલું ખરું છે કે રમતો રમાડવાથી બાળકો ભારી સાથે

ખીલે છે, મને ચોતાનો ગણવા લાગ્યા છે, મારાથી બહુ ભીતા નથી, અને રમત પછી આદર્શ વાચન ખૂબ ધ્યાનથી સાંભળે છે. પણ હજુ રમત વખતની અવ્યવસ્થા ને ધોંખાટ ચોડાઈ જ ધર્યાં છે. ખૂબ મહેનત કરું ખું પણ હજુ પૂરો રસ્તો કપાયો નથી.

“વાચનાલયમાં હજુ ચોડી જ ચોપડીએ છે. માખાપોને હજુ હું પાડચપુસ્તકોને બદલે પુસ્તકાલય રચવાની વાત ગણે ઉતારી શક્યો નથી. મને લાગતું હતું કે માખાપોને બાપણ આપીશું ને સમજનાશું એટલે બધું ચર્ચ જરો. પણ અહીં તો માખાપોને માત્ર ‘બાળાણી હો’ એટલું સમજવાની ટેવ પડી છે. તેઓ બીજું કશું સાંભળવા નવરાં નથી, અને તેમને સમજતું પણ નથી. પણ ઇકર નહિ; એ તો પાછળ લાગવાથી થરો. આજ નહિ તો કાલે; હજુ ધણ્યા દિવસો છે.”

મને થયું: “આ પ્રયોગ એટલે તો મોહું મહાભારત કામ ! આથી જેટલી આપણી કદ્દપના, સમજણું અને આદર્શ તેટલી તેની ગંભીર અને મોટી મૂંઝવણું મારો મનને અનેક પ્રશ્નો મૂંઝવતા હતા. સ્વચ્છતાનું તો હજુ કંઈ જ થયું ન હતુ. ટોપીએમાં તો કંઈ ન વણ્યું. કપડાં એકાદે દિવસ સુધી ઠીક ઠીક સારાં આવ્યાં ને પછી તો પાછી એતી એ સ્થિતિ ! નખ પણ પાછા એના એ પાવડા જેવા વખતવા લાગ્યા છે. પણ આની પણ પણ પણા જિવામ રસ્તો નથી. સમજમાં નવી ટેવ નાખની છે એટલે તે ધીરજથી પણ વારંવાર કરવાથી જ થરો.

“ને એકલા છોકરાની જ ચોડી ચિંતા છે ? ઉપરી સાહેખ પણ હવે જરા ઉતાવળા થયા છે. તેમના ય પાછા ઉપરી અને વિરોધીએ હોય છે. તેઓ જશના બાગી થવા માગે છે, પણ ઉતાવળ અને પરિણ્યામ બંને માગે છે. તેમની મદદ કરવાની શક્તિ પણ મર્યાદિત તો છે જ.

“મારા સાથી—શિક્ષકને તો મારામાં કશો વિશ્વાસ જ નથી. તેઓ તો મને ચોખ્યો વેદ્ધિયો જ માને છે; ને હા, હું કંઈક હેરંગ પણ ખરો. એમ તો અનુભવ વિનાનો. પણ આ એમની માન્યતાઓ અને શાખવવાની રીતો તો મારે ન જ જોઈએ. તે જોતાં જ મને ત્રાસ થાય છે! એમ તો હું જે કરું છું તે જ બરાબર છે. મારા છોકરાઓ મને જોઈ નાસી જતા નથી. તેઓ મને ઢીક ઢીક ચાહે છે. મારું માન રાખે છે. આજા પણ ઉપાડે છે. પરંતુ આ શિક્ષકના છોકરાઓ તો તેમને જોઈ ભાગી જય છે; ને પાછળથી તેમના ચાળા પાડતા મેં તેમને નજરે આયા છે! એક પણ છોકરા શિક્ષક પાસે આવી હસીને કે હેતથી બેભા રહેતો જ નથી. તેઓ વર્ગમાં ચૂપચાપ હલ્યાચલ્યા વિના એસે છે ને બહાર નીકળે છે ત્યારે ધીંગામસ્તી કરે છે. એ રીતે મારા છોકરાઓને મેં વાળખી દ્રો આપી છે; ને તેઓ વર્ગમાં થોડીક ગડાડ કરી લે છે તેથી તો અત્યંત વધારે પડતી ગડાડ બહાર મચાવતા નથી. પણ પેદાએ કહે છે કે હું તો તેમને બગાડું છું, ફટાડું છું; માત્ર વાર્તા કહું છું ને બખ્યાવતો નથી; રમાડિને રજાવું છું! ઢીક છે, જોયું જશે. એ રમત અને વાર્તા એટલે મારે મન તો અરધોઅરધ શિક્ષણ છે!

“આમ છે છતાં મારું કામ વિકટ છે તે મારે ધ્યાનમાં રાખવું જ જોઈએ; અને એમ રાખીને જ હું કામ કરીશ.”

વિચારમાંથી બારના ટકારે જાગ્યો ને પછી “હે લગવાનું! આખરે તો બધું તારા હાથમાં છે.” એમ કહી અધી ચિંતા એને એણ સોંપી “કાલની વાત કાલે જોઈશ.” એમ કરીને સુતો.

દ્વિતીય અંડ

પ્રચોગની પ્રગતિ

: ૧ :

ત્રીજે માસ એકો, મને ચચું કે હવે તો રોજના કામની નોંધ લેતો જઉં, જેથી મને પોતાનેજ ખખર પડે કે અડવાડિયે કેટલું કામ થાય છે. એની સાથેજ મેં એક ભાસના કામનો આલેખ કર્યો એટલે મને લાગ્યું કે નોંધપોથીની ઉપયોગિતા છે. આ નોંધપોથી લોગખૂક જેવી નહિ પરંતુ માત્ર દિશાસ્કુલ યાદીઝપ હતી.

વાર્તા તો રોજ ચાલતી હતી, અને રમતો પણ રમાતી હતી. વચ્ચે વચ્ચે વાર્તાલાપ, આદર્શ વાચન અને શરીરતપાસ પણ ચાલતાં હતાં. વાચનાલય પણ ધીમે પમલે વધતું જતું હતું.

: ૧ :

મેં અભ્યાસકરના વિષયોમાંથી કંઈક ઉપાડવાનું શકે કર્યું. એક દિવસ સવારે મેં કહ્યું: “લખો ડિક્ટેશન.” છોકરાઓ મારી સામે જોઈ રહ્યા. તેઓના મનમાં કદાચ આન્યું જ નહિ હોય કે હું ડિક્ટેશન લખાવું અને પાઠ લઈ ને દર્શાવું, કે નકશો પૂછું ને એવું ને એવું કરું એવી જાતનો માસ્તર હોય. વળી એક રીતે હું તેવા ન જ હતો. મને તેઓએ તેવા જણયો જ ન હતો.

મેં તેમને કહ્યું: “લખો.”

ધંજાની પાસે પાડી અને ગેન નહોતાં. પાઠીપેનનું કે બીજી ચોપડીઓનું તેમને ઝામ પડતું ન હતું એટલે તેઓ એ વિના જ આવતા થઈ ગયા હતા. બીજા વર્ગમાંથી મેં પાડી અને ગેનો મગાવ્યાં ને ડિક્ટેશન લખાવવા એકો.

કટલાએક મેં મચકોઝાં. ડાઈ કહે: “ભાઈ, વાતી નહિ ?” ડાઈ કહે: “ચોપડી કંચાં ચાલે છે તે એમાંથી ડિક્ટેશન લખાવશો !” એકબે કહે: “પહેલાં જોઈ જવા હો કે ભૂલ ન પડો.”

મને થયું: “વારુ; આ બધા છે તો પૂરેપૂરી જૂની ધરેઠના શિક્ષણુમાં ઊછરેલા. ડિક્ટેશનનો જૂનો અર્થ તેઓ બરાબર જણે છે ને તેથી તેઓને તે ગમતું નથી, તેનાથી બડકે છે ને તેની પૂર્વતૈયારી માગે છે.”

મેં વાચનાલયમાંથી એક ચોપડી ઉપાડી લખાવવા માંડયું. હું એક આખું વાક્ય ખોલ્યો. પણ હું એચાર શણદ ખોલ્યું લાં તો છોકરાઓ કટ કટ શણદો સાંભળાને લખવા માંઝા ને વાક્ય ખોલ્યો તે તો તેમણે સાંભળ્યું પણ નહિ ! તેઓ “શું લખાયું, ભાઈ ?” “શું લખાયું, ભાઈ ?” એમ કહી પૂછવા લાગ્યા. મેં કહ્યું: “જુઓ, કેમ લખતું તે હું તમને જતાવું હું ને વખતે

બોલું તે વખતે તમારે મારી સામે જેવું, અને બોકી રહું તે ભરાયર સાંભળી અમજ લઈ લખી નાખવું; ને પણ પાછું બીજું વાક્ય સાંભળાવા મારી સામે જેવું.” આ રીતે લખાવવા માંથું પણ જૂતી ટેવને એકદમ કેમ હીક પડે! આગળ જતાં તો સૌને એ જ નવી ટેવ પડી ગઈ ને ડાર્ચને ફરી વાર પૂછતું નહોંનું પડતું; તેમ હું માત્ર એક જ વાર બોલતો અને ફરીને સાંભળાવી પણ જતો નહિ.

ડિક્ટેશન લખાઈ ગયું ને પાડીએ. નીચે મૂકાઈ. તપાસી લીધું ને જાણ્યું કે જોડણીની ભૂલો ધણી પડે છે, જોડાક્ષણેનું પૂરું ડેકાયું નથી ને અક્ષરો પણ ભરાયર સારા નથી.

મેં ડાર્ચની પણ ભૂલ કાઢી ન હતી. જેમતેમ જોઈને પાડીએ પાછી આપી હતી. બધા કહે: “અમારી ભૂલ ડેટલી? અમારી ડેટલી? અમને ઉપર ચડાવો; ઉતારો.”

એક કહે: “હું તો લક્ષ્મીરામભાઈ પણ લખ્યાનશે ને નંબર પૂરશે ને એવું એવું થશે.”

મેં કહું: “હું તો કંઈ યે એવું કણવાનો નથી. હીક છે, તમને સૌને લખતાં આવડે છે ને હીક આવડે છે. કાલે વળી ફરી લખને ને એમ કરતાં બહુ સરસ લખતાં આકશો. રોજ રૈજ લખાએ તો આવડે જ ને! ને ભૂલો કાઢીને ય શું કરવું હતું!”

એક કહે: “પણ નંબર ને ચડાગિતરી?”

મેં કહું: “આ મારી પાસે વાર્તા સાંભળો છો તેમાં ચડાગિતરી છે?”

“ના.”

“આ રમત રમાએ છીએ એમાં નંબર પૂરવાનું છે?”

“ના.”

“આ તમે કોઈ જિયા છો ને કોઈ નીચા છો એમાં ચડાગિતરી છે ?”

“ના.”

“તમે કોઈ જાડા છો ને કોઈ પાતળા છો એમાં ચડાગિતરી છે ?”

“ના.”

“કોઈ પૈસાદાર છો ને કોઈ ગરીબ છો એમાં નિશાળમાં નંબર ને ચડાગિતરી છે ?”

“ના.”

“ત્યારે એમ. આપણું વર્ગમાં ચડાગિતરીજ નથી જોઈશી. કવિતા આવડે તે કવિતા ગાય; ન આવડે તો યાદ કરે. રમતાં ન આવડે તે જોઈ જોઈને શીખે; આવડે તે ખૂબ રમે ને મળ કરે. ડિક્ટેશનમાં સારા અક્ષર લખે તેના જોઈને બીજન સારા કરે. કોઈ ને પૂછીને એકને ન આવડે તો આવડતું હોય તે ન આવડનારને શીખવે, નહિતર હું શીખવું. એ પત્યું.”

બધા આખિએ ઝડપી મારી સામે જોઈ રહ્યા. તેમને નવાઈ લાગી હતી.

છેવટે મેં કહ્યું: “આપણો વર્ગ એટલે તો જુદીજ વાત. નવીજ વાત. એમાં જુદી રીતેજ ચાલે. આ તો આપણો વર્ગ !”

‘આપણો વર્ગ’ શબ્દ ઉપર ઐતિહાસિક વાર લાર મૂક્યો. એટલે છોક્રાએને રંગ લાગ્યો. તેએ કહે: “આપણો વર્ગ. આપણો વર્ગ એટલે જુદી વાત. આપણો વર્ગ એટલે નવી વાત.”

ડિક્ટેશનની બાધતમાં મેં અઠવાડિયામાં ઓડાલ્ફિલ્ડ સુખારા કરી વાલ્યા.

તએને રોજ ને રોજ ચાર લીટી ડાઈ પણ ચોપડીમાંથી બરાખર જોઈને લખી લાવવાનું સોંપ્યું. મેં પોતે તેમને દસ ભિનિટ રોજ વાક્યો લખાવવાનું રાખ્યું. તેઓ રોજ પા કલાક સામસામે લખાવે ને એકખીનાની ભૂલેા સુધારી નાખે તેમ પણ રાખ્યું.

તેમને જોડાક્ષરો આવડે તે માટે મેં અધરા જોડાક્ષરોની અને ખાસ કરિને ચોથી ચોપડીમાં આવી જતા બધા જોડાક્ષરોની એક ચોથી બનાવી આપી. આ પોથી સૌને વારાફરતી વાંચવા અને પારીમાં લખવા માટે આપી.

ચોથી ચોપડીમાં આવતી અધરી જોડણીની હું યાદી બનાવવા લાગ્યો, અને તેનો ઉપયોગ પણ વિચારી રહ્યો.

અમારું કામ ઢીક ચાલવા લાગ્યું.

: ૩ :

એક દિવસ બાળુના એરડામાંથી “એય વેદ્ય રે! મરી ગયો રે!” તો અવાજ આવ્યો.

અમારા કાન ચ્યાંક્યા. અમે વાર્તા કરતા હતા. છોકરાએનું ખાન તે તરફ ગયું. મેં વાર્તા બંધ રાખી કહ્યું: “એક જણ જઈને જુઓ જોઈએ, શું છે? કોણું રડે છે? શા માટે રડે છે?”

મોટા એવો છોકરો જોઈ આવ્યો ને કહે: “એ તો ચેલા જીવાને માસ્તરે માર્યો.”

મેં કહ્યું: “કેમ?”

“એને ભૂગોળા નથી અભિડતી.”

મેં ફરી પૂછ્યું: “તેમાં માર્યો શા માટે?”

એક કહે: “દેસન કરી ન લાવે લારે શું થાય?”

મેં કહ્યું: “પણ ન આવડે તો?”

ભીજે કહે: “પણ લેસન તો આવડવું જ જોઈ એ; તે ન આવડે તો માસ્તર મારે જ ને !”

મેં પૂછ્યું: “પણ ડાઈ ગાએ ને તો યે ન આવડે તો ?”

શ્રીજે કહે: “તો યે માસ્તર તો મારે. માસ્તર તો મારે જ. ન આવડે તો મારે.”

મેં કહ્યું: “એ તો હીક. પણ તમને ડાઈ ને માર આવો ગમે ?”

અધા કહે: “ના; એ તે ડાને ગમે !”

મેં કહ્યું: “હું લેસન આપીશ ને તમે નહિ કરી લાવો તો મારે તમને મારવા કે નહિ !”

“પણ એમે લેસન કરી જ લાભીયું.”

“પણ ગોખણો તો યે નહિ આવડે તો ?”

“તો...તો મારવું નહિ. મારો તો તો વાગે ! ન આવડે તો વધારે અણાવનો ને એમે વધારે ગોખીયું.”

મેં કહ્યું: “વાનું ત્યારે; આપણે આપણી વાત આગળ ચલાનીએ.”

પણ છાકરાઓતું મન આને પેદા જીવામાં હતું. તેઓ અધા કહે: “નેને તો, જીવો તો એવો છે કે પાછળથી માસ્તરને ગાળો દેશો ને ભીંત ઉપર એમનાં ચિત્ર કાઢશો ને નેડે ગાળો લખશો.”

મેં કહ્યું: “જીવાએ એમ ન કરવું જોઈ એ. માસ્તરને એમ ન થાય.”

અધા કહે: “પણ માસ્તર એને બહુ મારે છે !”

મેં કહ્યું: “ત્યારે શું કરવું ?”

છાકરાઓ કહે: “એને ન મારવો.”

મેં કહ્યું: “ત્યારે લેસનતું ?”

છાકરાઓ કહે: “લેસન ન કરી લાવે તો એને શાળામાંથી કાઢી મુક્કવો. નાહકનો મારવે શું કામ ! મારવાથી આવડતું હોય તો તો રોજ મારે જ છે ને !”

એક કહે: “જીવાનું લણવામાં મનજ નથી. એનું તો સસલાં પડવામાં મન છે, ને એને તો ઢોર હાંકવાં ગમે છે.”

ઓને કહે: “આઈ, નિશાળમાં જીવે માર ખાય છે; ‘આઈ બદાર જઈને તો એ છોકરાઓને મારે છે. અમે બધાય જોનાથી પ્રાણે છીએ.’”

મેં પૂછ્યું: “એ નાતે કેવો છે ?”

છોકરાઓ કહે: “જી, એ તો ડેળી છે. એને ખાપ દરભારી નોકર છે ને એને પરણે લણાવે છે. એ મારતરને ધેર લણાવવા પણ રામેલા છે.”

મેં કહ્યું: “જવા હો ને. ચાલો આપણે વાર્તા પૂરી કરીએ.”

વાર્તા પૂરી કરી અમે જેડ્યા ને ધંટ વાગ્યો. શિક્ષા અને તેનાં પરિણામો સંઅંધી વિચારો કરતો કરતો હું ધેર ગયો. મારે તો શિક્ષા કરવી જ ન હતી એહલે મને મારા મનમાં તો નિરાંત હતી.

શોઢા દિવસ વહી ગયા.

: ૪ :

એક દિવસ હું ઉપરી સાહેબને મળ્યો ને મેં કહ્યું: “સાહેનું, એક એવો હુકમ કાઢી આપો કે શાળામાં આવતાર આગંકે સ્વરૂપ કપડાં પહેરીને આવવું પડશે. માથે ટોપી રાખની હોય તો તે મેલી નહી જોઈ એ. વાળ રાખવા હોય તો ઓણેકા જોઈ એ. દર અડવાડિયે બાળકના નખ ઉત્તરાવવા ને વાળ વધે ત્યારે વાળ કપાવવા. કોટ પૂરાં જુતાન વિના ન જ હોય. વળી દરેક વિદ્યાર્થી નાહિયોઈને શાળાએ આવે; અગર હાથપગ ઘેરાને તો આવેજ.”

ઉપરી સાહેંએ ધીરજથી સાંભળ્યું ને તેણો દરયા. કહ્યો
“કાં, માઝાપો નથી સમજતાં ?”

મેં કહ્યું: “માબાપોને ધણું સમજવું છું પણ ગેમ જ નથી જિતરતું સારાં સારાં પૈસાદાર માબાપો પણ સમજતાં નથી. એ તો કહે છે કે ‘નાનપણુંભાં અમે પણ એમ જ શાળાએ જતાં.’ લેએઓ કહે છે કે ‘રાજ ને રાજ એ બધું તે ડાખું કરે! લાઈ, તમાંનું કામ ભણવવાનું છે તે ભણવો ને! આ બધું અમે નોઈ લઈશું.’ બહુ થાડો સુધારો ચર્ચ શક્યો છે. અરેખર સાહેબ, મને એવા વિદ્યાર્થીએને ભણવવું નથી ગમતું.”

સાહેબ હણે: “ત્યારે એમ છે! આપણો જનસમાજ આવો છે. આ સમાજને સંસ્કારી કરવો એટલે તો નેવાનાં પાણી મેંબે લઈ જવાં! તોપણ ન્યારથી આ ખાતું મેં હાથમાં લીધું છે ત્યારથી કંઈક માબાપો ઉપર પણ ટીક અસર કરી છે.”

મેં કહ્યું: “ત્યારે આપ એક હુકમ ન કાઢી શકો?”

“એવો હુકમ મારાથી ન કાઢાય. મારા અધિકારની બહાર છે.”

“અધિકારની બહાર રહેતી તો પછી આપ આવડા મોટા અધિકારી શાના?”

“આતો રાન્ય છે. વળી અન્યત્ર પણ આવી સત્તા અધિકારીએ પાસે નથી હોતી.”

મેં કહ્યું: “ત્યારે?”

ઉપરી સાહેબાઃ “ત્યારે તમે મોટી સત્તાને હલાવો તો જ આવા હુકમો નીકળો. વળી લોડા આવા હુકમનો કયાં અમલ કરવાના છે! વળી તેએ આપણા હુકમો ન માને તો આપણે શું કરીએ?”

“શાળામાંથી ગાળકને કાઢી મૂકીએ.”

“તે ન બને; તેમ કરીએ તો હોછો થાય.”

મેં કહ્યું: “એ બધું ચર્ચ શકે; પણ સત્તા વિના શાણપણ શા કામનું! ખરી વાત છે કે આપણે મહેતાળ એટલે શા વિસાતમં!”

ઉપરી સાહેબઃ “ત્યારે એમ જ સમજે; ને ચાલે છે બેમ અલંક રાખો.”

“ના, એ તો જાણે નહિ જ બને. છેવટે હું શાળાની અંદર નેટલો પ્રયત્ન થઈ શકે તેટલો કરી ભૂટીક્ષ. બાળકાને તેવી ટેવમાં ડેણવીક્ષ. ઉપરાંત આ બાયતમાં નવરાશ મળસે ત્યારે જહેર હિલચાલ કરીક્ષ. ખસે વાત તો એમ છે સાહેખ, કે લોકાને જલે પડી ન હોય પણું આ શાળાની ગંધીની પરિસ્થિતિ એટલે તો જેગને છેચેવાનું જ સ્થાન !”

ઉપરી ચાહેખ: “વાણુ, તમને ગમે તેમ તમે હો. પ્રયોગ કરવા તો તમે આવ્યા છો. પણું આ ચોંચો માસ પૂરો થવા આવ્યો છે. જોણે, વખત દોડ્યો જય છે.”

નમસ્કાર કરી હું વેર આવ્યો. ધરના ખર્ચ (કંઠિજાંટમાં તો શું હતું કે ખરીદી શકું !) એ સરસ મળની સાવરણી લીધી; એક નાનો એવો આરસો લીધો; એક દાંતિયો ને એક આદીનો કટકો લીધો, ને એક નાની સરખી ફાતર લીધી. સારું હતું કે નિશાળના કંપાઉંડમાં નળ તો હતો. વર્ગમાં બધી તૈયારી કરી રાખી.

મેં છોકરાંજોને હારથંધ ડેખા રાખ્યા. તેઓ હવે તો સારી રિતે અભિમુખ થયા હતા. મારા પર તેમની પ્રીતિ હતી. હું કંઈ ને કંઈ પણું તેમને ગમે તેવું ને ફાયદાકારક કરું જું તેમ તેમને લાગ્યું હતું.

મેં આરસામાં સૌને તેમનાં મોં બતાવ્યાં ને કહ્યું: “જેઓને ભાગતું હોય કે પોતાનાં મોં, આંખ, નાક, ગંદાં છે તેઓ નળે જરૂર ધોઈ નાયે. સાથે હાથપગ પણ ધૂએ ને વાળ પણ ભીના કરે.”

એ તો નાયડ તાયડ કરતા બધા ડેપઞ્ચા ને ઉપરાણાપરી પડતા હાથ, મોં, પગ, વગેરે ધોવા લાગ્યા.

મેં વિચાર્યું કે “આ લોકાને આગળપાછળ ચાલતાં અને કુમવાર કામ કરતાં બતાવવું જોઈશે. આમ ધખડ ધખડ કામ તો આપણો આખો સમાજ કરેજ છે. એ અણુઘડતામાંથી તો આપણે આ લોકાને ઉગારવા છે.”

हुरतज में तां एक लीटा कर्यो ने सूचना आयी: “आ लीटा पर सौ जिबा रहो ने वाराहरती नण पर जम्मा.”

हु ऐ हाथमां ऐ आदीना दुकड़ा लध जिबा रखो; ने अने आजु हाथ, पग, में, भाथुं लेवावा लाज्यां.

आनी रीते निशागना कंपाउंडमां तो पहेलवहेलुं ज थतुं हतुं. रस्ते जता भाष्युसो जोई रखा हता के निशागमां वला आ शुं चाजे छे!

बधासे हाथमां धोई लीधां एटदे अभे वर्मां गया, ने में दांतियो आगी आवडे तेम ओणी लेवा औने हँडुं. टापीओने एक भूष्यामां मूङ्कावी हती. बधा स्वच्छ थमा, सुंदर हेखाया, स्वस्थ थया.

में आकथी जोग दोर्यो ने सौने ते पर बेसार्यो. हु पणु ऐ जज्याए ऐठा ने में तेमने कहुं: “हवे ज्ञुओ, तमारा हाथ केटला चोभ्या छे! तमारुं में केटलुं सुंदर लाजे छे! तमने आ गमे के नहि?”

सौन्ये कहुं: “हा.”

में कहुं: “त्यारे आपणे एम करीओ तो? शज निशाने आवाने आ काम तमारे करी लेवुं; पछी आपणे भीज्युं काम करीश्युं.”

ते द्विसे भने साँउ भाग्युं; द्विल प्रसन्न थयुं. में कहुं: “आसो आजे कविता ओलीओ.” हु जे पहेली कविता ओल्यो। ते एक प्रार्थना हती. सहेजे आजे भारा भनभांथी प्रार्थना नीकणी गर्छ.

ते द्विसे नभनुं काम रही गयुं. कपडां अने शुतानतुं तो आकीज हतुं. चलावी लेवानुं राखी ते द्विसतुं भीज्युं काम उपाइयुं.

: ૪ :

મેં વિચાર્યું: “ધતિહાસના શિક્ષણુનો પાયો વાર્તા દારા નાખ્યો છે. હવે કવિતાના શિક્ષણુનો પાયો હું લોકમિત્રના ગાન દારા નાખું. મેં ખૂબ વિચાર કરી એમ નક્કી કર્યું હતું કે પહેલા છ માઝ મારે પાયાનું કામ કરવું, અને પછીના વખતમાં મારે તે ઉપર રીતસરના ભણુતરનું ચણુતર કરવું.”

વિજાથીને આમ કંઈક નવું આવે એટલે હસાહસ અને ગંભીર ને મશ્કરી તો ખરીજ. મેં લોકગીતેની શરૂઆત કરી: “ચાલો જુઓ, હું તમને ગવરાવું તેમ તમે ગાએ.”

મેં જરૂર કરાયું:

કાનો કાળજડાની કોર છે,

બહેની મારો કાનો કાળજડાની કોર છે.

પણ કોઈ અલી શક્કયું નહિ.

મને નવાઈ લાગ્યિઃ ચોથા ઘોરણુના છોકરાએ આટલું પણ ન અલી જાડે! પણ એમને એવી રેખજ ન હતી. મેં ખીજું લીધું:

મારો છે મોર, મારો છે મોર;

મોતી બરંતો મારો છે મોર.

હવે કંઈક ચાહ્યું.

પણ એટલા બધા છોકરાએએ કાચુંપાકું ગાન ઉપાડ્યું કે જાળામાં તો હોણો બાઈ રહ્યું!

પાસેથી શિક્ષક આવ્યા ને કહ્યું: “બાઈ, બસ રાએ આ અવાજ! કાનપઢ્યું સંભળાતું નથી!”

ઓક શિક્ષક કહે: “એ બાઈ, રેઝ ને રેઝ કંઈક નખરા તો કાઠવાનાંજ હે! અમારા છોકરાને સુખેથી ભણાવવા દેવા છ ક નહિ? તમારે તો કંઈ નહિ. અખતરામાં ફાળ્યા તો

ઉપરી કહેશે કરો આ પ્રમાણે ને તે પ્રમાણે; ને નહિ કરો તો
બગલથેલો બધને ક્યાંક બેપડી જશો!”

હેડમાર્ટર આભ્યાઃ “અરે લક્ષ્મીરામભાઈ, આ તે શું કાંઈ
ધૂરી નિશાળ છે કે મોપાટ જેમ કવિતાઓની મોપાટ લેવરાવો
છો! ને નવા અખતરા થાય છે! આ તો આપદાદાયે જાણે એ?”

અધા જતા રહ્યા પઢી મને થયું: “આ તો માર્યા! સદગાનને
હમણું કોરે ભૂકીએ. ગાનશ્વરણ કાઢીએ.”

મેં છોકરાઓને કહ્યું: “બેબા રહો; હું આઉં ને તમે સાંભળનો.”

મેં ‘નથ ધડી હે સોનારા રે મારી નથ ધડી હે સોનારા’
ગાયું. મારો રાગ તો જાણે ગયેંકું મોહિત થાય એવો! પણ હવે
બસ્દરો નહિ એટલે ચાલ્યું તો ખરું. મને થયું કે રાગ સારો
હોત તો ઠીક હતું. પણ મેં દાખલી ને અભિનયથી ગાયું. એમ
તો મેં અભિનયનો અભ્યાસ કરેલો. ડેટલાક છોકરાઓને ગમ્યું;
પણ ડેટલાક તો આગસ મરડના લાગ્યા ને ચાળા કરવા લાગ્યા.
બાકી ચંપક જેવા તો બાડી આંખ કરી જાણે કે મશકરીજ
કરતા હતા! મારી નજર બહાર તે ન હતું. પણ તે તો હું
હાથમાં લઈજ રહ્યો હતો.

જેમને ગાન સાંભળતું નહોતું ગમતું એમ લાગ્યું તેમને મેં
કહ્યું: “તમે જુદા એસો. પારીમાં તમને ગમે તે લાગો કે
ચિત્ર કાઢો.”

ખીન્જું ગાન ગાયું; રસ વધ્યો. પાણું ત્રીજું ચલાયું. સૌથી
વધારે ખીન્જું ગાન ગમ્યું ને તે વારે વારે ગાયું. જેમ જેમ ગવાતું
ગયું તેમ તેમ રસ વધ્યો. છોકરાઓને મેં કહ્યું: “જુએ, મારું
ગીત સાંભળને પણ બોલશો નહિ.. શાળાના કંપાઉન્ડમાં તો
ઓલશો જ નહિ.”

એ દિવસ થયા ને છોકરાઓ ‘નથ ધડી હે’ ગાવા લાગ્યા.
પણ મારો સંભ હુકમ કે કંપાઉન્ડની અહાર!

ગામના માણુસો વાતો કરવા લાગ્યા: “આ કવિતા વળી કઈ જતની ?”

આજો રાજુ કહે: “આ તો નવરાત્રમાં ભવાઈમાં એકે છે એ.”

રધો કહે: “લારે આ માસ્તર ભવાયા હશે કે ભવાઈ શીખવા આવ્યા છે !”

છોકરાઓની ભાતાઓ કહે: “આ નિશાળમં બાયડીઓનાં ગીતો શા સારુ ગવરાવે છે ?”

આપણે તો આ બધું કાન તળે જ કાઢતા હતા. એવું સાંભળાએ તો ચાલે જ ક્યાં ? આપણે તો કુકાવવું જોઈએ. નવા ચીકાઓ એમ જ પડે.

રોજ રોજ નવી નવી કવિતાઓ છોકરાઓ પાસે જાવા લાગ્યો ને તેમને ગમતી કવિતાઓ નક્કી કરવા લાગ્યો. એમ કરતાં પાંચ-પદ્ર ગીતા તો ધણુને મોઢે થઈ ગયાં. હા, એચાર છોકરા એવા હતા જેમને સંગીત ન ગમતું. તેઓ તે વખતે વાંચતા કે લખતા; અને હું તેમની ચિત્તા ન કરતો.

મારા મનમાં હું દાંડિયારાસને પણ દાખલ કરવાનો વિચાર કરી રહ્યો હતો.

હુમણું શાળામાં લગભગ આ પ્રમાણેતું કામ ચાલતું હતું: વાર્તાનું કથન, વાચનાસય, આદર્શ વાચન, રમતો, ડિકેશન, કવિતાશ્રવણ, સ્વચ્છતા અને પ્રાર્થના.

: ૬ :

એક દિવસ એક પરમહંસ બાવા આવ્યા. તેમની સાથે હેડ-માસ્તર હતા. હેડમાસ્તરે તેમનું એણખાણું કરાવ્યું: “આ મહા-રાજુ ધર્મોપદેશનું કામ કરે છે. રાજ્યની દરેક શાળામાં તેઓને ઉપદેશ કરવાની સગવડતા મળી છે. આજે તેઓ આપણું સાહેની ચિઠી લઈ આ શાળામાં ઉપદેશ કરવા આવ્યા છે.”

મેં મહારાજનુને આદરપૂર્વક નમસ્કાર કર્યો, ખુરથી ઉપર બેસાર્યો ને કહ્યું: “વારુ મહારાજનુ, આપ આપનું કામ શરૂ કરો.”

છોકરાએ તો સાધુ મહારાજના મૂર્દેલ શિર તરફ તથા મેં તરફ જોતા હતા. મહારાજનું પાતળું શરીર, હાથમાં કમંડળ, કાંતિવાળી મુખમુદ્રા, આ બધું વિદ્યાર્થીએ કૌતુકથી ધારી ધારીને જોતા હતા.

મેં વિદ્યાર્થીએને કહ્યું: “સ્વામીજી ઉપરેશ કરવાના છે. તમે સૌખ્યાનથી સાંભળજો.”

છોકરાએ હવે તો મારી આજામાં સમજતા હતા. તેઓ આંતિથી એડા.

સ્વામીજી ઉપરેશ કરવા લાગ્યા: “હેઠા વિદ્યાર્થીએ, આ જગતમાં સૌથી મોટા ઈશ્વર છે. આ દુનિયાને એણે પેઢા કરી છે. એનાથી આ જગત છે. એ આપણું આદિકારણું છે.”

આમ ઈશ્વરમહિમા ચાલવા માંડયો. હું તો ચૂપ એડા હતો. વિદ્યાર્થીએ શાંત હતા. પણ ધીમે ધીમે તેઓ અશાંત હતા. કોઈ આગસ મરડવા લાગ્યા, કોઈ પાડી ઉપર કંકરાશી ચિહ્ન કે મીડાં કરવા લાગ્યા, કોઈ ચોપડી બિચ્ચીનીચી કરવા લાગ્યા, કોઈની આંખ જરા જરા લાલ બની, કોઈ ટચલી આંગળી બતાવી બહાર ગયું; એક ગયો તેની પાછળ બીજે ગયો. એકબે જણુ વાતો કરવા જતા હતા પણ લાં તો મેં ચૂપકીની નિષ્ઠાની આપી ને તેઓ ચૂપ રથી ગયા.

મેં મહારાજને વિનતી કરી કહ્યું: “કંઈક સહેલી વાત કરો તો તેઓ સમજશો.”

એમ તો સ્વામીજી સરલ હતા. તેઓએ હિંદુ ધર્મ અને તેના અંશો અને તેમાં શું આવે છે તેની વાત ઉપાડી. પણ તેમાં યે છોકરાએને રસ ન આવ્યો.

હું મનમાં વિચાર કરતો હતો: “આમ ધર્મોપદેશ થાય! ધર્મનું તત્ત્વ ને અતિ ગૂઢ છે, અને જેણે જાણુતાં જીવન આપાને સમર્પી હોય પડે છે, તે આમ આપી શકાય! આનું નામ ધર્મશિક્ષણ કે ધર્મની માહિતી! વળી આ ધર્મની માહિતી એ શું જીવ વિનાનું બોળિયું નહિ?”

મારા મનમાં વિચાર ચાલતા હતા ત્યાં તો સ્વામીજીએ શ્લોકા બોલવા માંથા. છોકરાઓએ તે જેમતેમ કરી જીલતા હતા, પણ સમજતા ન હતા, તેથી તેઓ વધારે તો ગંભત ખાતર અવાજ કાઢતા હતા.

સાચે જ સ્વામીજી તો ગંભીર હતા. તેઓને મન આ કાર્ય આવશ્યક અને પવિત્ર જ હતું. તેઓ પોતાનું કર્તવ્ય બરાબર જ કરતા હતા; પણ છોકરાઓ પૂરતું આ બેંશ આગળ આગવત હતું.

સ્વામીજીએ શ્લોકાને અર્થ આપવા માંડ્યો. છોકરાઓને તે સાંભળવો પડ્યો. સ્વામીજીએ અર્થ પાઠિયા પર લખ્યો ને છોકરાઓને તે ઉતારી લેવા કહ્યું. પછી સ્વામીજીએ કહ્યું: “આ શ્લોક રાજ સવારે ભડિને બોલવો; સાંજે સૂતી વેળા બોલવો. તેથી ખુદી વધશો, બળ વધશો, તેજ વધશો.”

મારા વર્ગના દસ્તસ બારબાર વર્ષના છોકરા!! એમને શ્રી પણી હતી ધર્મની ને શ્લોકની! પણ તેઓએ શ્લોક ઉતાર્યો ને અર્થ ઉતાર્યા.

મારા વિચાર આગળ વધતા હતા: “આ ધાર્મિક શિક્ષણને બીજે કયાં યે આપવાની જગા નથી રહી તે હવે શાળામાં આવે છે! આગળ તો દૈવમંહિરમાં પ્રવચનો થતાં ને ધરમાં માઆપો તે પ્રમાણે વર્તતા હસે ને એ રીતે ધરના આચારો છોકરાઓને ધાર્મિક શિક્ષણિક્ય થતા હશે. પણ લોકાને હવે ધાર્મિક પ્રવચનો

સાંભળવા અબકાશ નથી, કે મોટાંએ તો હવે ખાઈએ જતર્યાં
એટલે, કે શાથી, આ વાત શાળામાં આવી હશે? ” પણ
વિચારસરથી અધૂરી રહી ને ધંટ વાગ્યો.

થાકુ ગયેલા છોકરાએ સ્વામીજીને નમસ્કાર કરીને ગયા.
હું અને સ્વામીજી રહ્યા મેં કહ્યું: મહારાજ! આજે મારે ત્યાંજ
લિક્ષા લેવા કૃપા કરો.”

અમે જમતાં જમતાં વાતમાં ને વાતમાં ધર્મિક શિક્ષણના
પ્રશ્ન ઉપર આવ્યા. મહારાજજી કહે: “હેઠો બાઈ, આજકાલ
ધર્મ જેવી વસ્તુનો લોપ થતો જ્ય છે માટે પહેલેથી જ ધર્મિક
શિક્ષણના સંસ્કાર પાડવા પડશે.”

મેં કહ્યું: “પણ મહારાજજી! આ કુમળાં ભગને ધર્શન,
આતમા, ધર્મ એવા કઠણું વિષયોને કેમ જીવે! આપેજ ન જેયું
કે તેઓને રહ્યા ન હતો, ને તેઓ સભ્યતાની ભાતરજ એડા હતા !”

મહારાજજી કહે: “હા, એ વાત તો સાચ્યા છે. છોકરાએને
રમના-કૂદવા-એલવાનું ગમે છે. વાર્તા કહીએ તો તે પણ ગમે છે.
પણ આ વસ્તુ ગમે કે ન ગમે પણ તેમને છેદેવી જોઈએ; મોઢે
કરાવવી જોઈએ.”

“પણ સ્વામીજી! ધર્મ મોઢામાં નથી રહેતો. ધર્મ તો
જગૃતિ છે; અને તે તો અંતરમાંથી જો ત્યારે ખરો. એ તો
ત્યારે જો કે જ્યારે તેની ભૂખ લાગે. તે માટે પણ વખત આવે
ત્યારે. સ્વામીજી ! આપને એમ નથી લાગતું કે આ બધું અકાને
લાદવા જેવું છે ?”

સ્વામીજી જરા વિચારમાં પણા. મેં આગળ કહ્યું: “સ્વામીજી !
ધર્મ વાત સલ છે; તે જીવનતરણું છે. મતુષ્યનું જીવનક્ષત્ર તરફનું
છે. પણ એમ નથી કે જો બધું આરે કઠિન છે ? સામાન્ય ખુલ્ઝની
પણ બહાર છે ? તે માટે કેટલી યે પૂર્વતૈયારી જોઈએ ?”

સ્વામીજી કહે: “હા, એ વાત ઢીક છે, પણ...”

મેં જરા વર્ચેથી કહું: “ધર્મ શાકમૂળા નથી કે બળરું વરતું નથી. ચોપડીમાં છપાય છે તે ધર્મ નથી. આપને એમ નથી લાગતું કે આવી મહાયની વાતને વધારે ને વધારે ગૂઠ રાખવી જોઈએ? વધારે ને વધારે ગુમ રાખવી જોઈએ? ને ભારે શ્રમ પડી જ તે મળવી જોઈએ?”

સ્વામીજી: “હા, એ માટે તો આપણા પૂર્વને ગુરુઆશ્રમે રહેવું પડતું હતું ને ધર્મ સમજવા માટે કાયાને નિચોવી નાખવી પડતી હતી.”

મેં કહું: “પણ આવે તો આપણે ધેર ધેર ને શાળાએ શાળાએ ઉપરેશ દર્ઢ લોકાને ધર્મની લદાણી કરવા નીકળ્યા છીએ!”

સ્વામીજી: “પણ આ તો કલિયુગ છે. આવે ડાઢુ ગુરુ પાસે આવે એમ છે !”

મેં કહું: “તો પણ રહ્યું. ધર્મ વેચવાથી કે બેટ ધરવાથી નહિ આવે.”

સ્વામીજી: “ત્યારે ?”

મેં કહું: “મને લાગે છે કે ધર્મીપરેશ નાનાં બાળકો પાસે ન કરાય. તેમને તો આજે સ્વર્ણ શરીર, તંદુરસ્ત મન, નિર્મણ ખુદ્દી, અથાક ક્રિયાશક્તિ, એ આપવાં જોઈ એ. તેમને ખધી રીતે બળવાન ફરવાં જોઈએ.”

સ્વામીજી કહે: “હા, બળવાન હોય તે જ આત્માને પકડી શકે છે.”

મેં કહું: “નેમ એક કાળે યૌવન ફાટી નીકળે છે તેમ એક કાળે ધર્મજિજ્ઞાસા ફાટી નીકળશે એમ મારું માનવું છે. અકાળનો ગૃહસ્થાશ્રમ જોવો આ અકાળનો ધર્મપરિચય લાગે છે. ધર્મને

પહેલેથી જ રોજની વાતનો ને શ્લોકનો કરી નામવાયી તો જીલી તે વિષેની ખરી જિયાસા મંદ થાય છે. ડીક છે, એ પણ એક છે, એમ રહે છે; ને તેને લીધે ૬૦ વર્ષ સુધી પણ માણુસ કર્મ-કાંડના શ્લોકા ઐબનારા ને ધર્મશરીરના ડોષુણા ધર્મ ભળનારા રહે છે.”

સ્વામીજી: “કો તો વાત સાચી. મારું પણ એવું માનવું છે. મને પણ આટલા અનુભવથી એમ તો લાગતું જ હતું કે આ રોજના સુધીવાસર્થી થોડા વખતમાં વિદ્યાર્થીને આવા વિષયો પર કંટળો આવશે. મને એમ તો સમજયું છે કે આપણે કોઈ ભીજી રીતે ધાર્મિક શિક્ષણ આપીએ.”

મેં કહ્યું: “માઝ કરશો, મહારાજજી ! મારું તો કહેવું છે કે ધર્મને આપણે જીવવા પ્રયત્ન કરીએ. માયાપો પ્રયત્ન કરે; શિક્ષક પ્રયત્ન કરે. પાઠખલુસતકોમાં ધાર્મિક પુરુષો ને પ્રસંગેની વાતો ભીજી વાતો જેમ આવે. વખતે ભીજી વાર્તાએ જેમ પુરાણું ને ઉપનિષદ્ધની વાર્તાએ પણ કહીએ. ધતિહાસના પુરુષોની જેમ વાર્તાએ કહીએ તેમ ધર્મિત્માળોની પણ કહીએ. આટલા સંસ્કાર કહો તો જંસ્કાર ને આટલી પૂર્વતૈયારી કહો બો પૂર્વતૈયારી ખસ છે. ખાંડી બધું કર્મકાંડ ને શ્લોકા, ને તે યાદ કરાવવા ને ઓલાવવા, ને ધર્મશિક્ષણ ને ધર્મો ને તેનાં પુસ્તકોની સમૃતિ ને એ બધું ધાર્મિક શિક્ષણને નામે રહેવા દઈ એ તો ?”

સ્વામીજી કહે: “સારે મારે ધ્યાયો શો કરવો ?”

મેં કહ્યું: “શિક્ષણનો. આપ પણ મારી જેમ શિક્ષણ આપવા જેસો.”

સ્વામીજી કહે: “પણ સ્વામી થઈને શિક્ષકનું કામ કરવું ?”

મેં કહ્યું: “શિક્ષણનું કામ જ તમારું છે. તમે જો શિક્ષણનું કામ લો તો સારા શિક્ષકનો અમાવ ફૂર થાય ને સાચું કામ થાય.”

સ્વામીજીએ હસતાં હસતાં હાથ ધોયા.

લારથી સ્વામીજી ને હું ખૂબ પરિચયમાં આવ્યા છીએ.
તેઓ નવીન શિક્ષણના વિચારો વાંચી રહ્યા છે ને હું તેમની
પાસેથી ધર્મઅંગેનો અક્ષાસ કરું છું.

: ૭ :

વખત ચાલ્યો જતો હતો. વર્ષ આપરે અક્ષાસક્રમ તો
પૂરો થબોજ જેર્ઝે, અને તે પણ વધારે સારી રીતે. ઉપરાંત
સારા સુધારાવધારા કરી બતાવું તોજ અખતનાનો કંઈક અર્થું.

મને થયું: “હું છતિહાસ ઉપાડું.”

છતિહાસનાં પાઠ્યપુસ્તકોનોં; સંતોષ ન થયો. એકમાં
હકીકતના દેખો હતા, બીજમાં પુરાણી દાઢિ હતી, ત્રીજમાં ચેસા
ખાવાની નજર હતી, ચોથામાં શૈલીદેખ હતો, અને સૌથી ખૂબ
વખણ્ણાતું પુસ્તક મોટાંએ માટે રસિક પણ વિદ્યાર્થીને માટે
અધ્યાતું હતું.

મને થયું: “પાઠ્યપુસ્તક તો ન ચચાનાય. લારે? લારે
છતિહાસની વાર્તા કહેવી ને સંભળાવની.”

વાર્તા તો સૌને પ્રિય હતી. પણ આજ દિવસ સુંધરી તો જુદી
જાતની વાર્તા કહેલી: અરધી સાચી, અરદ્ધી જોડી; ગપગોળાની
અને અદ્ભુત પરાત્રેની. છતિહાસમાં કાંઈ એવું નથી આવતું.
પણ છતાં વાર્તા કહેવા માંડી. લૂખીસુકી અન્તિમાસિક હકીકતોને
સાંધીને વાર્તા ચલાવી. છેકરાએ અસ્થિર થવા લાગ્યા.

“ભાઈ, આવી વાર્તા ન હોય.”

“ભાઈ, આવી વાર્તા નથી સાંભળની.”

“જુ, જેલી ગઈ કાલે કીંદી હતી તોની દંડા.”

“ચાલો ને ભાઈ રમચા.”

“લાઈ, આપણે ગીતો ગાઈએ.”

મને થયું: “આ તો નિષ્ઠળ ગયા !”

ખદ્ધા મારી ફરતા ફરી વખ્યા ને મને હળવેથી હાથ જેંચી રમવા ઉપાડ્યો.

મેં રાતે વિચાર કર્યો: “અતિહાસિક સત્ય ભારોભાર સાચવ્યે નહિ પાલવે. જોમ તો એ બધી હકીકતને અક્ષરશઃ ડોણે જોઈને જખ્યી છે ! વાર્તા દ્વારા જ કદાચ ઈતિહાસ રસદાયક થાય. વળી વાર્તામાં વાર્તાપણું તો જોઈશેજ. માટે મૂળ હકીકતની આસપાસ શક્ય એવી કલિપત વાતો ગોઠવીને ઈતિહાસ કહું.”

ખીજે દિવસે વાર્તા ઉપાડી:

“એક મોઢું એવું જંગલ હતું. ભીલો રહેતા હતા. એનાં આવાં આવાં શરીરો હતાં. તીર મારતાં તો એવું આવડે કે બેડતા પંખીને ધાર્યું પાડે. ત્યાં એક ઝૂંપડી હતી.”
વગેરે વગેરે.

વિદ્યાર્થીઓ વાર્તાના જદુમાં આવી ગયા ને વાર્તાને પી જવા લાગ્યા. મેં તો વનરાજની વાત હાંક્યો. મૂળ હકીકતની આસપાસ સુંદર રંગ પૂરતો હતો.

વાર્તા અધૂરી રહી.

ખીજે દિવસે ખીજું કામજ થના ન દીધું!

“અસ વનરાજ, વનરાજ, વનરાજ કહે.”

મેં વાર્તા પૂરી કરી. જરા ખીતાં ખીતાં પૂછ્યું: “ફરી વાર વાર્તા સાંભળવી હોય તે બેબા થાય.”

એક નહિ પણ અધા બેબા થયા.

ખીજે દિવસ વાર્તા ચાલા. ક્રીજે દિવસ, ચોથે દિવસ, એમ ઈતિહાસની વાર્તા ચાલવા માંડી. કાઈ રમવાનું કે ગાવાનું નામજ ન લે.
હું જોતો હતો કે ક્યાં સુધી રસ રહે છે.

કોઈએ ઉપરી સાહેબને કહ્યું હશે: “અખતરો કેવો થયો એની ખર તો ખણે પડશે; ને તે દિવસે શિક્ષકને કહેશો કે એને ન આવશ્યું? પણ આ છોકરાઓનું વર્ષ બગડશે તેનું શું?”

જરૂર કોઈ શિક્ષક આવું કહી આવે તેની ભારા મનને નબાઈ ન હતી. ભારા છોકરાઓને વાર્તા મળતી ને ખુશી રહેતા. બીજા શિક્ષકોના છોકરાઓ વર્ગમાં અસંતોષ બતાવે, વાર્તા મારે, ભલાભામાં ધ્યાન આપે નહિ ને તોકાન કરે; બોલે બીજા શિક્ષકો ભારી સામે ખિંગય.

હું કહું: “ભાઈ, તમે તમારે માર્ગ જાઓ. ભારો તો અખતરો છે. મારે હૈયે હિંમત છે. હું યે ચિંતા તો કરું છું કે છોકરાઓનું વર્ષ ન બગડે; ને તે માટે મહેનત કરી રહ્યો છું. પણ મારે ભારી રીત છે ને તમારે તમારી રીત છે. કહો તો બીજે ડેકાણે અહીંથી આવે ભારો વર્ગ ચલાવું.”

એક દિવસ ઉપરી અધિકારી ભારો વર્ગ જોવા આવ્યા.

એમ તો ભલા હતા; પણ બધો વખત વાર્તાનો જ જોઈ તેઓ પણ કચવાયા. મને કહે: “ભાઈ, છોકરા આમ ધતિહાસ નહિ શાખે. વાર્તા સાંભળે ત્યાં સુધી મળ. પછી તો આ કાને સાંભળ્યું ને આ કાને બહાર ગયું! આમાં ભલાભયું શું ને એમને આવડયું શું!”

મને વાત તો ઢીક લાગી. મને પણ થયું: “છેવટે વાર્તાની મુખ્ય વાત તો યાદ રહેવી જોઈશે, નહિતર ધતિહાસની પરીક્ષામાં નાપાસ થશે.” ભારે માથે પરીક્ષાનું બંધન તો હતું જ.

મેં એક અજમાયશ કરી. વનરાજની વાર્તા જીજ વાર શાલતી હતી તેમાં જરાતરા ફેરફાર કરીને કહેવા લાગ્યો. છોકરાઓ કહે: “એમ ન હતું. તમે તો આમ કાધેલું. પહેલાં તો હજર ઘ્યાં કીધાં હતાં અને હવે પચાસ કેમ કહો છો। પહેલાં તો નદીકઠિ જૂંપડું હતું.” વગેરે.

મને થયું: “વાર્તાને તો આ લોડાએ સજજડ પકી છે.”
મને હિંમત આવી કે હવે ભૂલી તો નહિ જાય

પણ મીઠું મરચું ભલભાવેલી એવી વાર્તા કાંઈ ધતિહાસના પરીક્ષાક માટે નથી. હવે એ બધાને પરીક્ષકના દૂરખીનમાં લાવની જોઈએ.

કહેલી વાર્તાઓને લખી લઈને હું વિદ્યાર્થીઓને વાંચવા આપવા લાગ્યો. ટૂંકાવવા જેવા ભાગો મેં ટૂંકાબ્યા હના. કોઈ ડેક્ષાણ વધારે ચોક્કસ સ્થળ અને કાળ પણ મૂક્યાં. વાર્તાની કથનશૈલી અને લેખનશૈલી વચ્ચે સહજ તફાવત છે; એજ તફાવત મેં અહીં લીધો ને વિદ્યાર્થીઓને વાર્તા વાંચવાની મજા પડી. તેઓ એકથી વધારે વાર વાર્તાઓ વાંચતા દેખાયા.

હજ મને હિંમત ન હતી કે તેના ઉપર તેઓને હું પ્રશ્નો પૂછીશ તો તેઓ તેના બરાબર ઉત્તરો આપશો.

મેં એક વાર્તાને મુહૂના રૂપમાં ગોડાની. માત્ર એક એક વાક્યમાં એક એક પ્રસંગને લખ્યો, એટલે કે વાર્તાની માત્ર રૂપરેખા માત્ર ટાંચણું લખ્યું અને તે વાંચવા આપ્યું.

વિદ્યાર્થીઓ તે વાંચી ગયા. તેમને તે વાંચતાં આખી વાર્તા યાદ આવતી હોય તેવું લાગ્યું. હવે મેં એક દ્વિસ હિંમત કરી વિદ્યાર્થીઓ પાસે વાર્તાની હકીકતને પ્રશ્નોત્તર દ્વારા કઢાવવાનું સહ કર્યું. મારા અચંભાનો પાર ન રહ્યો. તેઓ પૂંઢેલા પ્રશ્નોના જવાબ કરી દઈને હેવા લાગ્યા. મને ખાતરી થઈ કે હવે તેઓ પરીક્ષામાં પાસ થશે એટલુંજ નહિ, પણ પરીક્ષા પણી પણું તેણો. ધતિહાસને ભૂલી જશે નહિ.

મેં અધિકારી સાહેબને અભતરા ખાતર એલાંયા ને ધતિહાસની પરીક્ષા લેવરાવી. તેઓએ કહ્યું: “આ પદ્ધતિથી

[૫૦]

ધતિહાસ શીખવવાનું બીજા વર્ગોમાં પણ દાખલ કરવા જેવું છે.”

મારે હૈએ એક બાખતની નિરાંત થઈ.

પણ હજ ધાઢું બાકી હતું. ચાર માસ વીતી ગયા હતા,
પરંતુ મળતી જતી ઇતેહથી મારો ઉત્સાહ વધતો જતો હતો.

તૃતીય અંડ

છ માસને અંતે

: ૧ :

દર વર્ષના રિવાજ પ્રમાણે આ વર્ષ પણ અમારી શાળાએ
કુથારની તૈયારીએ કરવા માંગી હતી. મોટા સાહેબ પધારવાનું
હતા. એવો રિવાજ હતો કે મોટા સાહેબ આવે તારે છોકરાએ
નેમની સામે સંવાદ કરે, કવિતાએ ગાય, દ્રિષ્ટિ કસી અતાવે અને
સાહેબ તેમાંના એણને મોકું છનીામ આપે; બીજાઓને કંઈ કંઈ
છનીામ આપે; અને અખ્રી શાળાને કે દિવસે સહરના પડા ભળે.

બધા વર્ગના વિદ્યાર્થીઓને એકઠા કરી હેડમાસ્તર પોતાની નજરે સારા સારા લાગતા ગાનારને, સારા સારા ચોપણું બોલનારને એકઠા કરતા હતા. મારા પર પણ નોટિસ આવી હતી; પણ મારા વર્ગના છોકરાઓ ત્યાં હાજર ન હતા. મને હેડમાસ્તર સાહેબે ખુલાસે પૂછ્યો ને મેં કહ્યું: “મારા વર્ગના છોકરાઓ આ કામમાં ભાગ લઈ ન શકે.”

“કેમ ?”

“આ તો ફક્ત સાહેબ મહેરાયાનને રાજ કરવા અને તેમની વાહ વાહ લેવા માટે કરીએ છીએ.”

“પણ તેવો આપણો રિવાજ છે. આપણું ઉપરી સાહેબની તેવી ઘંઢા છે.”

“હા, તેમ હશે. પણ મારું મન તેમ કરવા કખૂલ કરતું નથી. હું તેમાં ભાગ નહિ લઇ. મારા વર્ગના છોકરાઓ નહિ આવે.”

“તો મારે ઉપરી સાહેબને જખુાવવું જોઈશે. તમે સહકાર આપતા નથી ને ખલેલ પહોંચાડો છો !”

“આપ જરૂર એમના પર લખશો જ. હું તેમને ચોંચ જવાય આપીશ.”

“વારુ ત્યારે, તેમ કરીશું.”

જરા અકળાઈ ગયેલા હેડમાસ્તરે મારી બાયતમાં તે જ ઘડીએ રિપોર્ટ કરી નાખ્યો.

શાળાના બીજા છોકરાઓને પસંદ કરવામાં આવ્યાઃ શામજી અને બીમજીને સંસ્કૃત શિલોક્ષા બોલવા માટે, દેવજી અને ભીમજીને ક્રવિતા ગાવા માટે. ચંપક અને રમણીકને તથા નેમચંદ અને મગનલાલને સંવાહેમાં મૂક્યા. બાકીના જીંચા, જડા અને દુઃખાવડા પાંચંદરને દ્રોલ માટે ચૂંટયા.

મારા મનમાં હું સમસભી રહ્યો: “સાધાશ રે સાધાશ
હેડમાસ્તર સાહેબને, શાળાને અને શિક્ષણુની આજની
નિતિરીતિને!” આ બધા એવા છોકરાઓને શોધ્યા છે કે જેમને
વિષયે સાથે લેવાહેવા ન હોય. શામળ અને બીમળના કંઈ કંઈક
સારા છે, તે ખાલખણુના છોકરા છે તે ધરમાં સંસ્કૃત શૈલોક કંઈક
સાંભળ્યા છે, એટલે તેમને પસંદ કર્યો છે. પણ એ બિચારાઓને
કુઝે કરી કશ્યું યાદ જ રહેતું નથી. તેમનો શૈલોક ગોખી ગોખીને
દમ નીકળી જરો. પણ આવું હોય ત્યાં આવું જ હોય! હું મનમાં
કુઝ પામતો ધેર ગયો. જરીને ઉછું છું ત્યાં ઉપરી સાહેબની
ચિઠ્પી મળી. “આવી જરો; જરા કામ છે.” આપણે તે
જાણુતા જ હતા કે શું કામ છે. નારાયણનું નામ લઈ હું
સાહેબની ઓફિસમાં ગયો. સાહેબના મેં પર ગુરસો હતો. મેં
જરા જરા લાલ હતું. જવાં ચટેલાં હતાં. મૂળો વિતાના હોઈ
જરા જરા હલતા હતા. તેઓ ખૂબ નારાજ દેખાતા હતા. મને
નોઈ ‘એસો’ કહી ખોલ્યા: “કેમ, શા માટે તમારા વર્ગના
છોકરાઓએ લાગ ન લેવો? એમાં કટલાએક છોકરાઓ સુંદર
ને હોશિયાર છે.”

મારું મન ઠંકું હતું પણ મગજ તેજ હતું, તેથી જવાખ
કેંકયો: “તે શું, સુંદર છોકરાઓ ને હોશિયાર છોકરાઓ
ખીજાયોનું મનરંજન કરવા માટે છે! ખીજ આગળ નાચીકૂઢી
શાળાની ખોટી વાહવાહ મેળવવા માટે છે!”

મારો તેજ જવીખ સાંભળી ઉપરી સાહેબ જરા ઠંડા પડ્યા
ને કહ્યું: “ત્યારે? આ કાંઈ નવી વાત નથી. કટલાં યે વર્ષોથી
આ રિવાજ ચાલ્યો આવે છે. મોટા સાહેબ આવે ત્યારે આવું
થાય જ છે.”

“માફ કરનો, સાહેબ!” મેં પણ જરા નરમ થઈને કહ્યું:
“એમ ભલે થતું આવતું હોય, પણ આપણે તે અટકાવવું

નેર્ધાએ. આ તો આપણે કેવળ ઢોંગ છે, દેખાવ છે, સાહેબની પણ છેતરપીંડી છે.”

“કુમ ?”

“એમ કે આપણે જે બધું તેમને બતાવીશું તે માત્ર મારી ભારીને અને ગોખાવી ગોખાવીને તૈયાર કરાવીને. વળ્ણ એ કાંઈ આપણે ભાણુવીએ છીએ તેનું સાચું પરિણામ થાકું જ છે! કેટલા જે દિવસો રીહર્સલ થશે ને ગોખણુપણી ચાલશે ત્યારે પોપટ છીમ છોકરાએ. પદ્ધો—અને તે પણ પાણગથી મદદ મળશે ત્યારે! છોકરાએનો વખત અને પ્રાણું અંને તંગ થશે; ભણુતર પડશે; આજે જેમને આ બધા કામને માટે પસંદ કર્યા છે તેએ બધા એવા છે કે એક એક હેરાન થઈ જશે ત્યારે તૈયાર થશે.”

“પણ એમાં છેતરપીંડી કયાં ?”

“છેતરપીંડી એમ કે આપણે સાહેબને ઠસાવવા માગીએ છીએ કે અમારા છોકરાએ હેશિયાર છે, અમારી શાળા સુંદર છે, અમારું કામ નભુનેદાર છે. પણ આપણે તો શું છે અને શું નથી તે જાણીએ છીએ.”

સાહેય જરા મૂંગા રદ્દા, વિચાર કરતા એડા. મેં આગળ કહું: “આપણે તો ઢોંગ કરીએ છીએ પણ છોકરાએને પણ તે રસ્તે લઈ જઈએ છીએ. સાહેય પણ ખુશ થવાનો ડોળ કરશે ને ધીનામ આપતી વખતે ભાણણું કરશે: ‘આ છોકરાએએ જે ખુદ્ધિશક્તિ અને આવડતવાળું કામ બતાવ્યું છે તેથી અમે ખુશ થયા છીએ, અને ખરેખર તેમાંના કેટલાએક તો ઉત્તમ પ્રકારની આગાહી કરાવે છે કે તેએ સારા અભ્યાસી, સારા શહેરી, અને ઉત્તમ માણુસ થશે. તેમને ઉત્તેજન આપવા માટે આ ધીનામોની બોજના વધાવી લઈ અમે આજે ધીનામ વહેંચવાને ખુશ થયા છીએ.’ આ શું બધું તેમના અંતરમાંથી નીકળે છે! તેએ શું

નથી જાણતા કે આ બધું તેમની ખુશામત વારતે કહું છે! વળો ઈનામ લેનારા છોકરાએને ગોખાવ્યું ન હેત અને તૈયાર ન કર્યા હેત તો અમસ્તા તેઓ કેવા અભ્યાસી, શ્વહેરી ને માણુસ છે તે આપ, એમનાં માયાપ અને શિક્ષકો સૌ જાણે છે.”

ઉપરી સાહેબ એલ્યાઃ “તમે વેહિયા છો. કામકાજમાં સમજતા નથી. તમારે તો બધું સિદ્ધાંતમાં અવી જાય! પણ અહીં તો અધી બાળુ રાખવાની છે.”

મેં કહ્યું: “તો લદે રાખો. પણ હું તેમાં ભાગ ન લઈ શકું. મારાથી આ ધાંધક સહન ન થાય.”

“તા !”

“તો મારો વર્ગ એ કામમાંથી બાતલ કરો.”

“પણ એમાં તો ભારે સુશકેલી પડે. બીજી માસ્તરો અને અધિકારીઓ અને... અને મારી સુશકેલી પણ વધે. ઉલ્લદું મને તો તમારા વર્ગના સારા છોકરાએ જેતાં સાહેબનું મન વધારે રાજ થશે એમ હતું. આ તો.....”

મેં કહ્યું: “મને તમે આમાંથી તો સુક્તા જ કરો. હું કંઈક સાહેબ મહેરખાનને અતાવવા જેતું કરીશ, અને છોકરાએનો વખત ન જાય, પ્રાણ તંગ ન થાય અને આ ઢોંગધતૂરા તેમાં કરવા ન પડે તેમ ગોડનીશ. મારા વર્ગમાં આપ સાહેબ મહેરખાનને લાવજો. મારા મનની ખાતરી છે કે આપ અને તેઓ સાહેબ પ્રસન થશો.”

જરા વિચાર કરી ઉપરી સાહેબે ભીતું સંકેરતાં કહ્યું: “વારું ત્યારે, એમ કરો. તમને આ કામમાંથી સુક્તા રાખે તેમ હું હેડમાસ્તરને લખી નાખું છું. પણ જેને, એમને તમે ચીડવતા નહિ. એ જરા જૂતા જમાનાના છે; તમે ઉછાગતા જુવાન છો. મારે તો તમને ઐછને સાચવવા છે. આ કામ જ એટલું કહીન છે.”

મેં મારી રીતે સાહેખની ભનમાં કદર કરતાં કરતાં કહ્યું:
“વારુ સાહેખ, ત્યારે હું રજ લઈશ.”

* * *

શાળામાં આને પૂર જોસથી તૈયારી થઈ રહી હતી. “સાહેખ
પધારે છે! મોટા સાહેખ પધારે છે!”

મોટા અમલદારો, નાના અમલદારો, ગામના માણુસો અને
વિદ્યાર્થીઓ હાજર હતા. અમે શિક્ષકો ખડે પગે અને ઢાલેવાલે
નોઢે-પણું અફુડ રહેવાની મહેનત કરતા-વ્યવસ્થા જણવતા
હતા. શાળાના તોકાની છોકરાએને એક બાળુ બોલાની હેડમાસ્ટરે
ધમકાવીને કહ્યું: “જોને, હરામઝોરો! કંઈ તોકાન કે ગડાડ કરી
છે તો કાલે વાંસો હળવો થઈ જશે.”

સાહેખ મહેરબાન પધાર્યો. તાળીએનો ગડગડાટ ને સંગીત.
શાળાનો રિપોર્ટ હેડમાસ્ટરે છટાથી અને ધૂંજતા નથી તેની ખાતરી
આપવા માટે ખૂબ મોટા અવાજથી અને વારે વારે અફુડ થઈ
વાંચી સંભળાવ્યો. રિપોર્ટનો અંત આવ્યો. ત્યાં સુધીમાં તેમનું
અંદરનું પહેરણું ભીનું જેવું થઈ ગયું હતું અને તેમનો અવાજ
ધોધરા જેવો બન્યો હતો.

રિપોર્ટ વાંચ્યા બાદ રેસિટેશન-સ એટલે કવિતાઓ અને સંવાહોની
શરૂઆત થઈ. જેમ યંત્રમાંથી ડાઈ બોલતું હોય તેમ બિચારા
છોકરાએ બોલતા હતા. તેમના પર કરો જ હાવ કે આવ સાચેજ
ન હતો. છતાં તેઓ જેરથી બોલતા હતા, હાથપગ હલાનીને
બોલતા હતા. કમણ્યખીની વાત એ હતી કે જે કવિતાઓ પસંદ
કરી હતી તે સુંદર હતી, રસભરી હતી, સારા કવિની હતી અને
છતાં છોકરાએને બખુાવવા બેસીએ તો તે અધરી પડે તેવી હતી.
બિચારા વગર સમજને તે બોલતા હતા, તેનો અભિનય કરતા
હતા ને તેમાં રસ અતાવતા હતા. એમ જ સંવાહોમાં પણ હતું.

સંવાદો ઉપરેશપૂર્ણ હતા. જે ઉપરેશો મોટાના મોઠામાં શાબે ને ઉપરેશો નાના બાળકોના મોઠામાં લાગતા હતા. એ ઉપરેશનું ફારસ બણ્ણું એહૂં હતું. મને તો તેમ ચોખ્ખું જ લાગતું હતું, અને તેમજ તે મોટા સાહેબને લાગતું હતું. તે મૂછમાં હસતા હતા, અને શિક્ષકભાઈઓ જે જરા તટસ્થ થઈ ને જેત તો તેમને પણ તેવું જ લાગત.

મેળાવડો પૂરો થયો. સાહેબે આભાર ને ખુશાલી બતાવ્યાં. ધનામો વહેંચાયાં અને હેડમાસ્ટર, ઉપરી સાહેબ અને સૌને આજના પ્રસંગ માટે સંતોષ થયો. સાહેબે વિવેકના ઉદ્ગારા કાઢ્યા હતાઃ “આ શાળાના કામે મને સંતોષ આપ્યો છે.”

આખ્રે અમારા ઉપરી સાહેબે મોટા સાહેબને વિનંતિ કરીઃ “અમારા આ શિક્ષક કંઈક બતાવવા માગે છે. પેલા પડા પાછળ કંઈક ગોડબું છે.”

સાહેબે તે જોવાની ધર્યા જણાવી એટલે હું પડા પાછળ ગયો. ત્રીજી રુકરીએ પડ્યો ઉધાડ્યો. વર્ચ્યે હું અને આનુભાળુ મારા વિદ્યાર્થીએ હતા. અમારા વર્ગમાં રોજ ગવાતા એક ગીતને અમે પ્રાર્થના ઇપે ગતા હતા. આપો એરડો શાંત હતો. એકએક નાટક ક્યાંથી એ વિચારમાં સૌ પડી ગયા હતા.

પ્રાર્થના પછી ‘કચેરી મેં જાઉંગા’ નો ઐલ શરી થયો. એક છોકરો ઉંદર થયો હતો. દોરકું કેડે બાંધી પૂંછડી કરી હતી. માથે કાળું કપડું આદ્યું હતું ને ચાર પગે ચાલી ચૂંચું કરતો હતો. વળી એક છોકરો દરજી, ખીને ભરતવાળો, ત્રીજે મેતીવાળો, ચેદ્યા ઢોલકવાળો, અને પાંચમો રાજ થયો હતો. ઉપરાંત હું છુટો હતો રાનના સિપાઈ તરીકે.

પાત્રો હમેશના સાદા જ વેશમાં હતાં. રાજ ટેખલ પર રેઝિસ્ટ્રી એઠા હતો; ટોપી વાંકી મૂકી હતી. સિપાઈએ એટલે મેં મૂછો

મંડીને વાંકી કરી હતી; ઇંટો જરા વાંકો બાંધી દીધો હતો; હાથમાં છરી હતી. ઢાલકવાળા પાસે ઢાલકું હતું. બીજાઓ પાસે કશું હતું નહિ.

રંગભૂમિ તો સાદી જ હતી. પડા પાછળ એક પાઠિયામાં કુમ લખેલો હતો. ઓરડાનો ભાગ વાગેલો હતો ને તેના પર એક નાની લજભ એક છોકરાને ત્યાંથી ભગાવીને પાથરી હતી. બાકી શાળામાં એવું કશું ન હતું કે રંગભૂમિની શોભા માટે મૂડી શકાય. છતાં પીપર અને લીમડાની ગાળખીએ કાપી ભીતે ચોડેલી હતી. ચાકથી બોંય પર છોકરાએ ગમ્યાં તેવાં ચિંતો કાઢ્યાં હતાં.

ઉંહરતું નાટક શરૂ થયું ને પુરું થયું. મોટાએ અને નાનાઓ શાંતિથી જોઈ રહ્યા. નાનાઓ-વિદ્યાર્થીએ રસથી જેતા હતા; મોટાએ અગ્નયખીથી જેતા હતા: “આ શું! આ કર્દ નવીનતા! આ કેવા પ્રકારતું નાટક!”

મારે કહેવું જોઈએ કે છોકરાએ સુંદર નાટક લજથ્યું. બેચોની ભૂસે પડતી ન હતી. પ્રોમ્પ્ટર રાખ્યો જ ન હતો. ભૂલ પડવા જેવું થતું હતું ત્યાં હું તરત જ તે ઉધાડી રીતે સુધારી હેતો હતો.

બીજું નાટક ‘દીકરીને ઘેર જવા હે’નું અને ત્રીજું ‘સસોભાઈ સાંકળિયા’નું થયું.

એક જ પડ્હો. સીનસીનરીમાં કંઈ નહિ. કયાંક માથે એલબાતું તો કયાંક લાકડી રાખવાની. બાકી બધો આધાર છોકરાએના અભિનય ઉપર હતો.

નાટકા છેલ્લી ગ્રાર્થના સાથે પૂરાં થયાં ને હું પડા આગળ આવ્યો. મેં નાટકના મેનેજર પેઠે લાખણું કર્યું:—

“મહેરખાન સાહેભો,

આ અમારા નવા નાયપ્રેરોગો આપે શાંતિથી જોયા તે માટે અમે આપ સૌનો ઉપકાર માનીએ છીએ. આપની પાસે એ બાધતમાં હું ઓક્ફે હકીકતો રજૂ કરીશ. આપ તે સાંભળવા હૃપા કરશો.

આ ચોથા વર્ગના ઓકરાઓ છે. આ પ્રસંગે આપણે બેચાર નાટકો ભજવીએ તો કેમ એમ જ્યારે બાળકોને પૂછવામાં આંધું ત્યારે તેઓએ ઉત્સાહ અને તત્પરતા ભતાયાં. તુરતજ નાટકો પસંદ કર્યાં જે વાતાએ. તેઓએ વાંચી છે ને સાંભળી છે, તેનાં જ આ નાટકો છે. તેમને કહેવામાં આંધું હંતું કે જેમ દર અડવાડિયે આપણે વગર તૈયારીએ નાટકો કરીએ છીએ તેમ જ આ વખતે પણ કરવાનાં છે. અમે નાટકો ગોખાવતા નથી. માત્ર તેઓ વાર્તા જાણે છે, દરેક પાત્ર પોતાનું કથન શું છે તે જાણે છે, ને પછી તો રંગભૂમિ ઉપર સંઘર્ષ જળનીને પ્રસંગ પ્રમાણે હૈયાઉંકલતથી એલે છે. ડાર્ઢ પણ બાળક ડાર્ઢ પણ પાડ ગોખયો નથી. સીનસીનરી અને વેશો નાટકનાં ગૌણું અંગો છે, મહત્વનું અંગ અભિનય અને લાવદર્શન છે. તેના તરફ અમારું ધ્યાન રહે છે. વેશ વગેરે વધારે નથી કરતા તેથી તેને વિકસવાની પૂરી તક મળે છે. આપે તે અહીં ડેટલું જોયું તે આપ જાણું શક્યા હશો. તેઓને આ કામ અત્યંત ગમે છે. તેમને આનાથી ખૂબ આનંદ થાય છે. તેમને સાખારી આપવી નથી પડતી, કેમકે નેણો સરસ કામ કરે છે તે જ તેમને પૂરેપૂરો સંતોષ આપે છે.

આપે તરદી લઈ આ બાળનાટકો જોયાં તેથી ફરી વાર હું આપનો ઉપકાર માની વિરસું છું.”

મોટા સાહેબના મેં ઉપર પ્રસન્નતા દેખાતી હતી તે હું ક્ષારનો જેઈ રહ્યો હતો. તે તુરત બેદ્યા ને બોલ્યા: “I cannot but congratulate both the teacher and

the taught for the real treat they gave us this afternoon. It was splendid ! I felt I was in a new school in my own country—England. It was really charming to see little kiddies playing mouse and tailor and king and so forth and so on, all spontaneous and free. This is true education. All recitation and cramming is a thing of the past. Oh ! It's terrible demon ! It's ugly, soulkilling.” १

આટલું ખોલી તે અટક્યા ને ક્રી પાછા ખોલ્યા : “I again say, I am very happy to see this. I won't give them prizes. The genuine pleasure they felt while acting, is a greater and better reward than anything else. I am very glad indeed; very very glad.” २

૧ આ શિક્ષક અને વિદ્યાર્થીઓએ અત્યારે ને ખરેખરી જાંમણ આપી છે તે ખદલ તેમને અભિનંદન ધઠે છે. કામ ખરેખર સુંદર થાં છે ! મને લાણે કે મારી ચેતાવી માતુભૂમિ ઈસાંડમાં હોડ્ય એમ લાગતું હતું. આ નાના બાળકો સ્વચંસ્કૃતિર્થી ઉંદર, દરજ અને રાન્ન પહોં લજવતા હતા. તે કશ્ય અદ્ભુત હતું. આજ સાચી કેળવણી છે રેસીટેશન અને ગોપને સંવાહો લજવવાનો કાળ હવે રહ્યો નથી. એ રીત ખરેખર નિર્ધૃણ, બેહદી અને આત્માનો નાશ કરનારી છે.

૨ હું ક્રી વાર કહું છું કે આ લેઝને મને ખૂબ આનંદ થયે છે. હું આને માટે છનામ આપવા માગતો નથી. નાટ્યપ્રેરોગો અં અભિનય વખતે તેમને ને ખરેખરો આનંદ થતો હતો તેજ તેમન ખરું છનામ છે. ખરેખર, હું ભારે ખુશ થયો છું.

મેળાવડો પૂરો થયો અને સૌ સૌને ટેકાણે જતા હતા. ઉપરી સાહેબની છાતી ફૂલી ગઈ હતી.

તેમણે મને મોટા સાહેબ પાસે બોલાવ્યો ને માંતું ઓળખાણું કરાયું, અને હું અભતરા કરું છું તેની તેમને વાત કરી. સાહેબે મારી સાથે હાથ મેળવી કહ્યું: “Bravo! You are success! Go on with your experiments. This is something! Rest is sham and bosh!” ૩

ઉપરી સાહેબના મનમાં શું થતું હશે!

* * *

હું ધેર ગયો. ખરેખર આજે હું આનંદમાં હતો. સાહેબે હાથ મેળવ્યો ને સાભારી આપી તે એક કારણું ખરું; પણ ખરું કારણું તો મારા અભતરાની આજે કાંઈક કિંમત થઈ તે હતું. પણ હું વિચાર કરતો હતો: “સાહેબ તો પોલિટિકલ અમલદાર છે; તેમને આ નવી નિશાળ ને એ ખંડી વાતની શી ખરર!” પણ મને પછી ખરર પડી કે તેમના દીકરાને ધૂરોપની કોઈ નવીનમાં નવીન શાળામાં તેમણે લખવા મુક્યો છે, અને તેથી પોતે નવી ડેળવણીમાં રસ લે છે.

રત્ન જેચાર શિક્ષકો મળવા આવેલા. તેઓ સાહેબે શું કહ્યું વગેરેની પૂછપરછ કરતા હતા ત્યાં જ ઉપરી સાહેબની ચિઠી આવી ને હું તેમને ત્યાં ગયો.

સાહેબ આજે પ્રસન્ન હતા. આજે મોટા સાહેબ શાળાથી ખુશ થયા હતા. ઉપરી સાહેબે મને ખુરશી આપી; ને પોતે આરામ ખુરશી પર લાંબા થયા ને બોલ્યા: “પહેલાં મને એ કહે કે છોકરાઓને નાટકમાંથી કાંઈ જ ગોખાયું ન હતું?”

“સાભારી! તમારું કામ આખાદ છે! આવા અભતરા હજુ કર્યા કરો. આમાં જ કાંઈ કેળવણી છે. બીજું ખાનું નિરપચોંગી-ઢોંગ છે।”

મેં કહ્યું: “આપને એમ લાગ્યું ?”

ઉપરી સાહેબ: “ના; પણ એ ખંડું યાદ શી રીતે રહ્યું ?
અધા બરાબર જોલતા હતા.”

મેં કહ્યું: “વાત જ એ છે. એમને વાર્તા સંભળાવી હતી.
વાર્તા ગમતી હતી. વાર્તાનાં પાત્રોના મનોભાવ સાથે તેમણે
એકતરપણું અનુભયું હતું. જે ખંડું તેમાં સાચે જ પોતાનું
કર્યું હતું તે તેઓ પ્રગટ કરતા હતા.”

ઉપરી સાહેબ: “પણ હાવભાવ ડોણે શીખ્યા ?”

મેં કહ્યું: “એમ તો હોઈ એ બતાવ્યા નથી. અમે દર
અઠવાડિયે નાટકો કરીએ છીએ. તેમાં હું પોતે જેતરું જું ને
છોકરાએ પણ જિતરે છે. મને આવડે છે તેવો મારા પાત્રમાં
હાવભાવ હું કર્યું જું. છોકરાએ પણ પોતાનાં પાત્રોના હાવભાવ
કરે છે.”

ઉપરી સાહેબ: “પણ એ કેમ બને ? મને નથી સમજતું.”

મેં કહ્યું: “એમની આંખ ખુલ્લી છે ને ! તેઓ દરજ,
સુતાર, કુંભાર, ઉદ્દર વગેરેને જુઓ છે—સાંભળે છે. વાર્તામાં તેમનું
વર્ણન આવે છે તે સાંભળે છે. ઉપરાંત તેમને ઈશ્વરી
કલ્પનાશક્તિ આપેલી છે. આથી તેમાં અનુભવ અને કલ્પના મેળાની
લગ્નાને મનમાં સૂઝે છે તેમ અભિનય કરે છે. તેઓ જ પોતાના
પરીક્ષક છે. અનુભવ અને કલ્પના રંગભૂમિ ઉપર જિતરે છે કે
નહિ તે તેઓ જેતા હશે.”

ઉપરી સાહેબ: “અરે, આ તો ખંડું જોંચી ને અધરી વાત થઈ.”

મેં કહ્યું: “પણ છોકરાએને કયાં આ વાત સમજવાની હોય
છે ! આ તો તેઓ જે કરે છે તે કેમ કરે છે તેનું પૃથક્કરણ છે.”

ઉપરી સાહેબ: “હું, I see (સમજ્યો). એ તો ઢીક, પણ
આજ તો કમાલ કરી. મોટા સાહેબ ખુશ થયા.”

મેં કહ્યું: “અને ન થયા હોત તો પણ આ નાટકનું કામ તો ચાલ્યા જ કરત.”

ઉપરી સાહેભ: “પણ તમે આ પ્રયોગ કરો છો તેની મને તો જણ્ય જ ન કરી. ધણ્યં કરી હેડમાસ્ટર કે ખીજ શિક્ષકા પણ જણ્યા નથી.”

મેં કહ્યું: “ભરી વાત છે. મેં જ તેમને વાત કરી નથી. લેખને મન આ બધું રખડણું-રજાળવું છે. તેમો છમાસિક પરીક્ષા માટે બેસન કરાવવામાં પડ્યા છે.”

ઉપરી સાહેભ: “પણ તેમને ખખર તો પડે જ ને!”

મેં કહ્યું: “ના. અમે દર અઠવાડિયે ફરવા જર્ખ એ છીએ ત્યાં રમત તરીકે આવું કરીએ છીએ. એક પછેડી હું લતો જાઈ છું જોતો. અમે પડ્યો કરીએ છીએ; એ છોકરા તે પકડીને બીજા રહે છે. એની એક ભાજુ જોનારા ને ખીજ ભાજુ નાટકવાળા રહે છે.”

ઉપરી સાહેભ: “શું કહો છો ! ”

મેં કહ્યું “એ જ કહું શું.”

ઉપરી સાહેભ: “વારુ ત્યારે, આપણે આપણું સાળાના અંધા વર્ગમાં નાટકા દાખલ કરીએ. મોટા સાહેભને તો આ વાત બહુ જ ગમે છે. અરેખર, નાટકા સુંદર થતાં હતાં! આપણે પેલાં રેન્ઝિટેશનસની છડાકૂટ કાઢી નાખીએ તો ? ”

મેં કહ્યું: “મેં તો કાઢી જ નાખ્યાં છે ને! આપ હવે કાણે તો.”

ઉપરી સાહેભ: “એમ જ કહીશ. સાહેભ પણ કહે છે કે Be damned cramming ! Yes, I also remember

my days of cramming.^૪ પણ હું તો જરા ભુદ્ધિશાળી છોકરો હતો. એટલે આપણું તો આકું નહિ પડતું. પણ બીજ વિચારા ગોખ્ખી ગોખ્ખીને મરી જતા હતા. Be damned ગોખ્ખુપદ્દી !^૫"

હું મનમાં હસી રહ્યો હતો. "આજે મોટા સાહેભની પદ્ધરામણીથી ભારે કામ થયું ! અખતરામાં આ પણ એક અતુલભવ !"

હું ઘેર જઈ સ્વઈ રહ્યો.

: ૩ :

જમાસિક પરિક્ષા માથે આવી હતી. અન્ય વર્ગમાં પુનરાવર્તન થઈ રહ્યું હતું. ધૃતિષાસ, ભૂગોળ, ગણિત, ભાષા ફરી વાર ગોખ્ખાતાં હતાં-તાજાં કરાતાં હતાં. એક વાર તો છ માસનો અભ્યાસક્રમ પૂરો થઈ ચૂક્યો હતો. મારું ચોતાનું ગાડું તો હજ ક્યાં ય ફૂર હતું; અને પરિક્ષાની દશ્ઠિયે વિચાર કરું તો તો હું ધણે જ પાછળ હતો. આમ છતાં મારે મારા વર્ગની પરીક્ષા તો આપવાની જ હતી. હું પુનરાવર્તન કરાવવામાં વખત ગાળવાનો ન હતો. તે વખત મારે બચવાનો જ હતો. મારું શિક્ષણુકાર્ય છેક સુધી ચાલવાનું હતું, કારણું કે મારા વર્ગમાં જે કંઈ થતું હતું તેનું પુનરાવર્તન વિદ્યાર્થીઓ સ્વતઃ જ કર્યા કરતા હતા. પુનરાવર્તન સ્વયં થાય તેની બોજનાઓ પણ મેં ચોણ હતી. દાખલા તરીકે અંતકડીની રમતમાં તેઓને ક્વિતાઓનું પુનરાવર્તન પુનઃ પુનઃ થયા જ કરતું હતું.

^૪ નાપાક ગોખ્ખુપદ્દી ! હા, મને પણ મારા ગોખ્ખુપદ્દીના દિવસો બરાબર ચાંદ છે.

^૫ ગોખ્ખુપદ્દીનો નાશ થાગો.

પણ હજુ મેં ભૂગોળ, પદાર્થપાડ અને વાકરણુંને સ્પર્શ કર્યો યે કર્યો ન હતો. મને થયું વાકરણુંને ઉપાસું. વ્યાકરણ અધરે વિષય ગણ્ય છે, અને તેમાં વિદ્યાર્થીઓને સીધી રીતે રસ હોવાનું કારણ નથી. ભાગાના પદ્ધતેમાં ચોથા ઘોરણુંના વિદ્યાર્થીને શા માટે રસ હોય! એમાં કબું રસિક તત્ત્વ છે! કર્ઢ વસ્તુ આમંદ વગર તે વખતના જીવનને ઉપરોગી જેવું જીબાન આપે છે! વિદ્યાર્થીને કર્ઢ જગાએ એમ ચાય એમ છે કે વાહ, આમાં તો ગંમન છે! —આ તો ભારે ઉપરોગી! તેથી મેં તો ભારો નિયાર બાંધેકોન છે કે વાકરણનું શિક્ષણ ભાગાશિક્ષણમાં રસ લેતા થઈ ગયેકા જોઈ ડિમરના વિદ્યાર્થીઓ માટે જ હેમ. પ્રાથમિક શાળામાંથી એ વિષય જ નાંકળી જવો જોઈએ. જે વિષય શીખવવામાં અધરે પડે અને જે શીખનારતે કંટાળો આપે તે શા માટે શીખવેઓ! જીબાનના બીજ વિષયો કયાં થોડા છે!

પણ મારે અખતરો તો કરવો જ હતો. કર્ઢ નહિ તો ભારી શરૂત પ્રમાણે પરીક્ષા વખતે મારે તે વિષય પણ સારી રીતે શીખની બતાવેલો દેખાઉંનો હતો. તાત્ત્વિક વિચારને કારણે વ્યવહારને માટે મારા આ અખતરામાંથી તે હાંકી દેવાનો ન હતો. મારે તો આલદા ચોથા ઘોરણુંમાં તે સારી રીતે કેમ શીખવાય તે સમજનવબું હતું.

વાકરણુંનો અભ્યાસક્રમ વાંચી ગયો. મને થયું કે આ કેમે કો આપણે ન ચાલીએ. નામની વ્યાખ્યા, કિયાપદ્ધની વ્યાખ્યા ઝડપ્પે જોખાવાશે પણ બરાબર સમજનવશે નહિ. મને નાનપણુંમાં જ્યારે સમજનવામાં આવતું હતું લારે હું પણ સમજ શકતો ન હતો; આત્મ યાદ જ રાખતો હતો. યાદ રહે તેટલા ઉપરથી શિક્ષકોએ ભૂલ ખાઈ બેસે છે કે તે સમજનવામાં આવેદું છે. મેં ચાલતી રીતને જો નમસકાર જ કર્યા. હું નવી કર્ઢ જીતે વાકરણ શીખવતું? મેં વિચાર કર્યો, ચોજના ધડી અને તેને અમલમાં મૂકી. ખરેખર

વિદ્યાર્થીઓને ભારે મજા પડી. તેઓને મન એક સુંદર રમત થઈ પડી; અને તેઓ એ માસમાં તો નામ, સર્વનામ, વિશેષણ કિયાપદ ને અવ્યયને ઓળખતાં અને વાક્યમાંથી ખતાવતાં શીખી ગયા. તેઓ એકવચન અને બહુવચન, તેમ જ નર અને નારી-જલિનો બેદ પણ સમજ્યા. હું કર્તા અને કર્મને ઓળખાવવાની ચોજના વિચારી રહ્યો હતો, એટલામાં એક વાર અમારા વર્ગમાં વ્યાકરણુંની રમતો ચાલતી હતી લાં મહેરખાન ઉપરી સાહેબ ચડી આવ્યા; અને તેઓ તો એ બધું જોઈજ રહ્યા ! પછી તેઓ બોલ્યા: “છાકરાઓને વળી ગંજુપે ક્યાં ચડાયા ? છમાસિક પરીક્ષા માથે આવી છે તો કંઈક જપાઠો મારો. જેને, આપણું માર્યું ન જય. અખતરો પાર પાડવો છે; ખખર છે ને !”

મેં જરા હસીને કહ્યું: “સાહેબ, એતી મને પૂરેપૂરી ચિના છે; અને આ ચાલે છે તે વ્યાકરણુંની રમતો છે. આપ જરા આ છાકરાઓને વ્યાકરણમાં તપાસશો ?”

ઉપરી સાહેબે એપાંચ સવાલો પૂછ્યા. ગને કહે: “ઓહો ! આ તો સુંદર કામ થયું છે ! આ તમારી આખી ચોજના મારે સમજવી છે. વ્યાકરણ તમે છાકરાઓને આઠલી ગંમત સાથે શીખવતા હો તો બધા વર્ગમાં એજ રીત દાખલ કરીએ. કાલે રજ છે. મારે લાં આવને ને આ અધાં સાધનોથી કેમ કર્યું તે બધું મને સમજવનો.”

*

*

*

ખીને દિવસે મારાં વ્યાકરણનાં સાધનો લઈ હું સાહેબ પણ ગયો. અને મેં મારું કામ પહેલેથી આ પ્રમાણે રજૂ કર્યું.

સાહેબ ! જુણો, આ મારું પહેલું સાધન. આ પૂંડાં પર આ બાળુણે નર અને આ બાળુણે નારીજલિના શાખાનો લખ્યા છે. માથે નરજનિ, નારીજલિ એમ લખ્યું છે. આપ જેશો કે આ

પૂંડાઓમાં નિયમિત નારીજલતિના અને આમાં અનિયમિત નારીજલતિના શબ્દો છે. મારું પ્રથમ કાર્ય આ પૂંડાં છોકરાઓને વાંચવા આપવાતું છે. તેઓ તે વાંચે છે, ખૂબ વાંચે છે, આવાં જેટથાં પૂંડાં આપો તેટલાં વાંચે છે! અહીં તેમને જતિના સંઝેનો પરિચય થાય છે. માથે લખ્યું છે નરજલતિ, નારીજલતિ; તેથી શબ્દોની જતિ તરફ કંઈક વિચાર જાય છે. પણ પ્રથમ તો જતિ શબ્દોનો પરિચય જ થાય છે.

પણ પણી મેં એક હિવસ તેમને કહ્યું: “બળદાની નારી કર્યા? ” તેઓ કહે: “ગાય.” “સિહની? ” “સિહણુ.” “છોકરાની? ” “છોકરી.” “ડોસાની? ” “ડોસી.” “કૂતરાની? ” “કૂતરી.” “મોરની? ” “ઢેલ.”

મારી યોજના આઆદ સફળ નીવડી. પરિચયથી તેમનામાં વિચાર રક્ખેરી હતો. શખ્ષદપરિચયથી તેમનામાં જીાન જગ્યું હતું.

મેં કહ્યું: “ચાલો એક રમત રમીએ. હું નરજલતિ લખ્યું, તમે નારીજલતિ લખો.” મેં નરજલતિ વાચક શબ્દો લખાવવા માંડ્યા અને સાથે તેઓ નારીજલતિ શબ્દો હેંશે હેંશે લખવા માંડ્યા; અને તપાસું છું તો થોડી જ ભૂલો! —થોડાની જ ભૂલો!

મેં કહ્યું: “ચાલો, એક ધીજુ રમત ખતાવું. આ પેરીઓ છે. આમાં નરજલતિ છે, આમાં નારીજલતિ છે. નરની નારી જતિ શોધો, અને નારીની નરજલતિ શોધો.”

છોકરાઓ એ રમત કેટલાં ય કલાકા સુધી રમ્યા.

ઉપરી સાહેખ: “પણ એક પેરીમાં બધા શી રીતે રમે?”

મેં કહ્યું: “એ મારે તો મારે એક રસ્તો કાઢવો પડ્યો હતો. વર્ગમાં મેં દસ આ આખુ ને દસ સામી આખુ કૂંડાળાં કાદ્યાં હતાં. આ તરફનાં દસમાં નર શબ્દો અને સામે નારીના શબ્દો મૂક્યા હતા. એક એક કૂંડાળે એક એક વિદ્યાર્થી બેડો. ચોતાતો

જીબન લઈ તેતી નારી શોધવા તે જ્યા અને જ્યાંથી મળે ત્યાંથી શોધી લાવી નરનારી સાથે મુકે. એમ દરેક કૂંડળા પાસે નરનારીનાં નોડકાં ચાય. બધા શખ્ફો ખલાસ ચાય એટલે રમત ફરી વાર ચાલે. એ છાકરાઓને જ રમવું હોય તો એક એંક પેણી રાખી નરની નારીજાતિ ને નારીની નરજાતિ શોધે.”

ઉપરી સાહેબઃ “સમજયું. આ તો ગંમત આવે તેવું છે. પણ નાન્યતરનું શું કહ્યું ?”

“હા. નરનારીને સારો પરિચય થયો. એટલે એક વાર પાઠિયા પર ‘નાન્યતર જાતિના શખ્ફો’ એમ કરીને યાદી મુકીઃ લોફડર, ટેઅલ, પાટિયું, ડસ્ટર વગેરે વગેરે. છાકરાઓ બાંચી ગયા. પણ મનમાં વિચાર કરતા નોવામાં આભ્યા કે આની જાતિ કઈ હો ? તેઓના પરિચયમાંથી ઉત્પન્ન થયેલી સમજખૂને લીધે આતે નિર્ણય થઈ શકતો ન હતો. મેં કહ્યું : ‘આ શખ્ફો નાન્યતર જાતિના છે.’ અને પાઠિયા પર ‘નાન્યતર જાતિ’ એમ લખ્યું.

એક વિદ્યાર્થી : “પણ નાન્યતર એટલે ?”

મેં કહ્યું : “નર નહિ, નારી નહિ તે નાન્યતર.”

છાકરાઓનાં મેં પર સમજખું હેખાઈ. મેં તરત જ કહ્યું : “દ્વારો શખ્ફો. તણું આનાં પાડોઃ એક નરનું, એક નારીનું, અને એક નાન્યતરનું.”

સાડ શખ્ફો લખાયા ને મને પણ નવાઈ લાગી કે લગભગ મોટા ભાગની કોઈ કોઈ જ ભૂલ હતી. મને થયું કે બ્યાખ્યાણયાખ્યામાં પ્રથમ ન પડતાં પરિચય આપવો એ સુંદર રીત છે. તેમને રમતોથી પરિચય કરાવી શકાય છે. ધીમે ખીમે તેમને તેની શાસ્ત્રીય ભાષા આપવી.

ઉપરી સાહેબઃ “પણ તમે કેવો, કેણી, કેવું એમ બતાવ્યું હોત તો ?”

મેં કહ્યું: “તે rule of the thumb થાત: ખાકી ગોખણું. તે વગર સમજણુંની વાત થાત. હવે તેઓને ગંમતની ખાતર કેવો, કેવી, કેવું એ પરીક્ષાઓ બતાવી શકાય.”

ઉપરી સાહેબ: “વાનુ; પછી આગળ કહો.”

મેં કહ્યું: “પછી મેં વચ્ચેનો લીધાં: એકવચન, બહુવચન. તે પણ ઉપરની જ રીતે.”

ઉપરી સાહેબ: “એમ! એમાં પણ રમતો જ ચલાવી?”

મેં કહ્યું: “હા જી. એકવચનવાળો બહુવચનને શાધી લાવી જોડી કરે.”

ઉપરી સાહેબ: “એ તો ઢિક; પણ તમે નામ, કિયાપદ વગેરે શી રીતે શીખ્યું, એ કહો જોઈ એ?”

મેં કહ્યું: “જુઓ. પ્રથમ મેં કિયાપહો લીધાં. વિદ્યાર્થીઓને વાંચતાં તો આવડે જ છે. મેં તેમને સમજાવ્યું કે જેમ પાઠ્યા પર લખ્યું તેમ કરવું. લખ્યા પ્રમાણે કિયા કરવી. હું કિયા લખીશ, તમારે કિયા કરવી. જેના તરફ આંગળી ચીંધું તે કરે.

મેં પાઠ્યા પર લખ્યું: ‘ભડો’, ‘એસો’, ‘દ્રાડો’, ‘સ્ફો’, ‘રમો’, ‘ચાલો’, ‘નાચો’, ‘વાચો’, ‘ઘોલો’, ‘હાલો’, ‘દ્રાડો’, ‘પડો’, ‘ફૂદો’, ‘ટુડો’, ‘ઘીઓ’, ‘ડેલો’ વગેરે.

આ સાદી કિયાઓ કરવામાં છોકરાઓને ભારે મળ પડી. તેઓ કહે: “વધારે લખો.” હું આવા શખ્દો વિચારતો ગયો. ને તેઓ તે પ્રમાણે કરતા જ ગયા. બીજે દિવસે મેં એક કાર્ડ પર લખ્યું: ‘થોડાંએક કિયાપહો:-ભડો, એસો, દ્રાડો’ વગેરે. સૌંદર્ય વાંચ્યું ‘થોડાંએક કિયાપહો.’ નીજે દિવસે હું એક ડાખલી લાગ્યો. તેની ઉપર લખ્યું હતું ‘કિયાપહોની ચેરી.’ છોકરાઓએ ઉધારી ને તેમાંથી કિયાપહો લીધાં; નાચો, ફૂદો, ભાગો, મારો, પડો અને

તેઓ તેમ કરવા લાગ્યા. પછી મેં કહ્યું: “થોડાંએક કિયાપદો લખી લાવો જોઈએ ?” તેઓ થોડાંએક શોધી લાગ્યા.

મેં એક બીજી રમત કાઢી. મેં તેમને કહ્યું: “જુઓ, હું કોઈને કંઈ કરવાનું કહીશ. પછી તે શું કરે છે તે પાઠિયા પર લખને.” જગળવનને મેં કહ્યું: “દોડા.” તે હોયા. મેં પૂછ્યું: “શું કરે છે ?” એક જણુ કહે: “દોડે છે.” બીજાને પૂછ્યું: “કઈ કિયા કરે છે ?” તે કહે: “દોડે છે.” પછી મેં છોકરાએ પર દોડા, ઝોડા, લખો, વાંચોના હુકમો છાજા અને બીજાએને તેઓ શું કરે છે તે પાઠિયામાં લખવા કહ્યું. જેયું તો તેઓએ બરાબર લખ્યું હતું. અલખતી ડોઈ ડોઈ સમજતા ન હતા તેથી લખી શક્યા ન હતા. ડોઈ એ કયાં ય કયાં ય ભૂલો પણ કરી હતી.

મેં એજ ઘોરણે કહ્યું: “હવે જે ડોઈ કંઈ કરે તેણે શું કહ્યું તે લખો.”

જગળવનને કહ્યું: “દોડા.” તે હોયા અને બોધોએ ‘દોડા’ એમ લખ્યું.

આમ રમતો ચાલી. તેઓને અંદર અંદર રમતો રમવાની અને લખવાની છૂટ આપી. ખૂઅ ઉત્સાહથી તેઓ રમતા હતા.

પછી મેં તેમને એક હિવસ બેસાદ્યા ને કહ્યું: “રામજી હોડે છે ત્યારે હોડવાની કિયા કરે છે, ખરું ?” તેઓ કહે: “હા.” “ત્યારે શામજી લખે છે ત્યારે શાની કિયા કરે છે ?” “લખવાની.” આમ મેં તેમને લીધા. એવી જ રીતે શામજી હોયા [ત્યારે શાની કિયા કરતા હતા, વગેરે સવાલો પૂછ્યા ને ઉત્તરો લીધા. પછી મેં પાઠિયા પર લખ્યું: “દોડે છે, દોડા, એલે છે, ચાલ્યા, આ ખધાં કિયાપદો છે; એમાં કંઈક કરવાનું છે.”]

છોકરાએએ વાંચ્યું ને તેઓએ હા કહી.

ઉપરી સાહેખ કહે: “પછી ?”

પણ મેં તેમને કહ્યું: “લખી લાવો હાથ આવે તેટલાં કિયાપહો.” તેઓએ જ્યાં કિયાવાચક શરૂદો બાળ્યા ત્યાંથી તે લીધી. પાઠી આપી લરી દીધી.”

ઉપરી સાહેબ: “પછી ?”

“પછી મેં એક ખીજુ રમત લીધી. પાટિયા પર વાક્ય લખ્યું: ‘રામજી હોડે છે; ચંપક વાંચે છે.’ ને કહ્યું કે આમાંથી કિયાપહોને રાખો ને ખીજું અગાડી નાખો; અને છોકરાઓએ આખાઈ સાચું કર્યું. પત્યું. ત્યાં મેં તે વખતે કિયાપહોને પાઠ અટકાવ્યો.”

ઉપરી સાહેબ: “મને લાગે છે કે આ રીતે જરૂર તેમને આવડે. પણ તેઓને વખત ધણો જય ને રમતો રમવી પડે.”

મેં કહ્યું: “રમતો રમવામાં તો મળ આવે છે, ને થોડો વખત અગાડવો ને પરિણામે તેના કરતાં જરા વધારે વખતને સુધારવો એ શું સારું નથી ?”

ઉપરી સાહેબ: “એ તો હીક. વારુ, નામનું શું કર્યું ?”

મેં કહ્યું: “નામનું કામ મેં આ પ્રમાણે લીધું. પ્રથમ તો મારી રીત પ્રમાણે મેં નામોનાં પૂંડાં ટીંગાઓં: નામો, નામો, નામો. છોકરાઓએ પુષ્કળ શરૂદો વાંચ્યા. વારંવાર વાંચ્યા. નામોની યાદીમાં ખૂબ વિવિધતા હતી, અને એ વિવિધ નામો અમૃક સમૃદ્ધાં રચી તેમાં ગોઢવેલાં હતાં, એટલે તેનું વાચન સર્વને એક આનંદદાયક કાર્ય થઈ પડ્યું. વિદ્યાર્થીઓને ખરર ન પડે તેમ મારે આવું શરીરવલાનું હોય છે. તેઓ હવે કિયાપહોનાં અને નામોનાં પૂંડાંમાંથી નામોને જુહાં પાડતા હતા. આ રીતે એ વર્ગને જુદા પાડવાનો પરિચય વધતો હતો.”

મેં તેમને એક વાર બેસાખા ને કહ્યું: “જુઓ, હું મંગાવું શું. શું ? હું કંઈ કહેતો નથી. માત્ર જેને નામ હોય, જેનું

કંઈ નામ હોય તે લઈ આવો, ઉપાડી લાવો. જઈને પૂછજો,
‘તારું નામ શું?’ નામ હોય તો લાવનો.”

છોકરાઓ સમજ્યા. તેઓ ઉપડ્યા. પાટિયાને કહે: ‘તારું
નામ?’ પોતે જ કહે: ‘પાટિયું.’ ‘આદો ત્યારે.’ પાટિયું આગ્યું.
ટેબલ આગ્યું. પથરો, લાકડી, ધૂળ, કાગળ, ચોપડી, પાણી, ચેન,
ડાખલી, જે ને તે થવા માંડયું બેગું. એક જણું તો ભાજુના
વર્ગના છોકરાને ઉપાડીને લાગ્યો ! મેં કહ્યું: “આ શું? લાવનાર
કહે: “એને નામ છે.” ડાઈ કહે: “સુરજ શી રીતે લાવવો?”
કોઈ કહે: “લીમડો નથી લવાતો.” હું સમજ્યો કે આ લેડો
મનમાં મનમાં નામનો અર્થ સમજ્યા લાગે છે.

આ રમત ચાલતી હતી તે દરમિયાન હું નામોની
કાપણીઓની પેટી લાગ્યો. ઉપર ‘નામો’ લખ્યું હતું. અંદર
પાંચસો નામો હતાં. બધાં નામો જ નામો. છોકરાઓ હવે ટેવાઈ
ગયા હતા. પેટી કાઢીને મૂડી મૂડી નામો ઉપાડી ગયા ને વાંચી
નાખ્યાં. મેં એમાં બધી જતનાં નામો નાખ્યાં હતાં. ડાઈ કહેતું:
“આ રતાશ નામ શી રીતે?” મેં પૂછ્યું: “ત્યારે આ લાલાશ
દેખાય છે એને કયું નામ આપીશું?” છોકરા હસીને પાણે જતો.

પછી મેં નામો તથા કિયાપહોની પેટીઓ લેગી કરી નાભી,
અને નામ તથા કિયાપહોને ધૂટા પાડવાનો ધૂંઘો-રમત બતાવી.
તે સુંદર ચાલી. તે વખતે નામનો અને કિયાપહોનો મનમાં એડેલો
ખ્યાલ તેઓ સારી રીતે બતાવી શકતા હતા.

પછી મેં તેમને એક બીજી રમત બતાવી. કિયાપહોને લાયકનું
નામ એણાખવાતી અને નામને લાયક કિયાપહોન એણાખવાતી.
‘દોડો’ શબ્દ લઈ ‘હોડે છે’ કે ‘હોડ્યો’ શોધાય, ‘આય છે’
શબ્દ લઈને ‘રામજી’ શોધાય, વગેરે સમજાવ્યું; અને શોધેલા
શર્જનોને ગોઠવીને મૂકવાતું બતાવ્યું. આ કામ પણ ચાલ્યું.

પછી મેં શું કર્યું ? મેં વાક્યો પાઠિયા પર લખ્યાં ને
છોકરાઓને કહ્યું: “આમાંથી નામો અને કિયાપહો પાઠીમાં લખો.
આમાંથી નામો બોલો. આમાંથી નામો બતાવો. આમાંથી નામો
જુસો. કિયાપહો જુસો. આને શું કહેવાય ? ” વંગરે.

અણીં છોકરાઓને નામ અને કિયાપદ્ધતું પૃદ્ધચેદ આવડયું.

ઉપરી સાહેબ: “સાચી વાત છે. ખરેખર ! એક ક્ષણું પણ
છોકરાઓને મહેનત નહિ પડી હોય; પણ જરા સાધનનો ખર્ચ
પડે એવું છે, અને તમારા જેવી જરા હૈયાઉકલત જોઈએ.”

મેં કહ્યું: “સાહેબ, છોકરાઓને ગોઢણુપદ્ધીમાંથી બચાવવા મારે
આટણો ખર્ચ કરવો પડે એમાં કાર્ય નથી. આ બધું તો મેં મારા
ધરને ખર્ચ કર્યું છે. જૂનાં પૂડાં શોધી ચેતીએ. કરી ને ધરમાં
આડાઅવળા પડેલા કાગળા ઉપાડી તેની કાપલીએ. કરી.”

ઉપરી સાહેબ: “આ ખર્ચ તમને મળે તેવી ગોડવણુ કરીશ.”

મેં કહ્યું: “આ ખર્ચ મળે તેવી ગોડવણુ કરતાં આ પદ્ધતિને
આપ સ્વીકારો તો મારો ખર્ચ લેખે લાગે.”

ઉપરી સાહેબ: “વારુ, જોઈશું; પણ પછી શું કર્યું ? ”

મેં કહ્યું “સાહેબ, પછી વિરોધણું કામ શરૂ કર્યું. પણ
આપને કંટાળા ન આવતો હોય તો જ આગળ વાત કરું. એક તો
વાકરણુનો વિષય ને એમાં લાંબી લાંબી માંડીને વાત કરવાની
મારી ટેવ.”

ઉપરી સાહેબ: “પણ પ્રયોગની વિગતો જણાવવી જોઈએ ને!
વિગત ન વિચારીએ તો તો પૂરેપૂરો ઝ્યાલ જ કેમ આવે! વારુ,
થોલો. આ ચા આવી છે તે પીધા પછી આગળ ચાલીએ.”

સાહેબ એમ તો શોખીન હતા. ચા જોંચી જતની પીતા હતા.
મારો અંગત શોખ પણ જાણુતા હતા. પૂરી વીસ મિનિટ ચા

પીવામાં ગાળો. પછી તો અમે જરા લહેરમાં આવ્યા ને વાત આગળ ચાલી. ૫

મેં કહ્યું: “છોકરાઓની પાસે મેં ભારા રિવાજ પ્રમાણે વિશેષણોનાં પૂઠાં મૂક્યાં. પૂઠાં ઉપર વિશેષણો વિશેષણો. હવે તેમનો રસ વધ્યો હતો. તેઓ વિશેષણો વાંચતા હતા. એક પૂછ્યું: ‘ભાઈ, વિશેષણ વળી શું ?’ મેં કહ્યું: ‘જુઓ ને એ બધાં વિશેષણો છે ! એ વિશેષણો.’ તેઓ મનમાં મનમાં તેને અર્થ સમજતા જતા હતા. પછી પાછી રમતો શરૂ થઈ. વિશેષણ, નામ અને ક્રિયાપદોનાં પૂઠાં વાંચવાની ને જુદાં પાડવાની.

પછી મેં એક નવી રમત આપી: “જુઓ છોકરાઓ, હું મગાવું તે લાવો.”

“પેન્સિલ લાવો.”

છોકરો એક પેન્સિલ લાગ્યો.

“રાતી પેન્સિલ લાવો.”

રાતી પેન્સિલ લાગ્યો.

“પીળી પેન્સિલ લાવો.”

પીળી લાગ્યો.

“પેન્સિલ મૂકી આવો.”

છોકરો કહે: “કઈ ?”

મેં કહ્યું: “રાતી.”

પછી કહ્યું: “પીળી, ભૂરી, ગુલાભી, લાંખી, ટૂંકી” વગેરે.

વળી પાડ આપ્યો. “એકાદ પેન્સિલ ઉપાડો.”

૫ વાંચનાર થાકે તો આહોં ચા પીને આગળ વાંચવાનું સૂચન નથી!

કોઈ પેનિસલ ઉપાડવામાં આવી.

“હવે ખાસ લીલી ઉપાડો.”

લીલી ઉપાડી.

“હવે ખાસ પીળા ઉપાડો.”

પીળા ઉપાડી.

“હવે ખાસ લાંખી ઉપાડો.”

લાંખી ઉપાડી.

મેં પૂછ્યું: “ખાસ કર્ય પેનિસલ લીધી ?”

“લીલી.”

“ખાસ કર્ય લીધી ?”

“પીળા.”

“ખાસ કર્ય લીધી ?”

“લાંખી.”

મેં પાઠિયા પર લઘ્યું: “આ ખાસ શબ્દો —આ વિશેષજ્ઞો —કંઈક ખાસ બતાવે છે: કંઈક વિશેષ વધારે બતાવે છે.”

છોકરાગોળો વાંચ્યું ને તેમને કંઈક વિચાર થયો હશે.

મેં નામ અને વિશેષજ્ઞની પેટીગો કાઢીને રમત બતાવી: “નામનું વિશેષજ્ઞ શોધો અને વિશેષજ્ઞનું નામ શોધો.” છોકરે ‘રાતો’ શબ્દ લીધો ને નામની પેટીમાંથી ‘ઘોડો’ શબ્દ કાઢ્યો અને ‘ગાતો ઘોડો’ ગોડનીને મૂક્યું. વિશેષજ્ઞ અને નામના ડગલાઓમાંથી જોડકાં બનવા લાગ્યાં. હું તો જેતો હતો અને ફરતો હતો. કોઈ કોઈ જોડકું ઓઢું પડતું હતું.

પછી તો મેં મારી જુદી જુદી રીતે વિદ્યાર્થીઓને તપાસી જેયા. તેઓ વિશેષજ્ઞનો અર્થ મનમાં સમજેલા હતા. તેથી ઝડ્ધને બરાબર નાગ કે વિશેષજ્ઞ જોળી જ કાઢતા હતા.

ઉપરી સાહેબ કહે: “તમે તો ગંમત કરી છે! નામ, વિશેષણું ને કિયાપદને ચુંદર રીતે એળખાવ્યાં. વારુ, વ્યાખ્યા આપશો કે નહિ?”

મેં કહું: “વ્યાખ્યા તો અપાઈ ગઈ છે ને! બાકી વ્યાકરણું ચુંદર આપેલી વ્યાખ્યા હું નહિ શીખવું, અને આપે પરીક્ષામાં તેવું પૂછવું ન જોઈએ. આપ પદ્ધતે પૂછનો.”

ઉપરી સાહેબ કહે: “મારે આ વિષયની પરીક્ષા નથી બેચે. મારે તો આ રીત આપી શાળામાં દાખલ કરવી છે. છોકરાએ વ્યાકરણ ગોખી ગોખીને મરી ગયા.”

મેં કહું “સાહેબ, વ્યાકરણ શીખતાં તો મારો વાંસો ફાડી ગયો છે. અમારા માસ્તર સાહેબ અમને ન આવડતું ત્યારે ફિટકારતા.”

ઉપરી સાહેબ કહે: “તે હજ કયાં મારતા નથી?”

મેં કહું: “તો પછી આપ તે બંધ ન કરો?”

ઉપરી સાહેબ: “એ તો જણે મારા હાથમાં છેક ન ગણ્યાય; ન ગણ્યાય પણ ખરું. વળી હજ મારો મત...પણ આપણે સારી રીતે ભણ્યાનીએ તો માર મારવાનું એની મેળે જ અટકે. જીએને, તમારે વ્યાકરણ શીખવતાં કોઈને મારવું પણું? પણ કહો જોઈએ, સર્વનામનું શું કર્યું?”

મેં કહું: “એમાં વળી ખીજું શું હોય! એક નાંતી સરખી રમત. મેં સમજાવું: ‘હું એટલે ડોણું?’ તેઓ કહે: ‘લક્ષ્મીરામભાઈ.’ ‘ત્યારે તમે એટલે ડોણું?’ શામળ કહે: ‘એટલે હું શામળ.’ મેં કહું: ‘પેદો ડોણું છે?’

આ સવાલો પૂછી મેં પાઠિયા પર લગ્યું:—

હું—લક્ષ્મીરામ.

તું—શામળ.

તે—ધનજિ.

અમે—હું લક્ષ્મીરામ, ભીમજી, શામજી, ધનજી.

તમે—રવજી, લવજી, નિકમ, દેવજી.

તોઓ—પેદા ત્રીજી વર્ગમાં છે તે મોનજી, મૂળચંદ, લખમર્થી, ઇપસિંહ.

છોકરાઓએ વાંચ્યું. મેં કહ્યું: “આ હું, હું, તે જ્યાં સર્વનામ કહેવાય.”

એક કહે: “સાહેય, સર્વનામ એટલે શું ?”

મેં કહ્યું: “તમે વિચાર કરોને ?”

ખીને કહે: “સાહેય, મારું એટલે લવજીનું, એમ ને ? લક્ષ્મીરામબાઈનું એટલે તમારું, એમ ને ?”

ત્રીજી કહે: “સારે મારું, તારું તમારું એ પણ સર્વનામો કે નહિ ?”

મેં કહ્યું: “એ પણ ખરાં.”

પાંચમો કહે: “પણ સર્વનામ અટલે શું ?”

મેં પાઠિયા પર લખ્યું:—

રામજીના હાથમાં પાઠી છે.

રામજીના હાથમાં પેન છે.

રામજી ખાલખું છે.

રામજી લાણે છે.

રામજી રોજ વહેલો આવે છે.

લક્ષ્મીરામ તમારા માસ્તર છે.

લક્ષ્મીરામ તમને લાણું વે છે.

લક્ષ્મીરામ તમને ફરવા લઈ જાય છે.

સૌઓ વાંચ્યું. મેં ખીન વાક્યથી ‘રામજી’ કાઢીને ‘તે’ મૂક્યું.

‘લક્ષ્મીરામ’ કાઢીને ‘હું’ મૂક્યું ને કિયાપદમાં ફરફાર છે.

છોકરાગોંગે વાંચ્યું ને તેમનું મગજ ચાલ્યું. મેં પૂછ્યું: “કહો,
સર્વનામ કોને ઠોક્કે ભર્કતું?” હોઈ કહે ‘રામજીને.’ હોઈ કહે
‘લક્ષ્મીરામભાઈને.’

મેં પૂછ્યું: “રામજી, લક્ષ્મીરામ, એ નામ છે કે કિયાપદ?”

“નામ.”

“સારે રામજી, લક્ષ્મીરામ એ નામને બહલે જે આવે તેને
શું કહીશું?”

“સર્વનામ”

ઉપરી સાહેબ હસ્યા: “તમે માસ્તર તો પક્કા લાગો છો! અધું વિગતથી બરાબર ચીકણા થઈ ને વણુંવો છે.”

મેં કહ્યું: “તે હવે કેમ મરી જવારો! વક્તીલ હોત તે
દૂંકમાં પતાવત.”

ઉપરી સાહેબ હવે થાક્યા હતા; જોકે તેમને રસ પદ્ધો હતો.
પણ મેં પછી રજ માગી અને તેમણે આપી. તેમણે કહ્યું:
“તમારી પરીક્ષામાંથી બ્યાકરણું બાદ કરવામાં આવે છે. પણ
હજી કાળ અને વિભક્તિઓનું કામ કરવાતું છે. તે થઈ જય લાય
એક વાર વાત કરી જને. મારે આવતે વર્ષે આ બાયતમાં
કંઈક જરૂર કરવું છે.”

હું પણ થાક્યોપાક્યો વૈર આગ્યો ને પડી રહ્યો.

: ૩ :

જમાસિક પરીક્ષાના દિવસો આબ્યા. ઉપરી સાહેબ પોતે જ
તપાસ કરવા આવવાના હતા. સાહેબ પરીક્ષાના શોખીન હતા.

મેં મારા વર્ગની તૈયારી કરી રાખી હતી; પણ તે અલંકત
મારી રહે. મેં માગી લીધું હતું કે આપી શાળાની પરીક્ષા
થઈ જય પછી જ મારા વર્ગની પરીક્ષા લેવાય. મારા વર્ગની
પરીક્ષા વખતે સૌ શિક્ષકભાઈઓ તથા હેડમાસ્તર સાહેબ હાજર

રહે. મેં એમ પણ માગ્યું હતું કે મારા વર્ગની પરીક્ષા વખતે દરેક વર્ગના પાંચ પાંચ છોકરાઓએ તાં જેસે.

પરીક્ષાને દિવસે મારા મનમાં શાંસિ હતી. કાળજું ધડકતું ન હતું. મારા મનમાં પાસ નાપાસનો પ્રશ્ન ન હતો. મારા અનુભવ પ્રમાણે તો ચિંતા કરવાનું કારણ ન હતું. વિદ્યાર્થીઓને કહેલું જ હતું કે “આપણે જે બધું રોજ રોજ કરીએ છીએ તે આજે પણ કરવાનું છે. પરીક્ષામાં તો બધા પાસ જ છે. આજે તો આપ્ણાખું કામ જેવા માટે સૌને નોતર્યા છે.”

મારી નાટકી રીત પ્રમાણે મેં પડદા પાછળ સૌ ગોડબ્યું હતું. આગળના ભાગમાં સૌને બેસાર્યા પછી મેં પડ્યો ઉપાડ્યો.

તાં હાજર રાખેલા ખીજન વર્ગના છોકરાઓની મંડળાઓ પાડેલી હતી. દરેક મંડળાને મારા વર્ગનો વિદ્યાર્થી વાર્તા કહેતો હતો. વાર્તા કહેવાનું કામ વારાફરતી ચાલ્યું. દરેક વિદ્યાર્થીએ પોતાની વાર્તા પસંદ કરી હતી. વાર્તા ભૂલી જય તો જેવા માટે ચોપડી પાસે રાખી હતી. તે પોતાની ઢેરે પોતાને ગમતી વાર્તા વિદ્યાર્થીઓને કહેતો હતો અને ઉદ્વારી રીતે તે સાંભળનારતી સાથે કહેવાની ગંમત લઈ રહ્યો હતો. તેને જરૂર વાર્તા કહેતાં આવડતી હતી. છટાથી, ભાવથી, અર્થ સમજુને તે વાર્તા કહેતો હતો સાંભળનારા બરાબર સાંભળતા હતા. વાર્તા પૂરી થઈ. સૌ શિક્ષકો એકખીજ સામે નેર્ઝ રહ્યા. મેં કહ્યું: “આ મારી એક પરીક્ષા.”

એક શિક્ષક ખીજને કાનમાં કહ્યું: “શાની ?”

મેં સાંભળ્યું ને કહ્યું: “ભાષા ઉપરના કાખૂતી, વાર્તાકથનની આવડતની, સ્મૃતિવિકાસની, અભિનયની.”

બધા શિક્ષકો ખીજ પરીક્ષાની રાહ જેતા ઐઠા.

ચેલો પડ્યો પાછો ઉપાડ્યો ને સૌ રેખળાકારમાં ઐઠા હતા. સામે પાઠિયા પર લખ્યું હતું: ‘અંતકડીની રમત.’

એક કવિતા ગાઈ. પછીનાં તેના છેલ્લા અક્ષર ઉપર બીજી ગાઈ. એમ આખું વર્તુણ પૂરું થયું. વળી પાછી અંતકડી ચાલી.

ઉપરી સાહેબ કહે: “સામસામે કેમ ગોડવ્યા નથી? મંડળા જોઈએ ને?”

મેં કહ્યું: “ના જી, મેં તે કાઢી નાખેલું છે. એમાં હારળત આવે છે. એમાંથી સ્પર્ધા અને ધર્ષા જન્મે છે. આમાં એકને ન આવડે તો તેની પછીનો ઉપાડે છે ને કામ આગળ ચાલે છે. એક વાર કદાચ નથી સુઝતું તો બીજી વાર આવડે છે.”

ઉપરી સાહેબે દાઢી ખંજવાળી ને આંખો મટમટાવી.

છાકરાએને બેસાર્યા હતા તો થોડી વાર રમવા; પણ તેમને તો ખૂબ મજા આવી ગઈ એટલે તેઓને તો ધંટડી વાગી પણ બેઠું ગમે નહિ. મેં થોડી ભિનિટ વધારે આપીને પડ્દો પાડ્યો.

મેં પડા બહાર આવી કહ્યું: “આપ જેશો કે પાડયપુસ્તકની અંદરની કેટલી બધી કાયપંકિનો તેમને બરાબર યાદ છે. કવિતાના વર્ગમાં આ રમત હું રોજ ચલાવતો આવ્યો છું.”

ઉપરી સાહેબે કહ્યું: “Hear, Hear! (સાંભળો, સાંભળો!)”

પાછો પડ્દો બધાયો. વર્તુણમાં સૌ વરતકિઅણા નાખતા હતા. ભારે ઉત્સાહ હતો.

ઉપરી સાહેબ: “ઓહો! આ તો વરતો ને ઉખાણ્યા! મેં નાનપણુમાં સાંભળેલાં, પણ તે અભ્યાસક્રમમાં ક્યાં છે?”

મેં કહ્યું: “જી, અભ્યાસક્રમમાં ભાષાશિક્ષણ છે. અભ્યાસક્રમ પાછળ જિજ્ઞાસા, વિકાસ અને જ્ઞાનવૃદ્ધિ છે. વળી આ છાકરાએ તો આ રમત પર ગાંડા છે. કેટલાં બધાં વરતો તેમને આનંદ છે! ને દરેક વરતમાં કેટલું મહત્ત્વ છે! આજે તે અભ્યાસક્રમમાં નથી છતાં તે મેં લીધાં છે; પણ મને આશા છે કે આનતા વર્ષમાં આપ એને અભ્યાસક્રમમાં સ્થાન આપશો.”

ત્યાર પછી અમે શબ્દોની રમત ચ્યાલાવી. એક શ્વર્ણ બોલે તેના છેડાના અક્ષર પરથી ભીજે શબ્દ બોલાય; તેના છેડા ઉપરથી તીજે શબ્દ બોલાય. આ રમત આમ તો સહેલી હતી પણ જ્યારે એમ જખાયું કે ડાઈ એક વિદ્યાર્થીએ જામેનાં, ડાઈએ નદીએનાં, ડાઈએ કુંગરનાં, ડાઈએ મુસલમાનનાં, ડાઈએ હિનુનાં, ડાઈએ સોકરણુનાં, ડાઈએ આલખુનાં તો ડાઈએ વાખ્યાનાં એવાં જ નામો બોલવાનું પોતપોતાને માટે નક્કી કરી રાખ્યું હતું ત્યાર સૌને તે રમત વધારે ગમી.

મેં મારા શિક્ષકભાઈએને કહ્યું: “આ રમત માટે ધખા ધખા શબ્દો મલે તે માટે હું છોકરાએને કહું છું કે તમે નક્ષા અને શબ્દકાશ વગેરે ચોપડીએ ઉપર નજર ફેરવતા રહેશો તો ધખા શબ્દો હાથમાં જ રમ્યા કરશો. ધણી વાર છોકરાએ રમત રમવાને બદલે જતજતના શબ્દો—જુદા જુદા વર્ગના શબ્દો એકઠા કરવામાં ધણો વખત કાઢે છે. બધા એકખીજાને શબ્દો સંલારી આપે છે ને ડાઈ ડાઈ તો શબ્દો લખી લે છે.”

ઉપરી સાહેય કહે: “આ રમતની પાછળ ધખું તરત હેખાય છે. આવી જતની બધી રમતો ઝુદ્ધિસક્તિ અને સામાન્ય ગુન વધે તે માટે દરેક વર્ગમાં અવસ્થ ફાખલ કરવી જોઈએ.” મારી સામે ખાસ નજર કરી તેમણે કહ્યું: “તમે પણ ટીક નવું નવું જિલું કરો છો !”

ડાઈ શિક્ષકે ભીજાને ઉપરી સાહેય ન સાંબળે તેમ કહ્યું: “તે એવા ધંધા કરવા તો અહીં એ આવ્યા છે. એમને ક્યાં અણુવવું છે! આ તો મળ છે મળ! આપણું ભણ્યાવીને માથું પાડે છે ને આમાં તો ગંમત સિવાય ભીજું કયાં છે!”

ભીજે કહે: “હવે જૂતા અણુતરને બદલે આ નવા અણુતરનો જમાનો આવ્યો. હવે એ દિસ્સો તો ગયા—કડ કડ જોલી જરું, ને

ગરથ ગાંડી ને વિદ્યા પાડે. હવે તો અખુતા માટે રમતથભત રહી. બાકી આગળ ઉપર તો થાય તે ખરું. હવે ડાર્થનું મનજ અખુતામાં નથી. રમત રમાડીએ તો સૌંને સારા લાગીએ.”

મારું લક્ષ મારા વિદ્યાર્થીએનું કામ બતાવવામાં હતું એટલે હું ઉપરની વાતચીત સાંકળી શક્યો નહિ પણ પાછળથી ડાર્થએ મને તે કહેલી.

મેં સીરી મારી એટલે બધા છોકરાએ હાથમાં સાવરણી લઈ હારયાંધ તેલા રહ્યા. તેમને મેં સાવરણી સાથે કસરત કરવી. પછી મેં તેમને ચારેકાર વાળી નાખવાનો હુકમ કર્યો. તેઓ આખી શાળા ફરતા ફરી વળ્યા. જ્યાં તેમણે કચરો હીઠા ત્યાં તેમણે સાવરણી ફેરની; અને જે કચરો એકઠો થયો તે એક ટાપ્લામાં ભરી અમારી સામે હાજર કર્યો.

ઉપરી સાહેય તથા શિક્ષકભાઈએ આ ધાંધલ નોઈ રહ્યા હતા. આ અમારા વર્ગના વિદ્યાર્થીએની પરીક્ષા હતી. ઉપરી સાહેય પૂછ્યું: “સાવરણી સાથે ડ્રિલ શા માટે કરવી એનથી સમજાતું.”

મેં કહ્યું: “હમણું તો દેશની અંદરી એજ મોટી આપત્તિ છે. જ્યાં સુધી એનું સાંચાન્ય છે ત્યાં સુધી આપણી દુર્દ્યા જ હું દેખ્યું છું. એની સામે જ મેં તો પહેલી લડાઈ લાધી છે. ગંઢી દૂર કરવાની રીતસરની લડત થવી નોચરી. સાવરણીથી ડ્રિલ એ તો ભાત્ર સૂચક છે. આ છોકરાએનું પહેલું દેસન આ સાવરણી ડ્રિલ છે. એની પૂરેપૂરો સાંક ન હોય ત્યાં સુધી અમે ખીજું કશું કમ કરતા જ નથી. હવે તો છોકરાએને પણ ગંઢી નથી ગમતી.”

વાત ચાલતી હતી એટલામાં વિદ્યાર્થીએ હાથ, પગ, મોદું ધોઈને આવ્યા ને મેં ખીજ સીરી મારી.

ઉપરી સાહેબ: “આ તમારો અખતરો તો વિચિત્ર છે. ચોથા ધોરણું ભાષુટર ભાષુાવવાનો અખતરો કરતાં કરતાં આ આવું ડેટલુંક કર્યું છે?”

મેં કહ્યું: “મારા અખતરામાં આ વસ્તુને અવકાશ છે. ચોથા ધોરણું ભાષુટર ભાષુાવું તે પહેલાં મારે તેમને પહેલા ધોરણું ભાષુટર ભાષુાવવું જોઈએ ને!”

છોકરાઓં હોડીને બહાર ગયા હતા ને શાળાની આળુભાળુ ઝાડ ઉપર ચ્યાડી ગયા હતા. મેં ખીજી સીટી મારી અને તેઓ કૂદી કૂદીને નીચે પડ્યા. ત્રીજી સીટીએ તેઓ પુનઃ ઉપર ચ્યાડ્યા ને ચોથીએ નીચે પડ્યા.

હેડમાસ્તર: “મારું આ ભાષુટર લારે! આ તો વગર ભાષુાવ્યે આવડે! આમાં સાહેબ, ભાષુટર કેવું!”

મેં હેડમાસ્તરને કહ્યું: “હવે આવું ભાષુાવ્યા વિના નથી આવડતું. આપણે આવું ભાષુટર ભાષુવા પણ ક્યાં દઈએ છીએ! ને ભાષુવા હેવું પણ ક્યાં છે!”

હેડમાસ્તર: “ના, એ વાત “રાખર નથી.”

મેં કહ્યું: “ત્યારે આ આપણી શાળાના છોકરાઓ જિલા. પૂછો જોઈએ, ડેટલાક આ પ્રમાણે ચીપડી શકે છે?”

તરત જ ઉપરી સાહેબે બધા છોકરાઓને ચડવાનો હુકમ આપ્યો; પણ ઐતખ્ય જણ્યા માંડ માંડ ચડ્યા.

મેં કહ્યું: “સાહેબ, આ જાતની મેં તેમને ડેટલીક તાલીમ આપી છે. આ બધી બાબતો મારા શિક્ષણ અને અખતરાના વિષયો છે.” પછી જરા હસીને મેં કહ્યું: “સાહેબ, પરીક્ષાપત્રકમાં એ બધાનાં નામો છે. એના શુષ્ણુ મૂકવા જોઈશે.”

ઉપરી સાહેબે રિનો માંજ જવાય વાલ્યો: “અરે, તમે પણ શુષ્ણુ માગવાના કે?”

ત્રીજ સીટી મારી એટલે શાળાના કણાટમાંથી છોકરાઓએ અમરડા અને હોરીઓ લઈ આવ્યા ને અમરડે રમવા લાગ્યા. શેરીના છોકરાઓની ચેઠ નહિ, પરંતુ ધોંધાટ અને બાજાબાઝી કર્યા બિના તેઓ રમતા હતા. તેઓ એકાઅ હતા ને રમવામાં કંઈ લુચ્ચાઈ કરતા ન હતા. રમવાને માટે ચોક્કસ રથળ હતું ને સૌનો એક સુખી હોતો.

અમે જો નાનપણુમાં અમરડાથી રમેલા એટલે સૌને રમતની મજા પડી.

ઉપરી સાહેબ: “આ છોકરાઓને અમરડે રમતાં કયારે શીખવ્યું? આ લોકો બરાબર વ્યવસ્થાથી અને નિયમનથી રમે છે.”

મેં કહું: “સાહેબ, અમારી શીખવવાની જગા નહીંડિ છે. અમે ફરવા જઈએ ત્યાં આવી ડેટલી યે બાબતો કરીએ છીએ; અને રમત રમતમાં તો ડેટલું યે આવડી જય છે!”

ઉપરી સાહેબે અંગ્રેજમાં કહ્યું: “તમે સાચું કહો છો. હુમણું જ મેં વાંચ્યું છે કે બાળકો રમત દારા બધું લખે છે.” હેડમાસ્તર તરફ જોઈને કહે: “હવે નિશાળમાં આવું બધું કયારે દાખલ કરશો?”

હેડમાસ્તર કહે: “પણ સાહેબ, આવું બધું કરવા જઈએ ત્યારે અભ્યાસક્રમ પૂરો શી રીતે કરવો! આ ભાઈને તો માથે શી પડી છે! અક વરસ જેવું અણુવાશો એવું અણુવાશો, ને કહેશો ‘એ તો અખતરો હોતો. થયું તેટલું કર્યું’. બાકોનામાં ન પહેંચાયું, ન અન્યું. છોકરાઓથા ન થઈ શક્યું?’ અને આપ પણ કહેશો કે અખતરામાં તો જે નીકળે તે માન્ય હોય. અમે તો આ અભ્યાસક્રમની સાંકળથી બંધાયેલા છીએ. આપ સાહેબ જ ઉપરથી લખ્યા મોકલો છો કે ‘કેમ કામ પૂરું નથી થયું? કેમ પરિણામ મોગાં છે? કેમ અભ્યાસક્રમ પૂરો ન કર્યો?’”

ઉપરી સાહેબ જરા હસ્યા. મનમાં જરા ખીજયા હતા પણ
ને તેમણે દખાવ્યું હતું.

એક સીટી મારી ને છોકરાઓએ પોત પોતાનાં પહેરણો
કાળી નાખ્યાં. છોકરાની હાર જિભી રહી. બધા ટટાર હતા. ઢીક
કીક જમેલા હતા. સ્વચ્છ હતા. ખાલખુની જનોધાયો મેલી ન
હતી. હાથ, મોં, વાળ બરાબર ચોખ્યાં હતાં. નખમાં મેલ ન
હતો. વાળ વધેલા ન હતા. આંખોમાં ચીપડાં ન હતાં. ટોપીઓ
ઘાયેલી હતી.

ઉપરી સાહેબે જરા હસીને કહ્યું: “કેટલા દિવસથી તૈયારી
કરી હતી? આ સ્વચ્છતા વગેરેની તૈયારી કરાવતાં ખૂબ મહેનત
કરવી પડી હો !”

મેં કહ્યું: “સાહેબ, છ માસથી તૈયારી ચાલે છે. છ માસથી
મહેનત કરું શું. આપ સૌ કયાં નથી જાણુતા !”

એક વધારે સીટી મારી અને છોકરાઓ કપડાં પહેરી, રાજ
થઈ, હારખંધ જિલા રહી નમસ્કાર કરી ચાલ્યા ગયા.

હેડમાર્સ્ટરે જરા મર્મમાં કહ્યું: “પરીક્ષા પૂરી ?”

મેં કહ્યું: “હજુ વાર છે. એરડામાં આપ સૌ પથારશો ?”

હેડમાર્સ્ટર: “હા, હા. એરડાને તમે બોડા દિવસથી વાપરવા
માગી લીધો છે, અને અમને ડોઇને અંદર આવવા હેતા નથી.
કુઈક બેનું કરાવતા હતા, ખરું ?”

મેં કહ્યું: “ચાલો તો.”

અમે સૌ એરડામાં આવ્યા.

ઉપરી સાહેબ: “ઓહો ! આ તો નાનુ એવું સંઅહસ્યાન છે !”

હેડમાર્સ્ટર: “હું એમ જ ધારતો હતો. છોકરાઓ
સાવવામૂક્કવાની દોડાદોડ કરી રહ્યા હતા.”

મેં કહ્યું: “છોકરાઓએ ખૂબ ઉત્સાહથી આ કામ કર્યું છે.
મેં કહ્યું હતું કે ‘તમારે નેમ ગોડવવું હોય તેમ ગોડવને. હું
જરા પણ બતાવીશ નહિ.’”

ઉપરી સાહેબ: “આ તમામ રચના વિદ્વાર્થીઓની છે ?”

મેં કહ્યું: “હા જી.”

ઉપરી સાહેબ: “પણ એ શી રીતે બને ! It is so very
tastefully arranged !” (અધું બહુ રસપૂર્વક ગોડવેલું છે.)

હું મુંગો રહ્યો. મારા કામનું પરિણામ હવે તો રૂપણ રીતે
ઓલાવાનું હતું.

ઉપરી સાહેબ: “આ અધું બેનું ક્યાંથી કર્યું ? કુદરતના
પાડો આપવા માટે આ અધું બહુ કામનું છે.”

મેં કહ્યું: “સાહેબ, કુદરતમાંથી જ. તેની પાસેથી પાડો લેતાં
લેતાં આ આપણું છે.”

હેડમાસ્ટર ડિમેર્યું: “છોકરાઓને કરવા લઈ જય છે ત્યાંથી
હું, સાહેબ !”

ઉપરી સાહેબ: “આ તો ભારે કામ થઈ ગયું ! આ સંગ્રહ
હવે વાંખશો નહિ. આખી શાળા માટે તે આપણુંને કામ આવશે.
આવો સંગ્રહ આપણે વધારીને મોટા કરવા શિક્ષકોને કહીશું.”

હેડમાસ્ટર મનમાં ગણગણ્યાઃ “ને પછી શિક્ષકો ભણવશે
કયારે !”

સંગ્રહની એક યાદી છોકરાઓએ તૈયાર કરી હતી. ઉપરી
સાહેબે તે વાંચી અને સાથે જ ઝુશ થયા. તેઓ કહે: “આ
છોકરાઓ પ્રનામને લાયક છે.”

મેં કહ્યું: “સાહેબ, આ સંગ્રહ કરવાની મળ એ જ એમનું
પ્રનામ હતું. આ આપો સંગ્રહ જ એમનું પ્રનામ છે.”

ઉપરી સાહેબઃ “તોપણુ...”

હું બોલ્યો નહિ.

એક ખૂણુમાં ગારાનાં રમકડાં હતાં.

ઉપરી સાહેબઃ “આ ડોષે કરેલાં ! ”

મેં કહ્યું: “છોકરાઓએ, આ આખા એરડામાં મારો કસો જ હાથ નથી.”

ઉપરી સાહેબઃ “પણ આટલાં ખધાં રમકડાં કે દિવસ કર્યાં ને ક્યારે પકુવ્યાં ? ”

મેં કહ્યું: “એ તો નદીકાંડ આડ આડ દિવસે કરેલાં ને લાંજ બઢ્યી નાખી પકુવેલાં.”

ઉપરી સાહેબઃ “અરે, તમારું ભેજું કંઈ અજ્ઞય લાગે છે ! તમારો પ્રયોગ કંઈ અદ્ભુત લાગે છે ! કંઈ સાધન નહિ મળે તો નદીકાંડ છોપડો છો. એતરની મારીનો ગારો કરો છો ને શાખાશ્શ.”

મેં તેમને આગળ બોલવા ન દીધા. વર્ચે જ કહ્યું: “હુંએ આપ આ એશરીમાં જરા નિરાંતે બેસો. તેમનું બીજું ચોકુંએક કામ અતાલું.”

સૌને મેં બેસાર્યો.

હેડમાસ્તરે વિચાર કરતાં કરતાં કહ્યું: “સાહેબ, કરીએ તો આ બધું ય; પણ પછી ભણ્યાવલું ક્યારે ! ”

હું કેટલાંએક આંકડાનાં પૂંડાં લાવ્યો. એક પર છોકરાઓનો વગ્ન શરૂ કર્યો ત્યારના અક્ષરના નમૂના હતા; બીજી પર ગર્ભ કાલના અક્ષરના નમૂના હતા. પૂંડા ઉપર લખ્યું હતું ‘અક્ષર-પ્રગતિસ્યુચક પત્રક.’

અધાને અક્ષરોની પ્રગતિ સારી લાગી.

એક શિક્ષકે ખીજના કાનમાં કહ્યું: “આ તો ખાસ સારા છોકરા પાસે ધીરથી કઢાવીને મૂક્યા હતો.”

મને શિક્ષકનો આ મેલો વિચાર ખટકથો; પણ મેં તે ન ગણુકાર્યો. મને એ એટલો બધો હલકો લાગ્યો કે ન પૂછો વાત.

ઉપરી સાહેબ: “તમે આ ફેરફાર શી રીતે કરો છો ?”

મેં કહ્યું: “જુદા જુદા ઉપાયો કરીને.”

ઉપરી સાહેબ: “તે ઉપાયોને શાળામાં દાખલ કરીએ તો ?”

મેં કહ્યું: “તો થઈ શકે; જરૂર થઈ શકે. હું આપને અતાવી શકીશ.”

હું એક ણીજી ચોપડી લાવ્યો. તેમાં દરેક વિદ્યાર્થીએ આ છ માસમાં કુલ ડેટલી ચોપડીઓ વાંચી હતી તેની યાદી હતી. એને દરેક પાને વિદ્યાર્થીનું નામ હતું. વિદ્યાર્થીએ પોતે ચોપડી વાંચીને ચોપડીનું નામ પોતાને હાથે તેમાં લખેલું હતું.

મેં તે ઉપરથી છેલ્દે પાને થાડાએક આંકડા કાઢ્યા હતા. ડેટલા વિદ્યાર્થીએ કુલ ડેટલી ચોપડીઓ વાંચી, સરેરાશ વિદ્યાર્થી દીઠ ડેટલી વંચાઈ, સૌથી વધારે ચોપડીઓ ડાણે અને સૌથી ઓછી ડાણે વાંચી વગેરે. ચોપડીઓની દખિએ પણ નોંધ કરેલીઃ કર્યા ચોપડીએ ખૂબ વંચાઈ ને કર્યું છેક જ ન વંચાઈ. વંચાએવી ચોપડીએનું વર્ગીકરણ પાડી બતાવ્યું હતું કે વર્ગના છોકરાએએ ક્રયા વિષય પર વાંચવાનો ખાસ રસ લીધો હતો.

ઉપરી સાહેબે ચોપડી લેઈન્દું તેએસા અનયથી પામી ઓદ્યાઃ “આટલી બધી ચોપડીઓ વંચાઈ ગઈ ! વળો તે આટલા આટલા વિષય પર ! કર્યારે તે વાંચી ?”

“જ હા, તેમ બન્યું છે, અને તે મારી આંખો નીચે.”

ઉપરી સાહેબે પૂછ્યું: “હેડમાસ્તર સાહેબ, તમારા સાતમા ધોરણુના વિદ્યાર્થીઓએ આ છ માસમાં ડેટલાં પુરતકો વાંચ્યા હશે ? ”

હેડમાસ્તર કહે: “સાહેબ, વાંચે કયાંથી ! વાંચવા જય તો ઈતિહાસ, ભૂગોળ, ભૂમિતિ, અધ્યું બણે કયાંથી ! ”

ઉપરી સાહેબ બોલ્યા નહિ પણ વિદ્યાર્થીઓએ આ પણા. મારા તરફ જોઈને કહે: “તમારા છોકરાઓ બાખામાં વગર પરીક્ષાએ પાસ થાય છે. કહો, હવે થું બાકી છે ? ”

હું વિદ્યાર્થીઓનું હસ્તલિખિત માસિક લઈ આવ્યો.

ઉપરી સાહેબે પૂછ્યું: “આ બધા લેખો છોકરાઓના ? ”

“જ હા.”

“આ એકબે કવિતાઓ છે તે પણું ? ”

“જ હા. હમણુંથી એકબે છોકરાઓ કવિતાઓ લખવાનો પ્રયત્ન કરે છે.”

“પણ આ કવિતામાં તમે કાંઈ સુધારી આપો છો ખરા કે નહિ ? ”

“ના, હજ સુધી તેમ નથી કર્યું. જેવી લખાઈ છે તેવી જ અગટ થઈ છે.”

“આ અધ્યું છોકરાઓ પોતાની મેળે લખે છે, ઉતારા કરે છે કે તમે સુઝાડો છો ? ”

“ઉતારા કરવાનો શો અર્થ, સાહેબ ! હું કહું છું કે ‘જે ગમે તે લખો. સ્ક્રેટ તે લખો. અધ્યું લખાય. વળો જે લખો તે અગટ કરો.’ તેઓને બધાં લખાણો ગમે છે ને હું બધાંને અગટ કરું છું.”

ઉપરી સાહેબઃ “આ છમાસિક પરીક્ષા માટે તે ખાસ કરાવ્યું હશે ? ”

મેં કહું: “ના જી. આ છેલ્ખા નથુ માસ થયાં દર માસે આ પ્રવૃત્તિ ચાલે છે. હા, આ છમાસિક પરીક્ષામાં મૂક્યું છે અરું, પણ તે પરીક્ષા માટે તૈયાર નથી કર્યું.”

ઉપરી સાહેભે ખુશ થતાં થતાં ડોકું હલાયું ને કહું: “આરે અધરું કામ છે.” મને ઉદ્દેશને કહે: “તમે અજબ કામ કરી બતાવો છો. જ માસમાં કયાં સુધી ગયા છો!”

હેડમાસ્તર હળવેથી એલયા: “હવે ગણિત, ભૂગોળ અને ધતિહાસની પરીક્ષા કયારે છે? અમે અપોરે હાજર રહીએ કે?”

કદાચ એવું બોલી મને ટકાર કરવી દશે! મેં હજ ગણિત અને ભૂગોળમાં મોકું કર્યું હતું તેની હેડમાસ્તરને ખરાર દશે. મેં કહું: “ભૂગોળ અને ગણિતમાં મારાથી કથું અન્યાં નથી; પણ બાર માસે મારે તે કામ પણ કરી બતાવવાનું તો છે જ. વળા ધતિહાસમાં કામ થયું છે પણ તે બતાવવા જેવું નથી થયું.”

હેડમાસ્તર: “ઓહો! ત્યારે તો મોટા મોટા વેશો જ રહી ગયા કહેણો ને!”

ઉપરી સાહેખ: “હેડમાસ્તર સાહેખ, એ તમારી દશ્ઠિએ: આ ભાઈની દશ્ઠિએ નહિ. તમારે તો ધતિહાસ ને ભૂગોળ, ગણિત ને પલાણાં એ જ મોકું ભણુતર!”

ઉપરી સાહેખ જરા મજામાં હતા એટલે હેડમાસ્તરને સામેથી સંલગ્નાની: “પણ સાહેખ, આપની દશ્ઠિએ પણ એમ જ છે. આપ પણ એમાં જ પરિણામ માગો છો!”

સૌ જરા મજાની વાતો કરતા જોડ્યા. મારા વર્ગની છમાસિક પરીક્ષા પૂરી થઈ. જતાં જતાં ઉપરી સાહેખે કહું: તમારું પરીક્ષાપત્રક?”

મેં કહું: “એ તો તૈયાર કર્યું જ નથી.”

ઉપરી સાહેખ: “ત્યારે પરિક્ષામાંથી તમારો વર્ગ આતલ.”

ચતુર્થ ખંડ

છેદ્દો મેળાવડો

: ૧ :

જમાસિક પરીક્ષા ગયા પછી ઓક દિવસ શાળાના શિક્ષકભાઈઓની સાથે હું એઠો હતો.

ચંદ્રશંકરે કહ્યું: “ખરેખર, તમે કાંઈ અજબ જેવા લાગો છો. મારે કહેવું જોઈએ કે તમારો અખતરો સફળ થયો છે. અમને વિશ્વાસ નહોતો કે પ્રાથમિક શિક્ષણુમાં આવું કશું શક્ય હોય.”

ભદ્રશંકરે કહ્યું: “ભાઈ, એ તો અંગ્રેજ ભણેલા છે એટલે અંગ્રેજ ચોપડીઓ વાંચી વાંચીને નવા નવા અખતરા કરે.”

ચંપકલાલ કહે: “એ બધું હીક છે. પણ એ એને પાલવે. ચૈસાની ચિત્તા નહિ અને પરિણામની પરવા નહિ. અખતરો નિષ્ફળ થાય તો એને કયાં નાહવા જવું છે!”

વેણીલાલે કહ્યું: “ભાઈ, અખતરાફતરા કયાં કરીએ! એ તો નવરાશ જોઈએ. આવું બધું વિચારવાને અને તૈયાર કરવાને વખત ડાની પાસે છે! આપણે તે ટયુશન કરવાં, કે ઉપરી સાહેબ પાસે સાંજની હાજરી અરવી, કે ધરનાં છોકરાંછીયાં સાચવવાં, કે નાતજાતમાં રહેવું, કે કરવું શું! આ તો રહ્યા ફુફડામ તે એને ચોસાય.”

હું આખરે ઓછોએ: “જુઓ ભાઈએ, પ્રાથમિક શિક્ષણમાં આથી એ વધારે શક્ય છે. આજનું પ્રાથમિક શિક્ષણ ડેવણ ઘદલાઈ જાય તેટલું બધું શક્ય છે. પણ વાત એમ છે કે એ ઘદલવા પાણી માણુસ જોઈએ છે. દુનિયાનું અને પૃથ્વીનું આપું પડ પહેલાં હતું તેથી આજે જુદું છે પણ તે માણુસોએ ફેરબ્યું છે. માણુસમાં ધગશ જોઈએ, આત્મવિશ્વાસ જોઈએ, અહાર્ય નિષ્ઠા જોઈએ. બાકી અંગેજ ભાગવાથી અખતરા વધારે સારા થાય એવું કાંઈ નથો. એ તમારે લૂલો બચાવ છે. તમારે જ્યારે કાંઈ કરવું ન હોય ત્યારે આ બાહાતું છે. અરી વરતુ હૈયાઉંકલત છે, અને તે તો કોઈ વરતુ માટે બળ રહેલા આપણા આત્માભાંથી આવે છે. વળી ચંપકલાલભાઈ, પરિણામની ચિત્તા તો અખતરા કરનારને હોય તેટલી બીજા કાઈને ન હોય. તમે તો પગારના વધારા માટે સારું પરિણામ માગો છો; પણ મારે તો સફળતા ન મળે તો બીજે અખતરા કરવાની જગા ન રહે! વળી મારી નિષ્ફળતા ભાની અખતરા કરનારાઓની આડી આવે. મારે વેણીલાઈને કહેવું જોઈએ કે ભાઈ, નાતજાતમાં હરવાફરવા અને ફડાકા મારવા કયાં ગોછી નવરાશ છે! વળી ઉપરી સાહેયને જીં ખાલડાં ધસવાને કોણ કહે છે! ઉપરીને સાચું કામ આપીશું

તો ખુશામત નહિ કરવી પડે. કામ ન આપે તે ખુશામત કરે! ને નિશાળમાં સારું લણ્ણાવીશું તો ટયુશન લેવાની ડાને જરૂર રહેશે! એ તો આપણે શાળામાં ન લણ્ણાવીએ એટલે ટયુશનની ગરજ ઊભી થાય છે.”

સિવસંકર વચ્ચે બોલ્યા: “પણ ભાઈ, પગાર એંછે મળે લેનું શું! તમને તો મેં-માર્ગે પગાર મળે છે; પણ અમારે ક્યાં જવું!”

મેં કહ્યું: “તમે પગાર માગો એટલે તમને પણ મળશે.”

વિશ્વનાથ કહે: “અરી વાત; પગારને બદલે નેકરીમાંથી ધક્કો મળે!”

મેં કહ્યું: “ખધા શિક્ષકો વધારે પગાર માગે તો જોઈએ કેટલાકને ધક્કો મળે છે! વળી હું તો કહું શું કે ધક્કો મળે તે પહેલાં તમે જ શા માટે નીકળી નથી જતા! જરા એપરવા થતાં શાઝે. હું એપરવા છું એમાં મારું આદે છે.”

અદ્રથંકરે કહ્યું: “ભાઈ, મમ મમનું શું?”

મેં કહ્યું: “મમ મમ? હિંમતે મરદા તો મહદે ખુદા. ધંધા ક્યાં એંછા છે! હું તો જાડુ વાળોને પણ પેટ ભરું; પણ તમારા જેમ અધ-ભૂઘ્યે. રહું નહિ. આ કાંઈ તમારા પગાર કહેવાય!”

વિશ્વનાથ કહે: “ભાઈ, એકને બદલે અઠાર જણ અમારી જગા પૂરવાવાળા છે. તમને ક્યાં ખરર છે!”

મેં કહ્યું: “આપણે તેમની આડા ઊભીએ. આપણે તેમને આપણો ચાર્જ આપીએ તો ને! વળી નવો ચાર્જ લેવા દઈએ તો ડે! એ તો એક વાર શાળા ફરતા રાતદિવસ ચોણી બરીએ; પણ જે ખાડામાં આપણે પડ્યા છીએ તે ખાડામાં બોલને કેમ પડવા દઈએ! તેમને પગે પડીને કહીએ: ‘ભાઈ, ધૂંધી’

શોધેા. આ ભૂખમરામાં ન આવો; આ ખુશામતખાતામાં ન આવો;
આ ચેહીખાનામાં ન આવો.””

પણ તો કેટલી યે વાતો ચાલી. મેં બધા શિક્ષકોમાં ઉત્સાહ
નેથેા. મને લાગ્યું કે જૂની ઘરેડની શુલામીના મૂળમાં ચિનગારી
લાગી ગઈ છે.

: ૩ :

હું હવે ભૂગોળ શીખવવાનો વિચાર કરવા લાગ્યો. ભૂગોળનું
પાઇપુસ્ટક જોઈ તેને નિરાકાશી બાળું મર્યાદા મર્યાદા. અભ્યાસક્રમ
વાંચીને મનને માફું લાગ્યું. શા માટે છોકરાયોને આ નહીંયો
અને પર્વતનાં નામો યાદ કરાવવાં! મને કયાં એ બધું યાદ છે!
ગઈ કાલે વિદ્યાધિકારી સાહેબ પણ નકશામાં જોઈ ઓસ્ટ્રેલિયાનો
રસ્તો શોધતા હતા. નાનપણમાં મોઢે કરેલી ભૂગોળ ડોને યાદ
રહે છે! મને થયું: “આ ભૂગોળ ન જ અણાવીએ તો કેમ! મને
પોતાને ખરી ભૂગોળ આફિકા ગયો ત્યારે જ સમજાઈ. ત્યાર
પણ્યો લૌગોલિક આંખ ઉધડી. આજે મને ભૂગોળમાં અત્યંત
રસ છે. મને ભૂગોળ અત્યંત ઉપયોગી લાગે છે. પણ આ
વિદ્યાર્થીઓને આ બધું અત્યારથી શા માટે સમજનવું ને અણાવવું!
આ અભ્યાસક્રમ પ્રમાણે તો નહિ જ ચલાય. આ પાઇપુસ્ટક જોઈ
હુસવું આવે છે. વિદ્યાધિકારીને મળું? મારી પોતાની રીતે
વિદ્યાર્થીઓમાં લૌગોલિક વૃત્તિ અને દાખિ ઉત્પન્ન કરવાની
રજા વહીં?”

હું વિદ્યાધિકારી પાસે ગયો.

સાહેબે પૂછ્યું: “કેમ?”

મેં કહ્યું: “ભૂગોળનો વિષય અભ્યાસક્રમમાંથા છોડી દઈએ તો?”

“એ તો ન જ બને. અભ્યાસમાં ભૂગોળ અત્યંત મહત્વનો
વિષય છે. છતિહાસ કરતાં પણ આજે ભૂગોળ કાસતી છે. આપણું

અખતરામાં વિષય છોડી હેવાની વાત નથી. વિષય સરસ રીતે ભણ્ણાવી હેવાનો છે. તમે ભણ્ણાવો ગમે તે રીતે પણ બીજી શિક્ષકને ખાતરી કરી આપો કે ભૂગોળ રસિક વિષય છે અને સરસ રીતે ભણ્ણાવી શકાય છે. તમારા અખતરાની કિંમત મને એમાં છે.”

વિદ્યાધિકારીએ સરસ રીતે મારું મેં બંધ કર્યું; પણ મેં કહ્યું: “આ પાડ્યપુરુષનું અને અભ્યાસક્રમ તો મારે ન જોઈએ. હું મારી રીતે ભૂગોળ શીખવીશ. હું આશા રાખું છું કે આપ નિરાશ નહિ થાઓ.”

સાહેબે કહ્યું: “હું પણ એ જ માઝું છું.”

થોડી વાર પણી વિદ્યાધિકારીએ એક બીજે સવાલ પૂછ્યે: “તમારું થું ધારવું છે—આપણે આ પરીક્ષાએ લઈએ છીએ તે બાબતમાં?.. નવીન શિક્ષણના ડિમાયતીએ પરીક્ષાનો સહંતર વિરોધ કરે છે; અને તેની બદી ખરેખર બયંકર છે. અમારે તો આતું ચલવનું રહ્યું એટલે પરીક્ષાને ડેમ કાઢી શકાય! પરિણામ પણ જોઈએ. વળી પરીક્ષા ન લઈએ તો શિક્ષક ન પણ ભણ્ણાવે, અને પ્રામાણિક શિક્ષક ભણ્ણાવે જય તોપણ ભણ્ણાવતાં આવડયું છે કે નહિ તેની ખરે પરીક્ષા વિના ન પણ પડે. વળી એ બધું જ્તાં વિદ્યાર્થીમાં ભણ્ણાત્મક જોગયું છે કે નહિ એ જાણવાને કંઈક રસ્તો તો જોઈએ જ. આ મુશ્કેલીમાં તમારો રોા અભિપ્રાય થાય છે?”

મેં કહ્યું: “આપની મુશ્કેલી સાચી છે. જ્યાં સુધી ગમે તે વિદ્યાર્થી ભણ્ણાવ એસે છે અને જ્યાં સુધી ગમે તે શિક્ષક ભણ્ણાવે છે ત્યાં સુધી પરીક્ષા જોઈશે જ. પરીક્ષા ત્યારે કાઢી નાખીએ કે જ્યારે અંદરભી ભણ્ણાવાની હેંશે નિદ્યાર્થી ભણ્ણાવ આને, અને સામેથી ભણ્ણાવવાની કાગાનાળો શિક્ષક ભણ્ણાવવાની હેંશથી ભણ્ણાવવા

એસી. પણુ હાલતી ભાડૂતી સ્થિતિમાં પરીક્ષાને પેસવાની જગા છે.”

વિદ્યાધિકારી કહે: “અભિજ્ઞત, હું એ બાળતમાં કાંઈક સુધ્ધારા કરવા માણું છું.”

મેં કહું: “આજે તમે માત્ર છમાસિક અને વાર્ષિક પરીક્ષા દેઓ છો તેને બદલે માસિક પરીક્ષા દાખલ કરો. જે વિદ્યાર્થીને પરીક્ષાની કસોટીએ ચડવું પડે તેમ છે તો પરીક્ષાનો જેટલો વિશેષ પરિચય તેટલો તેનો ત્રાસ પણ ધરે છે. અતિપરિચયથી ત્રાસ સલ્લ થાય છે. બીજું પરીક્ષા હોસિયાર વિદ્યાર્થીને માપવા માટે નહિ પણું કાચા વિદ્યાર્થીએ જગાડવા માટે, તેમની કચાશ કેટલી છે તે એળો કાઢના માટે થાય. આ મોટા દિશ્ટિફર છે. ક્રીજું જે વિદ્યાર્થીએ માનતા હોય કે પોતાને વિષય આવડે છે તેમને પરીક્ષામાંથી માઝ રાખવા. ધર્યાપૂર્વક વિદ્યાર્થી પોતાની કચાશ મપાવવા પરીક્ષા આપે. કચાશ નહિ મળવે તેને કચાશ દૂર કરવાનો અવકાશ નહિ રહે એવી સમજણું વિદ્યાર્થીએ માં આપીએ. પરીક્ષાથી મારી શકાય તેવા જ વિષયોની પરીક્ષા રાખીએ અને બાકીના વિષયોને પરીક્ષામાંથી આતલ કરીએ. વળી પરીક્ષા વખતે વિદ્યાર્થીએ પાડ્યપુસ્તકો જોઈને જવાઅ આપવાની છૂટ આપીએ. આપણે કહીએ કે ન આવડે તો જોઈને જવાઅ આપવો. મોઢેથી કહી ન શકાય તો ચોપડીમાંથી જોઈને સમજવલું. વિદ્યાર્થી પાડ્યપુસ્તકને જવાઅ આપવામાં ડેવી રીતે વાપરે છે તેમાં તેની સ્વતઃ પરીક્ષા થઈ રહેશે. બીજું આપણે ઉપલા વૈારણુમાં જવા લાયક, નાલાયક અને કાચું હોય તે પાડું કર્યું પછી જવાને લાયક એવા ત્રણું વિભાગ વિદ્યાર્થીના પાડીએ. પહેલે નંબરે પાસ, બોને નંબરે પાસ એ ઘેરણું રદ કરીએ.”

વિદ્યાધિકારી વચ્ચેથી એલાયા: “આવતે વર્ષે મારે તમને તેજુટી નીમવા જોઈએ.”

હું જરા હસ્યો. અને આગળ એલોએ: “પરીક્ષા શિક્ષકોને હાથે લેવાની જોઈએ. તેઓ જ વિદ્યાર્થીઓની સત્તિ વધારે જાણી શકે છે, અશક્તિનાં કારણો જાણી શકે છે, અને ઉપલા ખોરણું માલશે કે નહિ તે કંઈ શકે છે. હા, ડેઝુની જરૂર છે, પણ તે પરીક્ષા કેમ લેવાય તે યાંત્રના પરીક્ષા લેવા માટે છે – શિક્ષકને ખરાખર પરીક્ષા લેતાં આવડે છે કે નહિ તેની પરીક્ષા લેવા માટે જ છે.”

વિદ્યાધિકારી: “આ વાતી નવો વિચાર.”

મેં કહ્યું: “જ દા, લાગે છે તો જોમ.”

પરીક્ષા વિષે મારે વધારે કહેવાનું હતું; પણ સાહેબને જમવાનો વખત થયો તેથી તે બેઠયા. હસતાં હસતાં તેમણે કહ્યું: “ઢીક ઢીક, આપણે આ વિષય ફરી વાર વિચારીશું. એક વાર શિક્ષકો આગળ તમે ભાવણું આપો.”

હું ઉડ્યો. મનમાં ગાયુગણ્યો: “જોમ ભાવણું આપે શિક્ષકો કર્ણાં ડાઢા થાય એમ છે! પરીક્ષાની વરેડમાંથી તેમને કાઢવા ધણા અધરા છે. છતાં જેમ થઈ શકે તેમ હોય તો તે વિદ્યાધિકારીઓના છુકમોથા થઈ શકે; પણ એ બિચારા તો...”

: ૩ :

ચોથા ઘોરણુના છોકરાઓ એટલે ભૂગોળનાં નામ અને વિષયથી કંઈક પરિચિત. મેં નકશા મળાયા અને કાઢિયાવોડ, ખૂઝરાત તેમજ સુંબર્ધ રૂલાકાના નકશા ભીંત ઉપર ટાંગ્યા. છોકરાઓ નવાઈ પામ્યા. આજ દિવસ સુધી મેં ભૂગોળ શીખવી જ ન હતી. તેઓ નોટામાંથી કાગળિયા ફાડ્યા મંડ્યા અને કાગળની ભૂંગળાઓ ટચલી આંગળાઓ ચડાવવા લાગ્યા. હું જોઈ રહ્યો.

મેં પૃથ્યું: “આ ભૂંગળાં શા માટે?”

છોકરાએં કહે: “સાહેય, નકરો જોખવા.”

હું હૃદ્યકી ગયો. “નકરો જોખાય! ભૂગોળશિક્ષણે ગજય કરો!” જરા રમુજ જેવા મેં છોકરાએને કહ્યું: “ભાવનગર બતાવો.”

છોકરે સુંબદ્ર પ્રલાંકના નકશા ઉપર ચારે કોર નજર નાપી. સુંબદ્ર વાંચ્યું, અમદાવાદ વાંચ્યું, દૈદરાબાદ વાંચ્યું; વળી નીચે તિતરી પુના વાંચ્યું; વળી આ તરફ આવી પોરબંદર વાંચ્યું, પાછળ તિબેલા ઐતિહાસિક છોકરાએએ ભાવનગર શોધી રાખ્યું હતું. તેમની ભૂંગળીએ ભાવનગર બતાવવા અધીરી થઈ રહી હતી. આખરે એક જણે વગર પૂછ્યે ભાવનગર બતાવી હીધું.

મેં પૂછ્યું: “ભાવનગર કઈ દિશામાં?”

છોકરાએએ તિચે, નીચે, જમણી બાળુ, ડાખી બાળુ જોઈ કાંઈક મનમાં હિસાઅ ગણ્યી, કાંઈક કાયદો સંભારી કહ્યું: “સાહેય, ઉત્તરમાં.”

ખીને છોકરો કહે: “ઉત્તર દિશા તો તિચે આવી; આ બાળુ તો પૂર્વ કહેવાય.”

મારાથી હસી જવાયું. મેં કહ્યું: તિચે તો આકાશ છે; ત્યાં કયાં ઉત્તર છે?”

છોકરાએ કહે: “ના સાહેય, તિચે ઉત્તર અને નીચે દક્ષિણ.”

એક છોકરો કહે: “સાહેય, ઉત્તર દક્ષિણ લાંબું અને પૂર્વ પશ્ચિમ પહોળું.”

એક છોકરો કહે: “સાહેય, સુરજ જેણે એ તરફ ઉગમણું.”

મેં કહ્યું: “અતાવો, નકશામાં સુરજ કયાં છે!”

ખધા નિચારમાં પડ્યા. મેં પૂછ્યું: “શેરુંજ નદી અતાવો.”

છોકરાએએ ભૂંગળીથી શેરુંજ નદી અતાવી.

મેં પૂછ્યું: “કોને મળે છે ?”

નકશામાંથી વાંચી છાકરાઓએ જવાબ આપ્યો “ખંભાતના અખાતને.”

મેં પૂછ્યું: “આમ અરણી સમુદ્રને થા માટે નથી મળતી ?”

છાકરો કહે: “તે એની મરજી. ખંભાતના અખાતને મળવું હશે.”

મેં પૂછ્યું: “આ નથી આમ નીચાખુમાં શું કામ ગઈ ?”

છાકરો કહે: “સાહેલ, એમ જ જાય ને ! જુગ્યો ને, દક્ષિણ આમ નીચું જ છે ને !”

હું તાજુઅ થઈ ગયો. ગયે વરસે ભાણેલી ભૂગોળ તેણો ભૂત્યા નહોતા. ગોખલુપદી સફળ હતી. આ વખેં પણ એ જ રીતે હું શીખવી શકું; પણ એ કાંઈ ભૂગોળનું શિક્ષણ થાય ! મેં છાકરાઓને કહ્યું: “નકશાઓ બંધ કરી હો. એક મહિના પછી આપણે ભૂગોળ લઈશું. હમણું આપણે થોડા દિવસ ચિત્રો કાઢીએ.”

છાકરાઓ મારી સામે જોઈ રહ્યા. ચિત્રનો વિષય શાળામાં નનોં; અભ્યાસકભરમાં જગા નહિ. શાળામાં એવી સર્જનાત્મક એક પ્રવૃત્તિને જગા નહિ. પણ મારે એવી એકાદ પ્રવૃત્તિને તો દાખલ કરવી જ હતી.

ઓઝે દિવસે છાકરાઓને મેં કહ્યું: “ચીતરો; તમને ગમે હે ચીતરો; જેવું આવડે એવું ચીતરો. જોઈ જોઈને ચીતરો, નીચે રાખીને ચીતરો, સંભારીને ચીતરો, ફાવે તેમ ચીતરો. માણુસ ચીતરો, ઢોર ચીતરો, પક્ષી ચીતરો, પતંગિયાં ચીતરો, ઝાડ ચીતરો, ઝૂલ ચીતરો, આકાશ ચીતરો, ધર ચીતરો, પદથોરી ચીતરો, નકશા ચીતરો, ગમે તે ચીતરો.”

પાઠીમાં જેનાથ ચિત્રો નીચાના ચાંદાં. વાંકાંચૂંકાં જેવાંતેવાં ડેટલી યે જતનાં ચિત્રેને નીકળાના દાખાં. શાખાએ સાંચર ચિત્રમાં ચારી ગઈ. વંટ વાગ્યો તરારે જાંણ જેવડી. વખત મૂર્ખ ખેડો હતો.

મેં છોકરાયોને કહ્યું : “જેનાં માખાપ પેનિસલ અને કાગળ અપાવે તે નોટમાં ચિત્ર કાઢે; બાકીના પથા પાડીએં.”

એચાર દિવસ નીકળી ગયા. કટલાં ચિત્રો નીકળી ગયાં— ચિત્રકાર જેને જોઈને ફૂલી હે એવાં; પણ છતાં વિદ્વાર્થીની પોતાની કદ્દપનાનાં, પોતાની શક્તિનાં ચિત્રો હતાં. મને થયું : “ચિત્રોના હિસાબ અને સંગ્રહ રહેવો જોઈએ.” થોડીએક મુશ્કેલી વેઠી ઉપરી સાહેબને ભળી એક બાળુ કારા રહી કાગળો કઢાવ્યા અને સાહેબ પાસેથી એ ડણન રંઝીન પેનિસલો પડાવી. સાહેબે હસનાં હસતાં કહ્યું : “વળી બાળુનું ડારે મૂકીને ચિત્રનું કાઢ્યું લાગે છે !”

હેડ વિદ્વાર્થી પાસે ચિત્રના વિષયવાર એક એક નોટ કરાવી અને તે પ્રમાણે તેમાં ચિત્રો કાઢવાનું મેં કહ્યું. ચિત્રોના વાતાવરણ ઇપે મેં લામડાની ડાંખળીએ, પીપળાનાં પાંદડાં, તુલસીની માંજર તથા બારમાસી અને આકડાનાં ફૂલ મૂક્યાં. વેપારીને ત્યાંથી લાતભાતની છાપેદી કારોના નમૂનાના કટક લાવીને ટાંગ્યા. એકાદે ભાઈંધને ત્યાંથી થોડાંએક સારાં ચિત્રો લાવીને જેવા માટે મૂક્યાં. હંમેશા વપરાતી ચીને જેના કે ખડિયો, હોલ્ડર, ડાયલી દીવાસળીની પેટી વગેરે એકદી કરીને મૂકી. એક પાટિયા ઉપર મોટા અક્ષરે લખ્યું : “ચીતરો, ચીતરો, ચીતરો. તમારી એ ચીતરો. તમને ચિત્ર કાઢતાં આવકે છે. રોજ રોજ સારાં સારાં ચિત્રો નીકળતાં જય છે.”

છોકરાએ તે કાઢવા પાછળ બહુ પડ્યા. કટલાંએક તો છાપકામ, અગ્રતકામ અસલ જેણું જ ચીતરું. કાઈએ ફૂલના રંગ જેવા જ રંગા ફૂલોમાં પૂર્યા. કાઈ ચીતરતા જ નહોંતા; તો કટલાંએક ધીન કેમ ચીતરે છે તે એડા એડા જેતા હતા.

પખનાદિયા પણ હાઈસ્કૂલના ચિત્રશિક્ષકને હુ તેડી લાગ્યો. મેં કહ્યું : “તમારી ચિત્ર કાઢતાં શીખવવાનું નથી. પારીઆ જિપે

તમને ગસે વેવાં ચિત્રો તમે કાઢ્યે જાઓ. ખીમેથી કાઢલો, ચાદરીથી કાઢનો. આડ જોઈની છાડી કાઢી બતાવો, ખુરશી જોઈને ખુરશી કાઢી બતાવો." ચિત્રશિક્ષકે તેમ કર્યું અને વિદ્યાર્થીઓ તલ્લીનતાથી તે જોઈ રહ્યા હોને હિસ્સે ચિત્રનું કામ એટ જાગ્યું. કાઢવાના નિયમોમાં કાંઈ વધારે સમજ વિદ્યાર્થીઓમાં આવી હોય તેમ લાગ્યું. તે પછી ચિત્ર નીચે તારીખ અને નામ લખવાનું મેં દાખલ કર્યું.

વળી થોડા દિવસ પછી એ ચિત્રકારકાઈને મેં બોલાવ્યા અને રેપાચિત્રોમાં કે આદેખનચિત્રોમાં રંગ કેમ પૂરાય તે કરી બતાવવા મેં ગોઠવણું કરી. ચિત્રકારે એક, એ, તૃણ, ચાર, પાંચ એમ થોડાંએક ચિત્રોમાં સુધિતાથી પેન્સલથી રંગ પૂરી બતાવ્યા. વિદ્યાર્થીઓને રંગ પૂરવાની એક નવી દિશા મળી.

વળી થોડાએક દિવસો પછી મેં એક સર્વેયર મિત્રને બોલાવ્યા અને તેમને શાળા માપીને શાળાનો નકશો કરવાનું કહ્યું. હું અને તે શાળાનો પ્લેન માપતા હતા અને છાકરાઓએ સાથે ફરતા હતા. છાકરાઓની નજરોનજર મફાનનો નકશો કાગળ ઉપર કેમ હોયાય તે અમે કરી બતાવ્યું. એપાંચ દિવસ છાકરાઓને મેં સર્વેયરની એકિસમાં જ મોફલ્યા અને ત્યાં ઝ્રાફ્ટસમેનો શેરીના, ગામના, સીમના વગેરે નકશાઓ કેમ હોરે છે તે હેખાડ્યું. એકબે વાર છાકરાઓને મોજણીદાર સાથે સીમમાં લઈ ગયો અને પ્રત્યક્ષ મોજણીનું કામ બતાવ્યું. નિશાળમાં છાકરાઓ નિશાળને, એરડાને, પોતાના ધરને, શેરીને અને કોણ કોઈ વખત કોઈ કૂવા કે તળાવને ચીતરવા લાગ્યા. ચિત્રનું કાઢ વધારવા છાકરાઓને કુદરતમાં ફરવા લઈ જતો. કોઈ વરસુને આંખમાં ઘ્યાલ કેમ આવે તેની રમતો રમાડતો—નેવી કે કોણ આડ ઉપર નજર નાખતાંવેંત યડડાળો કેવાં છે તે જોઈ લઈં આંખ બંધ કરી તે કાગળ ઉપર ચીતરી લાવે; સુરોદ્દ્ય વખતન

રંગાની સામે જોઈ રહી તેતું ધ્યાન કરે; સંખ્યાકાળના ફરતા રંગાની ઘૂંઘીઓએ જુઓ; દૂરથી જાડ કેવું હેખાય છે અને પાસેથી કેવું લાગે છે તેનો જલઅનુભવ કરે; જાડ, પદાર્થ, પર્વત, માણુસ અને એના પડછાયા ડેવા પડે છે તે ધ્યાન પર લે.

આ રીતે અમારું ચિત્રકામ ચાલતું હતું.

: ૪ :

એક દિવસ હાઈસકૂલમાંથી હું એક દૂરથીન (બાયનોક્યુલર) લાગ્યો. છોકરાએને મેં દૂરની વસ્તુઓ ડેવી રીતે નજદીક હેખાય છે તે ખતાવ્યું. છોકરાએને ભારે નવાઈ લાગી. આએ દિવસ તેઓએ વારાફરતી બાયનોક્યુલર અંબ ઉપર રાખ્યાં જ કર્યું. રાત્રે હું ગ્રહે અને તારાએએ જોવાનું ટેલીરેકોપ લઈ આવ્યો. મારા મિત્રો કહે: “તું પણ ભારે ધમાલિયો છે !”

મારા શિક્ષકાઈએ હું ધણુંખરું તો આવા બધા પ્રસ્તે મારી સાચેજ રહેતા હતા. નિંદા છોડી મારી પાસેથી કાંઈક શીખવા અભિમુખ થયા હતા. વિદ્યાધિકારીએ તેમની સંમતિથી અઠવાડિયે એક કલાક મારા વર્ગમાં સૌ આવે અને હું કેમ કામ કરું શું તે જુઓ એમ ઠરાવ્યું હતું.

શરીર મેં ચંદ્ર અને તારાએ મારા વિદ્યાર્થીએને ખતાવ્યા. તેઓને અધધધ થઈ પડ્યું !

ચંદ્ર બતાવતાં બતાવતાં મેં વાત છેડી: “પેલા ચંદ્રમાં રંટિયા કાંતતી ડેશી અને બકરી હેખાય છે તે ચંદ્ર ઉપર મોટી મોટી ઝીણો અને પર્વતો છે; અને ત્યાં એટલી બધી ટાંડ છે કે ત્યાં ડાઈ માણુસ નથી.” છોકરાએ મારી સામે જોઈ રહ્યા. મેં કહ્યું: “આપણે રહીએ છીએ તે ધરતી અને ચંદ્ર એ એ બહેનો છે, તે એનો આપ સરળ છે.”

વિદ્યાર્થીએ વધારે આશ્વર્યથી મારા તરફ જોઈ રહ્યા.

એક જણું કહે: “આવી વાર્તા કર્ય ચોપડીમાં છે?”

મેં કહું: “આ વાર્તા નથી, સાચી વાત છે.”

છોકરાઓ કહે: “હોય નહિ!”

મેં કહું: “એમ જ છે.”

તરત જ મેં સ્વર્ગમાંથી પૃથ્વી કેમ થઈ તેની વાત આરંભી; અને તે વાત જન્મી, દિવસો ઉપર દિવસો ગયા. એટલામાં તો મેં પૃથ્વીનું પડ ટાહું કેમ પડ્યું, ખાડાટેકરા કેમ થયા, સરોવરનદીએ કેમ થયાં, શેવાળ, જળજંતુએ, માછબાં, દેડકાં, જળસ્થળ પ્રાણીએ, જંગલે અને જંગલી મનુષ્યો અને જંગલીમાંથી ધીરે ધીરે આજનાં મનુષ્યો કેમ થયાં તેની વાત કહી. એ વાર્તા ધણી અદ્ભુત હતી. છોકરાઓ અત્યંત એકાશ્રતાથી તે સાંભળતા હતી. હેડમાસ્તર સાતમા ધોરણું છોકરાએને પણ તે સાંભળવા મોકલતા.

એક દિવસ હું પૃથ્વીનો ગોળો લાગ્યો અને કહું: “આ બધું આના ઉપર કેમ થયું તેની વાત કહી.”

પછી મેં પાણી અને જમીન કયાં છે, કાળા લોડા અને ઘેણા લોડા કયાં છે, પીળા લોડા અને રાતા લોડા કયાં છે, ડિંગણું અને ચિંચા લોડા કયાં છે એ બધું બતાયું. પછી મેં પૃથ્વીના કુદરતી વિભાગો અને તેનાં નામો કલાં. પછી આપણે એશિયામાં છીએ; એશિયામાં આ દેખાય છે તે હિન્દુસ્તાન છે; હિન્દુસ્તાનમાં આ દેખાય છે તે કાઢી લોડાનો સુલક કાઠિયાવાડ છે; અને કાઠિયાવાડમાં આ લાવનગર છે, તે બતાયું.

મેં છોકરાએને કહું: “આ લો ગોળો અને પેલી પેટીમાંથી કાઢો નકશાએ. આ ગોળા ઉપર કયાં કયાં તે બધા બંધાસતા આવે છે તે શાધી કાઢો.”

હું છોકરાએને દરરોજ કાંઈ નવું નવું જોઈ જવા કહેવા લાગ્યો. મેં કહ્યું: “તમે ને ને ગામો આજ સુધી જેથાં હોય તે ખોણ કાઢો. ત્યાં ક્યે ક્યે રસ્તેથી જવાય છે તે જુઓ. રસ્તામાં કઈ કઈ નદીએ આવે છે, ક્યાં ક્યાં ગામો આવે છે તે પણ જુઓ.”

આ એક રીત થઈ. બીજુ બાળુએ હું આદ્રિકા જોઈ આવેલો એટલે આદ્રિકાનો નકશો સામે રાખીને હું આદ્રિકાની વાતો કરવા લાગ્યો. મેં વિક્ટોરિયા ન્યાન્જા, ટાંગાનિયાન્ડ, ઝાંખેસી, નાઈસ અને આદ્રિકાના સિંહો અને હાથાએ ને ત્યાંના લેડો-મરસાઈ ને ડેવારોન્ડોની વાતો કહી. પછી એક દિવસે મેં તેમને કહ્યું: “આ આપણી આલુભાળુના લેડો ડેણી, કુલાર, ભરવાડ, રબારી વગેરે છે એને તે જેવા જાઓ.” વળો એમ કહીને તે દશ્ચિયે એકબે પ્રવાસે તેમની સાથે ગામડામાં, સોમભાં, નદીકિનારે, કુંગરા ઉપર એમ મેં જોડબ્યા અને તેમને ભૂતળના અભ્યાસ તરફ અભિમુખ કર્યો.

પછી મેં તેમને માટે ભૂતળનું એક વાચનાલય વસાવવાનો વિચાર કર્યો; પણ તેવા સુંદર પ્રવાસેનાં પુરતકા આપણી ભાષામાં ન મળ્યાં. જે મળ્યાં તે તેમને આપ્યાં અને કહ્યું: “પુરતક વાંચતા જાઓ અને નકશા જોતા જાઓ. માણુસ ક્યાંથી ક્યાં જાય છે તે જુઓ અને તેની સાથે ફરો.”

પ્રવાસના અંથે વિદ્યાર્થીએને વાંચવા ગમે છે. એકબે વિદ્યાર્થીએને કાઠિયાવાડ સર્વસંગ્રહમાં અહુ મજા પડી. નકશા ઉપરથી એક ગામણું પસંદ કરે અને તેની હકીઃત સર્વસંગ્રહમાંથી વાંચે. એમ કટકાં યે જાણીતાં અન્નાણ્યાં ગામો વિષે માહિતી મળાવે. રવિલાઈનાં ચિત્રોએ અમદાવાદનો તેમને સારો પરિયય કરાયે. દરેકદરેક અગત્યના સ્થળનાં એવાં ચિત્ર-આલ્યમેં હોત તો સારું થાત. એક દિવસ રવિલાઈ આવ્યા અને તેમની પાસે

મદાસનાં દશ્યોની એક ફિલ્મ હતી તે મેં તેમને બતાવી. સિનેમા નુકસાન કરે છે તેમ બીજુ બાળુએ શિક્ષણ આપવાના એક શીખતી સાધન તરીકે પણ તે જિલ્લાં રહે છે. દૂરનાં દશ્યો આપેહું બતાવવાથી તેમનો બૌગેલિક રસ વધતો જાય છે. સિઝર્સ સિગારેટનો ગંભુરો મને હાથ લાગેલો. તેમાં દેશેદેશના માણુસોનાં ચિત્રો છે. એ ચિત્રો પણ જેવા મુક્કાં. મારો ઉંડેશ તેમને આખી દુનિયાનું જાન કરાવવાનો ન હતો; તેમને કંશું યાદ રહે નેવી મતલબ પણ નહોંતી. માત્ર તેમના મન ઉપર વસે કે દુનિયા આવડી મોટી છે, તેમાં ઘણું જેવાબાળુવા જેવું છે અને તેને જેવાને માટે આ સાખનો છે, એટલે બસ.

એક બીજુ રમત પણ કાઢેલી. તે રમતનું નામ ‘આદી આપણે મુસાફરીએ જરૂર એ.’ એવું રાખેલું. બાવનગરથી અમદાવાદ, દારકા, મુંબઈ, હિમાલય, વિલાયત એમ જોપડવા નીકળતા. પછી કુમ ઊપરથું, કર્દ કર્દ ગાડીઓમાં એસવું, કયાં કયાં ગાડીએ બહલવી, કયાં કયાં જેવા જેવું છે અને શું શું જેવા જેવું છે, કટલા દિવસમાં કટલો પ્રવાસ થણે, ડાને ડાને મળવું, શું શું ખરીદવું એનો વિચાર કરતા. ખરેખર. ખર્ચનો અડસટો બાંધતા અને શહેરોની ગાંધીઓ જેઠ્યે પ્રવાસમાં જેવાનાં સ્થળો નોંધી લેતા અને ભૂગોળોમાંથી વખ્યાતી ચીજે વાંચીને કર્દ લેવી તે નક્કી કરતા. સાચે જ મુસાફરીએ નીકળ્યા હોધ્યે તેવો બધી બાયતનો અભ્યાસ કરતા. આ અભ્યાસ ભૂગોળ સમજવાની રીતના એક નમૂના રૂપે કરાવતો. બાકીનું વિવાર્થાએ ઉપર છોડતો. કાઈ વાર દીવાસળીની પેટી કયાંથી આવી તેનું નકશા ઉપર પગેં કાઢતા; કાઈ વાર અહીં ઊગેલું રૂપદાયત જાય છે તે કથે રસ્તે જાય છે તે જાણુવા કદ્દપનામાં ઇની ગાંસડી ઉપર એસીને ચાલતા. કાઈ વાર બજારમાં ક્રવા જતા ને એક દુકાનમાં કયા કયા દેશો અને ગામો આવીને એહાં છે તેની તપાસ કરતા. કાઈ વાર

નહીંઓનાં નામોની તો કોઈ વાર પર્વતોનાં નામોની, કોઈ વાર દેશોનાં તો કોઈ વાર જહેરોનાં નામોની એમ ભૌગોલિક વરસુનાં અને ભૌગોલિક સ્થળોનાં નામોની અંતકડી ચલાવતા. ચિત્રકામમાં વિદ્વાર્થીઓ આડ ચીતરતા તેમ નક્ષાઓ ચીતરવાનો રસ લેતા અને પોતે ચીતરેલા નક્ષામાં પોતે જ જેયેલાં, વાંચેલાં તથા સાંબળેલાં ગામો, નહીંઓ ને હુંગરા પૂરતા; ને વધારે પૂરવા માટે નવાં ગામો ક્યાં છે અને ક્યાં આવ્યાં તે ભૂગોળમાંથી વાંચીને જેતા. આ રીતે અમારું ભૂગોળનું શિક્ષણ ચાલતું.

મારા શિક્ષકભાઈએ મને એક દિવસ કહ્યું: “ભાઈ, આ કામ તો તમારું. આર્ટી બધી લ્યાક્ટો અમારે ક્યાંથી જાણતી! આવી રીતે અમને ભૂગોળની વાતો કરતાં ન આવડે.”

મેં કહ્યું: “ભાઈ, એ પણ આવડે. આપણે જરા ઉદ્ઘોગ કરવો જોઈએ. આપણું માં ઉત્સાહ હોવો જોઈએ.”

. : ૫ :

વાર્ષિક પરીક્ષાનો વખત નજીક આવતો હતો. હું મારા કામનો હિસાબ લેતો એઠો હતો. હું ગણિતનો હિસાબ લેવા એઠો. આજ દિવસ સુધી મેં ગણિત હાથમાં લીધું જ ન હતું એમ નહિ પણ એની વાત આજે જ કરવાનું મન થાય છે. મેં જ્યારે મારા વર્ગના છોકરાઓને તેઓ ગણિતમાં ડેટલું જાણે છે તે તપાસવા માટે થઈ ગયેલા અભ્યાસમાંથી દાખલા લખાયા ત્યારે તેઓઓ ગણ્યી આપ્યા. પ્રથમ તો મને થયું કે આમાં તો અધ્યા બરાબર છે; અને સારું થયું કે જે વિષયમાં હું કાંઈ ખાસ નવું કરી બતાવી શકું તેમ નથી તે વિષયમાં વિદ્વાર્થીઓ ઢીક છે. પરંતુ ધીરથી મેં દાખલાની પાછળ રહેલો તર્ક પૂછ્યો, રીતનું કારણ પૂછ્યું ત્યારે અંધારું ભાલૂમ પણું. મને લાગ્યું કે વિદ્વાર્થીઓને સરવાળા, બાદબાકી વગેરે આવડે છે પરંતુ તે ગાન પોપટિયું અને યંત્રવત છે. હું વિચાર

કરવા લાગ્યો: “આતું શું કરવું ?” મને મુંઝનણું થવા લાગી. એક તો ગણ્યિતનો વિષય મને એટલો બધો પ્રિય નહિ; એના વિદ્યાખુમાં થતા હોયો હું સમજું પણ તે કેમ દૂર થાય તેની રોક્ક મેં કરેલી નહિ. આવે વખતે મારે કેમ કરવું એ પ્રશ્ન આકરો હતો. હું વિદ્યાધિકારી પાસે ગયો ને સીધેસીધું કહ્યું: “સાહેબ, આ ગણ્યિતના વિષયમાં હું કંઈ નવું કરી બતાવી આપી શકીશ નહિ. હા. છોકરાએને સારી રીતે સમજનીને તેમને ભણ્યાવીશ અને અભ્યાસક્રમ પૂરો કરાવીશ.”

વિદ્યાધિકારી કહે: “એમ કેમ ? શું, એમાં ફેરફાર જેવું કંઈ નથી ?”

મેં કહ્યું: “હા જી, છે. પણ તે ફેરફાર પાયામાંથી થવો જોઈએ. આગંકને ગણ્યતાં શીખવવાના સમયથી જ તેની સામે યોગ્ય પદ્ધતિ આપવા જોઈએ. ગણ્યિત એવો વિષય છે કે જે એક વાર તર્કથી તે મનમાં ન ફરયો તો કાયમને મારે તે પાંગળો જ રહે છે.”

વિદ્યાધિકારી કહે: “પણ તમે પહેલેથી જ માંડીને ગણ્યિત કરાવો તો ?”

મેં કહ્યું: “પણ તે મારે વખત ક્યાં છે ! વળો હોય તો પણ આ વિદ્યાર્થીઓ કે જેએને યંત્રવત્ત કામ કરવાની ટેવ પરી છે, જેએઓ ગણ્યિતમાં કારણ પૂછતા જ નથી ને ગણ્યે જ જાય છે, તેમને રસ્તે લાવવું આકરું છે—ધારું આકરું છે.”

વિદ્યાધિકારી કહે: “પણ ત્યારે આ છોકરાએનું ગણ્યિત.....”

મેં કહ્યું: “એમ તો હું બને તેઠણું સારું કરીશ; પણ મારે એટલું જ કહેવાનું કે એમાં જે કંઈ અખતરા શક્ય છે તે બતાવી ન જ શકાય.”

વિદ્યાધિકારીએ કહ્યું: “ધારો કે તમને પહેલેથી જ એક વર્ગ આપીએ તો તેના ઉપર તમે અખતરો કરો કે નહિ ?”

મેં કહું: “મારી એવી ઉમેદ તો છે જ કે ગણ્યતનો અખતરો હું એકદેથી જ કરું. પછી હું બધાને કદી શકું હે આ રીત સારી છે. મારા શિક્ષકભાઈએ ગણ્યતના વિષયમાં કંઈ ને કંઈ નવી પદ્ધતિ દાખલ કરવાનો શોખ છે તે જાણું છું. હું આવતે વર્ષે ને અખતરો કરવા ભાગ્યશાળી થાં તો અંદરથી કર ને હું એ વિષયમાં અખતરો કરીએ. મને લાગે છે કે માન્યોરી ગણ્યતપદ્ધતિ અચ્છી છે. તે સ્વાભાવિક છે. મેં તેનું વાચનમનન કર્યું છે પણ પૂરો અનુભવ લીધો નથી.”

વિદ્યાધિકારી કહે: “આવતે વર્ષે તમે આપણે ત્યાં ડેપ્યુટીનું, અધ્યાપનમંડિરના શિક્ષકનું અને ગણ્યતના અખતરા કરનારનું સ્થાન લ્યો તો?”

મેં જવાય આપ્યો: “એ તો હન્દિચ્છા; પરંતુ આ વખત માટે તો હું માગી લડું હું કે ગણ્યતના વિષયમાં હું કાંઈ ખાસ નવીન કરી અતાવી શકીશ નહિં.”

: ૬ :

વાર્ષિક પરીક્ષા નજીક આવી. હું મારી રીતે મારા વિદ્યાર્થીએ પાસે તેની તૈયારી કરાવવા લાગ્યો. વિદ્યાર્થીએ ખૂબ ઉત્સાહથી તૈયાર થઈ રહ્યા હતા. મારા મનને ખાનરી હતી કે મારા વિદ્યાર્થીએ પરીક્ષામાં સફળ નીવડશે.

પરીક્ષાનો દિવસ આવ્યો. અધિકારી સાહેબે સૌની પરીક્ષા લેવરાવી લીધી. આજે મારા વર્ગનો વારો હતો. અમારી શરત પ્રમાણે તેમણે ચોટે જ પરીક્ષા લેવાની હતી. તેમણે મને હસીને કહ્યું: “વાનું, મારે તમારા વર્ગની પરીક્ષા નથી લેવી. તમારા વર્ગના બધા વિદ્યાર્થીએ હું ઉપલા દોરણું ચડાવું છું.”

મેં કહું: “ના જુ, એમ ન બને. એમ કરવાથી કેટલાએક વિદ્યાર્થીએ ન્યાય નહિં મળે.”

વિદ્વાધિકારી કહે: “ગેઠલે ઉલ્લટો એમાં અન્યાય થશે? શી રીતે?”

મેં કહું: “જેઓ ચડાવવા જેવા નથી તેઓને મારાથી ઉપર ન ચડાવાય.”

વિદ્વાધિકારી કહે: “પણ મારી ખાતરી છે કે તમે બધાને અગ્રાર તૈયાર કર્યા છે. તમારું ભાષ્યનું મને મંજૂર છે.”

મેં કહું: “જો ખરું; પણ મારું ભાષ્યનું સૌમાં શું સરખું જિગે છે! ડાઈ ડાઈને તો એ સ્પર્શ્યું પણ નથી: એવા ને એવા ડ્રારા રહ્લા છે.”

વિદ્વાધિકારી કહે: “તો એનું શું કરવું તે તમે જ બતાવો.”

મેં કહું: “જોમાંના ડાઈ ડાઈને તો શાળા જ છાડાવવી જોઈએ. રધા વાળાંનો છેઅરો છતિલાસ લૂગોળ કે ગણિતનો જીવ નથી. તે આ શાળામાં મુંઝાય છે. પણ તે એવો ફરહો છે કે સો હળમનો શેડ થઈ મોડું હળમતખાતું જોડે. એને હળમતમાં કુશાગતા મેળવવા અને સલૂનોની બ્યવસ્થા શાખવા મુંઝઈ મોકલવો જોઈએ.”

વિદ્વાધિકારી કહે: “વારુ, ખીજ ડોણુ ડોણુ હે કે જેઓ શાળા માટે નાલાયક હોય?”

મેં કહું: “શાળા માટે નાલાયક છે એમ નહિ, પણ શાળા તેમને માટે નાલાયક છે. જે કામ માટે તેઓ લાયક છે તે કામ શાળા તેમને આપતી નથી.”

વિદ્વાધિકારી કહે: “વારુ એમ; પણ એવા ડોણુ ડોણુ છે?”

મેં કહું: “જીવજુશેડનો નમો પોલિસખાતા માટે લાયક છે. એને અખાડામાં દાખલ કરો. એને માટે થોડીઓક સુસાફરી સેટ જાઈને સારા ફાન્ડાર પાસે ને રહે ને થાડા કાયદો વાંચો. પાંચ વર્ષે ફુકડ જમાદાર થશે. અત્યારથી એ અરભી નિકાળ ઉપર જો જમાદારી કરી જ રહ્લો છે!”

વિદ્યાધિકારીએ કહ્યું: “વારુ, ભીજ કાચા કોણુ કોણુ છે?”

મેં કહ્યું: “જી, એ રીતે ભીજ નણુ જણુ કાચા છે. એને કું આ રજમાં મારી પાસે રાખીકા ને ઉપલા ઘોરણુ માટે તૈયાર કરીશ. પણ સાહેબ, આ આપણું નિશાળાનાં ઘોરણો અને અભ્યાસક્રમની સખ્તાઈની કંઈ ઉપાય નથી શું?”

વિદ્યાધિકારીએ કહ્યું: “એ વાત જવા હો. એમાં મારા હાથપગ ખંધાયેલા છે. એમ મેં તમને ધણી વાર કહેલું છે. વારુ ત્યારે તમારી પરીક્ષા પૂરી.”

મેં કહ્યું: “ના સાહેબ.”

વિદ્યાધિકારીએ કહ્યું: “જમાસિક જેમ કંઈક ગોડંયું લાગે છે. તમારી પદ્ધતિ હવે જાણવામાં આવી જઈ છે.”

: ૭ :

આજે શાળાનો મેળાવડો હતો. દર વર્ષે આવો મેળાવડો પરીક્ષા પછી થાય છે. જે વિદ્યાર્થીઓ તોંચે નંબરે પાસ થયા હોય તેમને આજે ધનામો આપવાનાં હતાં. ગામના શેઠશ્રીમંતો અને અમલદારો હાજર હતા. આ પ્રેસંગનો કાર્યક્રમ મને ગોડવલા સાહેબે કહ્યું હતું. મેં મારા જ વિદ્યાર્થીને તે કામ સોંપ્યું હતું. જે કંઈ કર્યું હતું તે મારી સૂચનાસલાહથી તેમણે જ કહ્યું હતું.

પ્રથમ દાંડિયારાસ શરૂ થયા. અધી ક્લાક સુધી તેણાએ ઝુકુઝુકાટી બોલાવી. પછી શરતોની રમત ચાલી-હોડવાની, ડેકવાની ત્રણ પગની, જમડિયની, ઝુરશીની વગેરે વગેરે. લોડા એકધ્યાનથી રમતો જોઈ રહ્યા હતા. રમતો પૂરી થઈ એટલે મૂડ અનુકરણું નાટક શરૂ કર્યું. ડોર્ચ ગામના સેઠતું, ડોર્ચ વિદ્યાધિકારીનું, ડોર્ચ ફોજદારનું, ડોર્ચ ફેસના કાંતું સુંદર અનુકરણું વિજાર્થીએ બતાવી

ગયા. ત્યાર પછી વિદ્યાર્થીઓ પોતે બનાવેલાં ચિત્રો લઈને આભ્યાં ને નથી. નમીને દરેક ગૃહસ્થને એક એક આપું આખો એઠોડો વિદ્યાર્થીઓનાં ચિત્રો જોવામાં રોકાઈ જયો હતો.

હવે છનામ આપવાનું છાર્ય હતું. દર વર્ષે ૧૨૫૦ ઇપિયા છનામના આપાતા હતા. હોશિયાર વિદ્યાર્થીઓ વચ્ચે તે વહેંચવાના હતા.

વિદ્યાધિકારી સાહેય બીલા થયા ને હમેશના રિવાજ મુજબ તેમણે એ બોલ કહેવા માંડ્યાઃ—

“આજના છનામનો મેળાવડો હું જુદી જતનો લેખું છું. આ મારી બાજુમાં બેઠેલા ભાઈએ મને છનામની બાધ્યતમાં નમે પાડ આપ્યો છે. આ વખતના ૧૨૫૦ ઇપિયાનાં હું જુદાં જુદાં છનામ નથી આપતો પણ એ નવે પાડ આપનાર લાઈને નામે શાળામાં એક વાચનાલય ઉઘાડું છું. દર વર્ષે આ છનામો વાચનાલયમાં જાય એવો હુકમ મેં ઉપરી સત્તા પાસેથી મેળવ્યો છે, એ જાણવાનાં મને આનંદ થાય છે. છનામ બ્યક્ટિગત આપવાથી વિદ્યાર્થીઓમાં અભિમાન અને નિરાશા થાય છે. છનામી રકમનો સૌને લાખ મળે એવી આ બ્યવસ્થા છે. મને છનામની નિરર્થકતા બતાવનાર અને આ સદ્ગ્રાંયોગ બતાવનાર ભાઈનો હું અહીં જહેરમાં આભાર માતું છું.

“આ પ્રસંગે જાણ્યાવી દહે કે આ ભાઈ મારી પાસે ચોઢ દોરખુનો અખતરો કરવા વર્ષ પૂર્વે આવેલા. હું તે વખતે તેમને વેહિયા ધારતો હતો. ‘આવા ધણું પડ્યા છે, ને કસોટીએ ચઢાવતાં આગી જશે.’ જોમ માની મેં તેમને પ્રયોગ કરવાની રજ આપી. મારે કહેલું નોઈએ કે મને તેમાં વિશ્વાસ ન હતો; પણ મારે ફણૂલ કરવું જોઈએ કે તેમણે સફળ પ્રયોગ કર્યો છે. તેમણે મારા વિચારામાં ફેરફાર કર્યો છે; અને મારા અંતરમાં મને સંભળાયું હું પ્રાથમિક શાળાની આ જૂની ધરેણો હવે જાંત લાવવો

[૧૧૨]

નોઈએ. અમારા જેવા શિક્ષણ અને અધિકારીઓએ હવે શાળ-
ખુલ્લીથી રજ લઈ આ નવી પેઢીના ડેળવણીના કલ્પક વિચારકેને
જગા આપવી નોઈએ.

“હું મારો આનંદ શી રીતે વ્યક્ત કરું! આ તેમના વર્ગના
વિદ્યાર્થીઓ સામે જુઓ. તેઓ કેટલા વ્યવસ્થિત, તંડુરસ્ત અને
આનંદી છે! તેમની શક્તિ કેટલી વધી છે તેનો હું સાક્ષી જું.
તેમનાં ભાબાપોનો એમના વિષેનો સંતોષ મેં વારંવાર સાંભળ્યો છે.”

વિદ્યાધિકારીનું ભાષણ પૂરું થયું. સૌ વિભેરાયા. હું બેર આવ્યો.



સ્વ. ગિજુભાઈના મનોરથો

મેં મારો એ સંકદ્ય જલેર કર્યો છે કે જેતું આ ખરું
સન્માન છે તે બાળકોને ચરણે આ ચેલી શોલે; તેમનું જ
સન્માન હજુ વધારવાને આ નાણાં વયરાય.

આટલા થોડાક હજર ઇપિયામાં આપણે બાળકો માટે શું
કરી શકોયે? લગલગ કંઈ જ નહિ. ગુજરાત ધારે તો તે
લાયો ડિપિયાથી બાલસન્માન કરી શકે; તેની શક્તિ ધણી
જખખર છે. ગુજરાતને આંગણે એકાદ બાલસન્માન મંહિર
હોય, એકાદ બાલશિક્ષણ વિદ્યાપીઠ હોય, એકાદ બાલશાન-
ક્રોષ હોય ત્યારે ગુજરાતે બાળકોનું સાચું સન્માન કર્યું
કહેનાશે. હું તો એમ સમજું છું કે આવી એકાદ કલ્પના
પાર પાડવાને માટે ગુજરાત તત્પર થઈ શકે અને મને
આપવામાં આવેલી આ સન્માન ચેલીની રકમ તો ગુજરાત
બાલસન્માનની કોઈ જખખર ચોજના ઉપાડે તેમાં મામૂલીમાં
મામૂલી રકમ તરીકે નોંધાય.

સૌ પ્રાંતોમાં ગુજરાત આજે આગળ છે, જીવંત છે.
એની આગળ આવા ગાંડાવેલા તરંગો મૂક્તાં મને જરા પણ
સકોય થતો નથી. ઈશ્વરની દ્વારા વડે મારા આવા તરંગો
ગુજરાતમાં કંઈક વાસ્તવિકિતાને પાંચા કે એટલે જીલ્ડું આ
મનોરથો રજૂ કરતાં મને આનંદ થાય છે.

(સન્માનચેલી અર્પણ સમારંભ પ્રસંગે આપેલા ભાષણુમાંથી)



